


માનવતા
ના
મૂળ સિદ્ધાન્તો



શ્રી સ્વામી શરાણનન્દ ની સંતવાણી

સંપર્ક
માનવ સેવા સંધ્યા
કૃન્દાવન-281129 (મથુરા)
દૂરભાષા : 0565-2456995, 2442778

માનવતાના મૂળ સિદ્ધાન્તો



મૂલ્ય ૨ ૦૦

પ્રકાશક :

માનવ સેવા સંઘ શાખા, રાજકોટ

✓
Yogeshbhai Modi
Mumbai
09820951911

જેન્ટીભાઈ ગોવાણી
રાજકોટ
મો. ૦૮૪૨૭૨ ૦૮૫૩૩
૦૨૮૧-૨૫૭૬૮૯૬

અક્ષર ભારતી
ભુજ
૦૨૮૭૨ - ૨૫૫૫૪૮

ઉકાભાઈ પટેલ
મહુવા
૦૮૮૨૪૮ ૪૭૨૭૩
૦૨૮૪૪ - ૨૨૨૮૭૮

www.swamisharnanandji.org

આ નું કે મણિ કા

વિષય	પૃષ્ઠ
વિગ્રહ	૩
ભૂમિકા	૪
પ્રાર્થના	૧
પ્રાર્થનાની વ્યાખ્યા	૨
પહેલો નિયમ	૧૦
બાંને નિયમ	૨૭
ત્રીને નિયમ	૩૦
ચોથો નિયમ	૪૦
પાચમો નિયમ	૪૮
છુટો નિયમ	૫૨
સાતમો નિયમ	૫૬
આઠમો નિયમ	૬૦
નવમો નિયમ	૬૬
દશમો નિયમ	૭૦
અગ્રીયારમો નિયમ	૭૩
બીજુ પ્રાર્થના	૭૭
પ્રાર્થનાની વ્યાખ્યા	૭૮

આપાંતર પ્રસિદ્ધ કરનારની

પ્રકાશકીય વિજ્ઞાપન

“માનવતાના મૂળ સિદ્ધાંતોની જીણ આવતિ સર્વાધિકાર માનવ સેવાસંવૈ (વંદ્ધવન), ચુરક્ષિત રાખીને ડાલેનું માર ૧૯૬૭માં પ્રસિદ્ધ કરેલ છે. તે મૂળ અંથ હિંદીમાં હેઠાથી, માનવસેવાસંધની રાજકોઈની શાખા તરફથી, ગુજરાતી વાંચકો સુખપૂર્વક વાંચો સમજ શકે તે માટે પ્રસિદ્ધ કરવાનો પ્રસ્તાવ શ્રી લગ્વાનદાસલાઈ પારેખનું રફ્થારી થતાં તેમની જ ઉદ્ઘારતા થી એ અંથનું લાખાં-તર કરીને પ્રસિદ્ધ કરવાનું હરાવવામાં આવ્યું. એ આપાંતર કરવાનું કાર્ય રાજકોઈ શાખાના એક સભ્યથી ભૂપતરાયાધ કુચે સહર્ષ સ્વીકાર્યું. શ્રી લગ્વાનદાસ ભાઈએ હિંદીમાં પ્રસિદ્ધ કરનાર વંદ્ધવનના મુખ્ય સંસ્થા પાસે અનુવાદ પ્રસિદ્ધ કરવાની અનુમતિ મેળવવા પત્ર લાયે. તેના પ્રલયુતર તરીકે સંસ્થાએ તા ૪-૫-૭ડના પત્રથી અનુમતિ આપતાં અને થયેલ આપાંતરની ગુજરાતી લેખીના પ્રત માનવસેવાસંધ ગુજરાત શાખા તરફથી માન્ય રખાતાં. આ ગુજરાતી અનુ-વાદ પ્રસિદ્ધ થાય છે તે રાજકોઈની શાખાનાં અહોભાગ્યનો વિપય છે.

જનતા સમક્ષ આ મૂહ્યવાન પુરિતકા રણુ કરતાં રાજકોઈની શાખા આનંદ અનુભવે છે.

રાજકોઈની શાખાના પ્રમુખ તથા ડેનિય સંસ્થાના આળવન સભ્યશ્રી લગ્વાનદાસભાઈના ઉત્સાહ પ્રેરણું અને ઉદ્ઘારતા તથા મુખ્યદીના સહયોગસ્થ શ્રી અંસલાલે આ અંથની અદીસે. પ્રત લેવાનું સ્વીકારવાથી આ પુરસ્તકની પ્રસિદ્ધિમાં ઘણી સહાયતા મળી છે જેની સહર્ષ નોંધ લેવી વધે છે.

શાખાના આળવન સભ્યશ્રી જોવરધનદાસભાઈ રાડોડે પત્રભ્યવહાર યલાવીને પ્રુદ્ધ તપાસવાની વ્યવસ્થા કરીને અને છાપકામ પણ નિર્દિષ્ટ સમાન થાય તે માટે તન મન ધનથી અમ લીધો છે તેની પણ નોંધ લેવી આવશ્યક છે.

પ્રકાશક

માનવ સેવા સંધાર
રાજકોઈ શાખા.

વસંતપંચમી ૨૦૩૦

તા. ૨૮-૧-૧૯૭૪

ભૂમિકા

સુધૃતી રચના વિચિત્ર છે. એકતામાં અનેકતા અને અનેકતા એકતાનું બહુ જ સુંદર સામંજસ્ય છે. માનવ જીવનમાં આવું સામંજસ્ય વળી વિશેપ અદ્ભુત રૂપે ઉપરિથિત છે. કેટલીક વાતોમાં, તો એવી ભિનતા જેવામાં આવે છે કે એ વક્તિ પણ એક સરળી નથી હોતી. આડતિ ઇચ્છિયોગ્યતા તેમજ પરિસ્થિતિના બેદ્ધી, દરેક વ્યક્તિ પોતાનાં વ્યક્તિત્વની જુદી રસમ હોય એવું અનુભવે છે, પરંતુ કેટલીક વાતોમાં તો તમામ મનુષ્યોમાં, એકતાજ છે, દાખલા તરીકે

૧ આડતિ, ઇચ્છિયોગ્યતા તેમજ પરિસ્થિતિએ એક ઝીજાંથી, ભલે ધ્યાંએ જૂદાં હોય, પરંતુ સુખદુઃખવાળી વર્તમાન પરિસ્થિતિમાં, સંતોષ કોઈ ને હોતો નથી. એ દાખિએ સર્વ એક છે.

૨ મૃત્યુના કથાથી, અસુભર્થતા તથા પરાધીન ખાંધાંની પીડાથી, અને નીરસતાના દુઃખથી સર્વ દુઃખો છે. દુઃખની નિવિસિ, કાયમની શાંતિ, સંપૂર્ણ સ્વાધીન પણ અને નિયમ નવો નવો રસ, એ સર્વની માંગણી હોય જ છે. એ માંગણી પૂરી ન પડે તાં સૂધી કાંઈક જીવનમાં ઓછાપણું હોય એ ભાવ અટો નથી. તથા એવું જણાય છે કે એ તુટિ નિર્મળ થાય એની સર્વવ્યક્તિની મૂલ્ય માંગણી યા અંતરેચા હોય છે. એ મૌલિક અંતરેચાની દાખિએ માનવ માત્ર એક છે.

૩ એ મૌલિક અંતરેચા સંતોષાય એવી શક્તિ, પ્રકૃતિની રચનાથી જ, માનવ માત્રને ભળોવી છે. અને એ અંતરેચા સંતોષવાતી શક્તિ અખ્યતાર કરવામાં સર્વમાનવો, સમાન રીતે સ્વાધીન જ છે.

૪ એ મૌલિક અંતરેચાની પૂર્તિ કરવાના કાર્યતું જે જીવન છે, તે જીવન પણ સર્વતું એકજ છે.

૫ એવી રીતે આપણે લોઈ શક્તિથું કે જીવનની કેટલીક બાબતોમાં, એકખીનથી જૂદાપણું વ્યક્તિઓમાં હોય છે. અને કેટલાંક પાસાંઓમાં આખી દુનિયાના વસનારાં માનવો સથળાં એક છે.

આકાર, ઇચ્છિયોગ્યતા, ભત, વિચાર, સંપ્રદાય, ભાષા અને રહેણીકરણીના ફેન્ફારથી જે બેદ્ભાવ ઉત્પત્ત છે, તેથી માનવ સમાજમાં ઠર્યાં, દૂષ અને પરસ્પર તકરારની સ્થિતિપેદી થાય છે. આંતી તકરાર અને તેથી થતા સંહતની પરિસ્થિતિ કોઈને સારી તો લાગતી નથી. તેમ છતાં બેદ્ભાવ રહેવાથી તકરારનો

અંત આવતો નથી. આવા બેદભાવનો અંત, મનુષ્યમાં જે મૌલિક પ્રેમભાવની એકતા ગુપ્ત રહેલી છે તેના વિકાસથી, શક્ય છે. તેથી માનવની એ મૌલિક, એકતાની આધારશિલા ઉપર માનવર્દ્ધનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે - માનવ દર્શનનું ટીક ટીક રાન થઈ જાય નારે અનેકતામાં એકતાનું રૂપણ દર્શન થાય છે. એમ થવથી બેદનો નાશ થાય છે. સંઘર્ષ અને અશાંતિ જે અમાનવતાનાં ચિહ્ન છે, એ અમાનવતાનો નાશ કરવો હોય તો, આપણે માનવજીવનમાં જે અનેક પ્રકારની લિનતા જણાય છે, તેમાં પણ મૌલિક એકતાનો અનુભવ કરીએ.

થીજુ વાત એ છે કે, વર્તમાન હૃદાખ અસંતોષ ઉત્પન્ન કરનાર વરસુ સ્થિતિને રણાને, તેમાંથી ઉત્તુતિ સાધવા માટે અને તે દારા આપણું ખરેખરું એકતાયુક્ત જીવા માટે સાધન નિર્માણનો વિચાર કરવાનો હોય ત્યારે હરેક મનુષ્યના, થીજાં મનુષ્યથી, લિન સ્થિતિ સંલેગ સ્વભાવ હોય છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. સાધકની વ્યક્તિગત ઇચ્છા, યોગ્યતા વગેરે વાતોનો વિચાર કરીને તેને માર્ગ દર્શન આપી શકાય. એમ થાય તો જ તેને જે સાધન બતાવ્યું હોય તે તેનાં જીવનમાં ઉત્તરી શકે અને તેને સંઝીતા મળે, તેવું સાધન તે કરી શકે. હાલમાં વ્યક્તિગત જીવનનું હૃદાખ અને તેમાં તેને જણાતો અસંતોષ મટ્ટતો નથી તેનું કારણ એ છે કે સાધક, પોતાની વર્તમાન પરિસ્થિતિનું નિદાન સમજ્યા શિવાય અને પોતાની મૌલિક અંતરેચ્છા શી છે અને પોતા ઉપર જરૂર્યની શી જવાબદારી છે તે સમજ્યા શિવાય પોતાને પ્રચ્છા થાય તેવી રીતે સાધન કરવા લાગી જાય છે. એમ કરવાથી પોતાનાં જીવનનો વિકાસ નથી થતો, એટલું જ નહિ પણ પોતે પસંદ કરેલી સાધનની રીત માટે આચાર બંધાઈ જાય છે. એમ થાય તે, વ્યક્તિને હાનિકારક છે.

હાલમાં સામાજિક જીવનમાં અશાંતિ લડાઈ અને દિસા ભટ્ટતી નથી તેનું કારણ એ છે કે આપણે હેખાતી અનેકતામાં એકતા જોઈ શકતા નથી. અનેક પ્રકારની વ્યક્તિ વ્યક્તિઓમાં લિનતા હોય તોપણ તેઓ વચ્ચે પ્રેમની એકતા ચાલુ રહી શકે છે, એ વાતનો અનુભવ આપણે કરતા નથી, એ વાતનો સ્વીકાર કરતા નથી અને એ શી રીતે બને તે સમજીતા નથી. આપણે ભૂતી જાઈએ છીએ કે હરેક માનવની મૌલિક અંતરેચ્છા તો એકજ હોય છે. સલજીવન એક છે, એ સલજીવન જીવા માટેના માનવતાના મૂળ સિદ્ધાંત સર્વને માટે એક સરખા છે. એ સિદ્ધાંત વ્યક્તિ અને સમાજની મુસ્કેલીઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં કારગત થઈ શકે.

માનવજીતિની ભૂગ્રહૂત એકતાના આધાર ઉપર, માનવર્થનરું પ્રતિપાદન થયું છે. એ હર્ષન (તત્ત્વજ્ઞાન) અનુસાર, માનવ, કામના, જિજ્ઞાસા અને પ્રિયતાની વાસનાઓનો પુનર (શબ્દ યુજરાતીમાં પણ વપરાય છે.)—ગાંઠડી છે. ખીજું કાંઈ તેમાં નથી. એ ગાંઠડીમાંથી કામનાઓનો નાશ થઈ રહે અને પ્રિયતા (પ્રેમ)નો આવિર્ભાવ — વિકાસ થઈ રહે. કામનાઓના નાશથી, દુઃખનો નાશ થાય અને સહાયની શાંતિ તેમજ આવશ્યક શક્તિનો વિકાસ થાય છે. જિજ્ઞાસાનીપૂર્તિથી —જ્ઞાનપ્રાપ્તિથી, દેહાલિમાનનો નાશ તથા વાસ્તવિક જીવનનો આધુનિક છે; (અર્થાત् જીવન જીવવાની ઇંચી લાથ લાગે છે.) અને પ્રિયતા — પ્રેમના વિકાસથી, નિત્ય નવા રસની સ્થિતિ ઉત્પત્ત થાય છે. — પરમાનંદની પ્રાપ્તિ થાય છે — એ નણે લક્ષ્યો સિદ્ધ કરવાની મનુષ્યની વાસ્તવિક અને અંતિમ મહેન્દ્રા હોય છે. સહાયની શાંતિથી જે શક્તિનો વિકાસ થાય છે તે શક્તિથી જીવનજગતને માટે ઉપયોગી થાય છે, વાસ્તવિક, એટલે હોવું જોઈએ, તેવું, માનવ જીવન જીવતાં આવડવાથી પોતાનું કલ્યાણ થાય છે; પરમાનંદમય—નિતનવ નવા રસમય જીવન જીવવાથી પ્રભુ-જગતપતિને માનવ જીવન ઉપયોગી થાય છે. એ માનવ જીવનની મહત્ત્વા છે. એવું જીવન, માનવ માત્ર (અનાથી શકે છે) મેળવી શકે છે.

હર્ષન (માનવ તત્ત્વજ્ઞાનના અનુભવિષ્ય જીવન બનાવવા માટે માનવતાના ભૂગ્રહૂતની સર્વ મનુષ્યને માટે એક સરખા છે. આ પુસ્તકમાં, એજ સિદ્ધાંતોનો ઉદ્દેશ અને તેની વિસ્તૃત સમજણું આપણને ભગણે એ સિદ્ધાંતોના આચરવાથી, પ્રત્યેક વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાસલ કરી શકે છે. એ સિદ્ધાંતો, માનવ જીવનના સર્વધૂંચેનું સમાધાન સિદ્ધ કરવાની આપી શકે તેવા છે. એટલું જ નહિ પણ આ “માનવતાનાભૂગ્રહૂતની સિદ્ધાંતોમા” માં, જે સિદ્ધાંતોનું જ્ઞાન આપણે ભગણે તે માનવતાના વિકાસ માટે આવશ્યક પણ છે. કેમકે એ સિદ્ધાંતો અનુસર્યા વિના, ડોધપણું વ્યક્તિનો વિકાસ થઈ શકશે નહિ. વળી તે સાથે, આ સિદ્ધાંતો, માનવ જીવનના મૌલિક તત્ત્વના આધાર ઉપર રચાયદ્વારા હોવાથી, તે સિદ્ધાંતો સર્વમાન્ય પણ છે. ડોધનો, એ સિદ્ધાંતોથી વિરોધ, ડોધ પ્રકારે નથી ધર્મ, સંપ્રદાય, ધર્મજમ (Ism) અથવા ડોધ આસ તત્ત્વજ્ઞાનની પ્રણાલિકાની ભર્યાદાઓથી સ્વતંત્ર એવા આ સિદ્ધાંતો છે — તેથી તેનું આગહપૂર્વક સર્વર્થન કે વિરોધ ડોધએ કરવા પણ નથી.

હિંદુ, મુસ્લિમાન, ધર્મસાધ, ધર્મજવાદી કે અનીશ્વરવાદી, બૌતિકવાદી કે અધ્યાત્મમવાદી, ગમે તે ધર્મ કે Ism ધર્મજમનો માનવ લાલે હોય તે આ સિદ્ધાંતો પ્રમાણે આચરણું કરશે તો તે પોનામાં માનવતાનો વિકાસ સાધી શકશે. એવી

માનવતા વિકસાયા શિવાય. કોઈના પણ જીવનમાં સૌંદર્ય પ્રકરણે નહિ. માનવતા સંપૂર્ણ વિકસિત થાય તો માનવમાત્રનું જીવન આદર્શ - અનુકરણીય થધ જય - એટલું જ નહિ. હાલના વૈતાનિક વિકાસના પ્રભાવથી અંનાઈ ગેલ આધુનિક ચુગનો ખુદ્દિવાદી વ્યક્તિ પણ માનવતાના નિર્દેશેવ માર્ગ ચાલશે તો રાહત અનુભવશે.

આ સિદ્ધાંતો એવા છે કે, કોઈ વ્યક્તિ કે કોઈ ધર્મવાળા કે Ism ધર્મમના અનુયાયી, એમ આયહપૂર્વક નહિ કહી શકે કે તે અમૃક (જુદા) ભત્પંથના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો તો માનવમાત્રના છે - જેમ આ સિદ્ધાંતો પ્રત્યે કોઈનો, પર સિદ્ધાંત હોવા વિશેનો આયહ રહી શકતો નથી તેમ તે સિદ્ધાંતો કોઈ ત્યાન્ય હોવાનું પણ કહી શકે તેમ નથી. એ સિદ્ધાંતને તો પૃથ્વીની ઉપમા આપી શકાય - વસુધરા જેમ સર્વ પ્રકારના છોડવાઓને પોતાનો આધાર આપીને, તેનો તેની આગવી પ્રકૃતિ પ્રમાણે વિકાસ પોષે છે, તેજ પ્રકારે આ સિદ્ધાંતોથી જેમ માનવતા પોશાય તેમ સર્વ ભત, સંપ્રદાય, ધર્મ ને ધર્મોના અનુયાયીઓને પોતપોતાની સફળતાનો અનુભવ થશે. તેથી “માનવતાના મૂળ સિદ્ધાંતો” નું પુસ્તક માનવમાત્રને મારે કલ્યાણકારી છે.

પ્રશ્નુત પુસ્તકમાં અગીયાર નિયમો આપવામા આવ્યા છે. તે જીવનના સર્વાંગી વિકાસમાં સહાયક છે - પહેલા ચાર, આઠમો, નવમો અને અગ્યારમો. આંતરિક જીવન સંબંધી છે, અને પાંચમો, છ્ટો, સાતમો અને દશમો બાણી-જીવનને લગતા છે. એ પ્રકાર એ નિયમો, શરીરિક, માનસિક, આંતરિક, અને સામાજિક જીવનનો સાંગોપાંગ વિકાસ કરીને, સાધકને વાસ્તવિક (જેવું હોવું જોઈએ તેવું-સલ્ય) જીવનનો યોગ કરાવવા સમર્થ બને છે.

ઇલાહાયાદ
માનવ સેવા સંધ

વિનીતા
હેવકી



मानव सेवा संघ के अन्य प्रकाशन अक्टूबर १९६७

हिन्दी	पृष्ठ संख्या	भूल्य
१ सन्त समागम भाग-१	२५७	१-५०
२ सन्त समागम भाग-२ दोनों भग इक साथसजिलद	३५७	२-००
३ मानव की मांग	२४६	२-००
४ जीवन दर्शन (द्वितीय संस्करण)	३४१	२-५०
५ चित्त शुद्धि (द्वितीय संस्करण)	४८०	४-००
६ साधन तत्व (सजिलद)	१०४	१-२५
७ सत्संग और साधन	६६	१-००
८ जीवन पथ	१४०	१-२५
९ मानवता के भूल सिद्धान्त	१२२	०-५०
१० दर्शन और नीति	१४४	१-५०
११ दुःख का प्रभाव	११६	१-२५
१२ मानव सेवा संघ परिचय (तृतीय संस्करण)	३२	०-१०
१३ मूक सत्संग और नित्य योग	२०९	१-७५
१४ मानव दर्शन	१६०	१-७५
१५ मंगलमय विधान	७०	०-७५
१६ साधन निधि (प्रथम संस्करण)	१६०	सदुपयोग
ગુજરાતી		
१ માનવની માંગ	३२०	२-००
२ માનવ સેવા સંઘ પરિચય અને વ્યાખ્યા	१०८	०-३८
३ સાધન નિધિ	८०	સદુપયોગ



प्रार्थना

मेरे नाथ !

आप अपनी सुधामयी, सर्वसमर्थ पतितपावनी,
अहैतुकी कृपासे, दुःखी प्राणियोंके हृदयमें त्यागका बल
एवम् सुखी प्राणियोंके हृदयमें सेवाका बल प्रदान करें,
जिससे वे सुख-दुःखके बंधनसे मुक्त हों, आपके पवित्र
ग्रेमका आस्वादन कर कृतकृत्य हो जाय ।

ॐ आनंद ! ॐ आनंद ! ! ॐ आनंद ! ! !

(प्रार्थना साधकके विकासका अचूक उपाय है ।)

प्रार्थना

मेरे नाथ
 आप अपनी
 सुधामयी,
 सर्व समर्थ,
 पतितपावनी,
 अहैतुकी कृपासे;
 दुःखी प्राणियों के हृदयमें
 त्याग का बल,

एवम्

सुखी प्राणियों के हृदयमें
 सेवा का बल,
 प्रदान करें;
 जिससे वे,
 सुख दुःख के बंधनसे
 मुक्त हो,
 आपके
 पवित्र प्रेमका,
 आस्वादन कर,
 कृत कृत्य हो जावें।

FIRST PRAYER

My Lord,

By Thine Nectarine (सुधामयी),

Almighty, purifying

and motiveless Grace,

Grant the strength of renunciation (of desires)

to those afflicted with sorrow,

and the strength of rendering

selfless service

to those who are happy,

So that they may be released

from the bondage of happiness and sorrow,

and become blessed by

Divine Love.

SECOND PRAYER

My Lord,

By Thine Nectarine (सुधामयी),

Almighty, purifying

and motiveless Grace,

Grant all mankind the power to act

in accordance with one's Vivek,

and to make proper use of one's strength.

And Oh Ocean of Compassion,

by Thine boundless Grace

Speedily destroy attachment and hatred.

Let the life of all be full of

Service, Renunciation and Love.

પ્રાર્થનાની વ્યાખ્યા

પ્રાર્થના પ્રાણીનો સત્ય પોકાર છે. જેમ જેમ મનુષ્યને પોતાની નિર્ભળતાઓનો પરિચય થતો જય છે, તેમ તેમ સ્વાભાવિક રીતે જ પ્રાર્થના થવા લાગે છે. પોતાની નિર્ભળતાનું જ્ઞાન, વિકાસનું મૂળ છે. કેમ કે વર્તમાનની આવશ્યકતાથી જ અવિષ્યનું અંધારણું થાય છે. આવશ્યકતા એની હોય છે. કે જેનાથી જતીય તથા સ્વરૂપની એકતા હોય પરંતુ માનેલી જૂદાઈ હોય છે. તે વસ્તુથી મનુષ્ય પોતાના મનથી બિનાતા કુટ્ઠી લે છે. અને તેથી મનુષ્યમાં પ્રમાદ આવે છે. અને તે કારણે પ્રાણી અનેક નિર્ભળતાઓમાં સપદાઈ જય છે. જેમ જેમ નિર્ભળતાથી થયેલી વેહના વધતી જય છે તેમ તેમ તે નિર્ભળતાઓનો અંત લાવવા માટે, સ્વાભાવિક રીતે જ પ્રાર્થના થવા લાગે છે. પ્રાર્થના જે વસ્તુ પ્રાપ્ત કરવાનું અનિવાર્ય હોય તેને માટે જ થાય છે, એ દષ્ટિએ પ્રાર્થના સઝળતાની દૂંચી છે, પ્રાણીમાત્રને પ્રાર્થના સ્વભાવથી જ ધૃપું છે. દાર્શનિક દષ્ટિ તથા માન્યતાઓમાં લેદ હોવા છતાં સર્વની પ્રાર્થના એક જ ખાખતની હોય છે. કારણું કે સ્વાભાવિક આવશ્યકતા સર્વની એક જ હોય છે અને અસ્વાભાવિક ધય્યાઓ અનેક હોય છે. પ્રાર્થનાનું ઉત્પત્તિસ્થાન, સ્વાભાવિક આવશ્યકતા છે, જે બીજરૂપે સર્વ પ્રાણીઓમાં એક જ હોય છે. અસ્વાભાવિક ધય્યાઓમાં લેદ હોવાથી, માન્યતાઓમાં લેદ લલે હોય પણ સ્વાભાવિક આવશ્યકતા એક હોવાથી, માનવમાત્રનું જીવન એકસરણું હોય છે, એ દષ્ટિએ માનવ સેવા સંઘની પ્રાર્થના માનવ માત્રને માટે હિતકર છે—તે પ્રાર્થનાનો પ્રથમ અંશ છે “મેરે નાથ”.

‘મેરે’ અને ‘નાથ’ એ શાફ્ટેથી જે ધ્વનિ નીકળે છે, તે પ્રાર્થના કરનારમાં પ્રેમ, નિશ્ચિયતા અને નિર્શિતપણું. જાગ્રત કરે છે, કારણું કે ‘મેરે’ એ શાફ્ટમાં (જેને સંઝોધન કરાયેલ છે) આત્મીયતાનું સૂચન થાય છે, આત્મીયતા પ્રિયતા (પ્રેમ)ની માતા છે. પ્રિયતા સ્વાભાવિક રીતે જ

રસડુપ છે. તેથી પ્રિયતા નીરસતાનો નાશ કરવામાં સમર્થ છે. નીરસતાનો અંત થતાં જ, જુદાપણું મટી જાય છે. તેમ થતાં, શ્રોબ અને કોધ વગેરે વિકારનો અંત આવે છે. શ્રોબ મટવાથી પ્રાપ્ત પરિસ્થિતિનો સહુપચોગ થવા લાગે છે, અને કોધ મટી જતાં વિસ્તૃતિ મટી જઈને, કર્તવ્યપરાયણતા સ્વતઃ સિદ્ધ થાય છે. ‘નાથ’ તેને કહેવાય જે સમર્થ અને રક્ષક હોય—એવા નાથના આહાનથી નિશ્ચિંતપણું અને નિર્ભયપણું સ્વાભાવિક રીતે જ પ્રગટ થાય છે. નિશ્ચિંતપણું નકામી ચિંતા અને નિરાશાનો અંત લાવે છે. અને નિર્ભયતા પ્રાપ્ત પરિસ્થિતિનો સહુપચોગ કરવાનું બળ આપવા સમર્થ છે. તેથી ‘મેરે નાથ’ એ પહેના અર્થને વિચાર સરૂરતાં જ, નિરાશામાં આશા અને હાર્દિને હેઠી ગયેલને, સર્જણતા મળવાનો ઉત્સાહ પેદા થાય છે. એ રીતે જીવન એક નવીન ઉત્કંઠા અને ઉત્સાહથી પરિપૂર્ણ થઈ જાય છે.

આ પ્રાર્થનામાં, પ્રાર્થના કરનાર પોતાની મૂળ નિર્ભળતાઓને જાણી લઈને જેની પ્રાર્થના કરે છે, તેની કૃપાશક્તિના મહિમા ઉપર શ્રદ્ધા ધરાવે છે. સુખયત્વે પણ મૂળ નિર્ભળતાઓ હોય છે. (૧) પ્રાણીમાત્રમાં સ્વાભાવિક રીતે જ જીવનની ઈચ્છા અને મૃત્યુનો લય હોય છે. (૨) પોતાની અસમર્થતાનું પ્રાણીમાત્રને જ્ઞાન હોય છે તેથી સામર્થ્યવાન બનવાની સર્વને ઈચ્છા રહે છે. (૩) પોતે કરેલાં પાપમાંથી ધૂટવાની એટદે ભૂતકાળમાં કરેલી ભૂલોથી થયેલી અશુદ્ધમાંથી ધૂરી, પવિત્રતા પ્રાપ્ત કરવાની પણ સ્વાભાવિક ઈચ્છા સૌને હોય છે. જેની પ્રાર્થના કરવામાં આવે તેના મહિમામાં શ્રદ્ધા હોય એ જરૂરનું છે એવો નિયમ છે. જે જતની નિર્ભળતાની પીડા હોય તે ફર કરવા માટેની તેવી જ પ્રાર્થના થાય છે અને તે અનુસાર જેની પ્રાર્થના કરતા હોઈએ તેના ગુણોની સ્તુતિ સ્વાભાવિક રીતે જ થાય છે. આમ હોવાથી આ પ્રાર્થનામાં, જેની પ્રાર્થના કરવામાં આવી છે તેનીકૃત પાશક્તિના મહિમાનાં ચાર વિશેષજ્ઞાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે, ‘સુધામથી’, ‘સર્વસમર્થી’, ‘પતિતપાવની’ અને ‘અહેતુકી’ એ વિશેષજ્ઞો.

સુધામયી (કૃપા) હોવાથી મૃત્યુના લયનો નાશ થશે અને સર્વ-
સમર્થ (કૃપા) હોવાથી પ્રાર્થના કરનારની અસમર્થતા ભરી જશે એવી
શક્તા હોય છે. “પતિતપાવની” (કૃપા) હોવાથી લક્તને પોતાની પવિત્રતા
મેળવવાનો અને ‘અહૈતુકી’ (કૃપા) કહેવાથી, હરેક પ્રાણી એ કૃપાશક્તિના
અધિકારી છે એવો લરોસો સૂચવાય છે. નિર્ણયતાએ ત્રણ પ્રકારની અને
જેની પ્રાર્થના થાય છે તેનાં ચાર વિશેષણો છે—એ દૃષ્ટિએ લક્ત અને
તેના લગવાનની વચ્ચે, વગર સંકોચની એકતાનો સંબંધ બની જય છે,
અર્થાતું પ્રાર્થના કરનાર બનીને આપણે સ્વાભાવિક આવશ્યકતાની પૂર્તિ
અને અસ્વાભાવિક ધર્માચ્છેનો ત્યાગ કરી શકીએ છીએ—એ દૃષ્ટિએ, ઉપર
જણુવેદી પ્રાર્થના હરેક માનવ વિકાસનું અચૂક સાધન છે. આ પ્રાર્થનામાં
એ વાતનું વિશેષ ધ્યાન રખાયું છે કે તે કોઈ વ્યક્તિ, પક્ષ, સંપ્રદાય,
દેશ, જલ્દિ કે વર્ગવિશેષ વગેરેને માટે સ્વયબામાં આવી નથી; વિશ્વની
એકતા ધ્યાનમાં રાખીને, પ્રાણીમાત્રના હિતને માટે તે બનાવાઈ છે. બીજુ
વાત આ પ્રાર્થનામાં એ છે કે પ્રકૃતિનિયમ અનુસાર જે આપોઆપ
થયા કરે છે તેનો વિરોધ કરવામાં આવ્યો નથી, એટલે કે જે પરિસ્થિતિ
હોય તેનો સહદ્યોગ કરવા માટેની એ પ્રાર્થના છે—કોઈ નહિ અસ્તિત્વમાં
હોય એવી પરિસ્થિતિ પેઢા કરવાની તેમાં માગણી નથી. સર્વ કોઈ એટલું
તો માન્ય કરે છે કે હરેક સ્થિતિ સંનેહ કે પરિસ્થિતિ સુખ કે દુખના
સંયોગવાળી હોય છે. પ્રત્યેક પ્રાણી કોઈ ને કોઈ પ્રકારે થાડે ઘણે અંશે
સુખી અને કોઈ કોઈ અંશે દુખી હોય છે. અથવા એમ પણ કહી શકાય
કે વર્તમાન પરિસ્થિતિનું પરિવર્તન થયા કરતું જીવન, સુખ અને દુઃખવાળું
હોય છે. આટલું સૌને સ્વીકાર્ય થશે કે જેમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયા કરે,
તેમાં નિત્યસ્થિતિ હોતી નથી. ફેરફારમય સ્થિતિનું સ્વતંત્ર અસ્તિત્વ પણ
હોતું નથી. જેનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય તેને જીવન માનવામાં આપણી
વિવેકણુદ્ધિ જ વિરોધ કરે છે. એટલું માત્ર સ્વીકારી શકાય કે પ્રાપ્ત પરિ-
સ્થિતિ એ માનવનું જીવન સત્ય ન હોવા છતાં સત્ય જીવનની સાધન-

સામગ્રી એવહેતા પ્રવાહમાંથી જરૂર ભળે છે. એ દિશિએ સુખ તથા હુઃખની પરિસ્થિતિ પ્રાપ્ત થાય તેનો સહૃપદોગ કરી દેવો. એ માનવમાત્રનું કર્તવ્ય છે. એ કર્તવ્યપરાયણુતા આચરણમાં લાવવા માટે, આ પ્રાર્થનામાં હુઃખી પ્રાર્થનામોના હૃદયમાં ત્યાગનું અને સુખી પ્રાર્થનામોના હૃદયમાં સેવાનું બળ પ્રહાન કરવાની, તે આપણો નાથ કે જેની સુધામયી, સર્વસમર્થ, પતિતપાવની, અહેતુકી કૃપા છે તેને માટેની પ્રાર્થના કરવામાં આવી છે.

જે આપણે ગંભીરતાથી વિચાર કરશું તો આપણને આતરી થશે કે કોઈપણ હુઃખી માણુસ જ્યાં સુધી તેનામાં ત્યાગનું બળ ન આવે ત્યાં સુધી હુઃખના લયથી ધૂઠી શકતો નથી; અને કોઈપણ સુખી મનુષ્ય, જ્યાં સુધી તેનામાં સેવાનું બળ વિકસે નહિ ત્યાં સુધી સુખલોગની આસક્તિથી સુકલ થઈ શકતો નથી. એવો નિયમ છે કે હુઃખના લય અને સુખની ગુલામીથી સુકલ થયા સિવાય, મનુષ્યોમાં પરસ્પર એકતા થતી નથી એટલે કે સમસ્ત વિશ્વમાં એક જીવન છે, એ અનુભવ થઈ શકતો નથી. તેમ થયા સિવાય કલહનો અંત આવવાનો સંભવ નથી. એટલે કે શાંતિની સ્થાપના, જ્યાં સુધી સુખી માનવો અને હુઃખી માનવોમાં લેદલાવનો નાશ ન થાય, ત્યાં સુધી થઈ શકશે નહિ. હવે કોઈ એમ પ્રક્રિયા કરે કે બિચારો હુઃખી શું ત્યાગ કરી શકે? તેનો જવાબ એ આપી શકાય કે જે વસ્તુ કે પરિસ્થિતિના ન હોવાથી, હુઃખી માણુસ હુઃખ અનુભવે છે, તે વસ્તુ કે પરિસ્થિતિના વાસનાનો ત્યાગ કરવામાં આવે તો લયંકરમાં લયંકર હુઃખ આપોઆપ શાંત થઈ જય. તેમ થવાથી સુખહુઃખ જ્યાં લાગે જ નહિ, તેવા જીવનમાં પ્રવેશ થાય છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે ત્યાગથી ઉદ્ધારતા અને ઉદ્ધારતાથી ત્યાગની પુણિ થાય છે. કોઈ પણ સુખી મનુષ્ય, પરહુખથી હુઃખ અનુભવ્યા સિવાય કરુણિત થતો નથી, અને કરુણિત થયા સિવાય સુખલોગની રૂચિનો નાશ થતો નથી. કરુણાનો રસ, સુખલોગની રૂચિ કરતાં ઘણો વધારે ભધુર અને સરસ છે. સુખલોગની રૂચિનો નાશ

થાય તો એ સુખી માનનારે મતુષ્ય સુખની ગુલામીમાં બિચારે અની ગયેકો તેમાંથી મુક્ત થઈ જય છે. એ દણિએ એવું નિવિવાદ કિંદુ થાય છે કે હુઃખીનું કર્તવ્ય ત્યાગ છે અને સુખીનું કર્તવ્ય સેવા છે. સર્વાશમાં તો કોઈ વ્યક્તિ કેવળ સુખી કે કેવળ હુઃખી હોય નથી. તેથી કે વિલાગનું હુઃખીને હુઃખ હોય તે ભાગનો વ્યક્તિએ ત્યાગ કરવો રહ્યો; અને જે ટકે અંશો સુખી હોય તે અંશમાં સેવાનું કર્તવ્ય આચરવાથી, સુખહુઃખ જ્યાં પહેંચાયતાં નથી તેવું જીવન જીવનનો અધિકારી માનવ માત્ર થઈ શકે છે.

સમસ્ત વિશ્વ એક જીવન છે. આ ભૌતિક તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠ છે. પ્રાણીમાત્રનાં વર્તમાન જીવનમાં કુખુખ છે. એ માનવમાત્રનો અનુભવ છે. સુખહુઃખના સહૃદ્યોગમાં જ કર્તવ્યપરાયણુતાનો સીમાડો છે. એ દણિએ પ્રાર્થનાના કે ભાગમાં પ્રાણીમાત્રને સેવા અને ત્યાગનું સામર્થ્ય પ્રદાન કરવાનું કહેવામાં આવ્યું છે તે ભૌતિક વિકાસની સીમા પૂરી થાય તેનું છેલ્લું નિશાન છે. એ જ વિશ્વશાંતિનો સુગમ ઉપાય છે.

પ્રાર્થનાના કે ભાગમાં પ્રાણીમાત્રને સુખહુખ્યી મુક્ત થવાની વાત કહી છે તે અધ્યાત્મમવાદનું સીમાચિહ્ન છે, કારણ કે સુખની ગુલામી અને હુખના ભયથી મુક્ત થતાં જ, વ્યક્તિ દેહાલિમાન રહીત થઈ શકે છે. દેહાલિમાન ગળી જય એ જ પરો અધ્યાત્મમવાદ છે. કારણ કે સર્વ વસ્તુ, અવસ્થા અને પરિસ્થિતિથી પર થયા પછી કે જીવનમાં પ્રવેશ થાય છે તે જ અધ્યાત્મ જીવન છે. દેહાલિમાનના નાશ સિવાય, કિયા, ચિંતા અને પરિસ્થિતિ વગેરે અવસ્થાઓથી અસંગ અનવાનો સંભવ નથી, અને સુખની વાસના તથા હુખનો જય, જ્યાં સુધી રહે, ત્યાં સુધી દેહાલિમાનનો નાશ થતો નથી. એ રીતે જેતાં ઉક્ત પ્રાર્થનામાં, પ્રાણીઓનાં સુખહુખનાં અંધનથી મુક્તિની પ્રાર્થના કરવામાં આવી છે. એ નિયમ છે કે દેહાલિમાન છૂટે તો નિર્વાસના આપોઆપ સિદ્ધ થઈ જય છે. વાસનાઓનો અંત થતાં જ લેહખુદ્ધિ ટકી નથી. લેદખુદ્ધિનો નાશ થાય ત્યારે પરમ ગ્રેમનું

હર્ષન આપોઆપ થાય છે. એ આસ્તિકવાહનું વાસ્તવિક રીતે તત્ત્વ છે. તેથી પ્રાર્થનાના અંતે પવિત્ર પ્રેમનું આસ્ત્વાદન કરી કૃતકૃત્ય થવાની પ્રાર્થના કરવામાં આવી છે. પ્રેમ તો પવિત્ર જ હોય છે. પરંતુ પવિત્ર એ વિશેષણું એટલા માટે લગાડવામાં આવ્યું છે કે તે વિશેષણુંથી પ્રેમની ઉચ્ચતમ ટોચનું એ પ્રાર્થનામાં કહેવાયું છે તે સ્પષ્ટ સમજથી. વાસ્તવિક રીતે તો પ્રેમમાં ઊણુપ કે પૂર્ણતા કહેવાનો અવકાશ હોતો નથી. કામનાઓની નિવૃત્તિ અને પૂર્તિ જિજાસાની થાય છે. પ્રેમની તો પ્રાસિ ન થાય, પ્રેમની પ્રાસિમાં જ જીવનની પૂર્ણતા છે. કેમકે સ્વાભાવિક રીતે જ પ્રેમ સર્વને ગમે છે. એથું જ નહિ પ્રેમમાં તો પ્રેમની દહ્ખાણું થાય છે. પ્રેમનો બહલો તો પ્રેમમાં જ હોય છે, બીજા કશામાં નહિ. એ રીતે જેતાં પ્રેમી અને પ્રેમાસ્પદનો જ પરસ્પર પ્રેમી અને પ્રેમાસ્પદ સંબંધ છે. સ્વભાવથી જ પ્રેમ, હિંય, ચિન્મય અને રસદ્યપ છે. પવિત્ર પ્રેમનો આવિર્ભાવ થતાં, પ્રેમી ઉનમન થઈ જાય છે. એટલે કે તેનું મન તેની પાસે રહેતું જ નથી. પ્રેમાસ્પદના મનની ઈચ્છા એ જ એના મનની ઈચ્છા અની જાય છે. પ્રેમાસ્પદનો રસ તે જ તેનો રસ છે. વિશેષામાં કે મેળાપમાં, અંને દશામાં પ્રેમની ઉત્તરોત્તર વૃદ્ધિ જ થયા કરે છે. ઊણુપ આવતી નથી. પ્રેમમાં ફરસણું કે લેહલાવ રહેતો નથી. એ કારણે પ્રેમની પ્રાણિતમાં જીવનની પૂર્ણતા રહેલી છે. એ આસ્તિક તત્ત્વ-જ્ઞાનની પર કાઢા છે.

પ્રાર્થનાના પ્રથમ અંશમાં, જે શક્તિની કૃપા સુખામયી, સર્વ-સમર્થ, પતિતપાવની અને અહેતુકી છે, તેની સાથે આત્મીયતા તથા નિત્ય સંબંધનો સ્વીકાર કરવામાં આવ્યો છે—તેના બીજા અંશમાં, પ્રાણી-માત્રમાં એકતાનો સ્વીકાર થઈ, સુખીઓમાં સેવાના અને હુણીઓમાં ત્યાગના અળની વાત કહેવામાં આવી છે. તે અરી રીતે કર્તાબ્યપરાયણુતા (નો ઉલ્લેખ ઉદેશ) છે. બીજા, પ્રાર્થનાના અંશમાં, સુખલાલસાની ગુલામી અને હુણના જયથી સુકૃત થવાની વાત કહી છે, તે આધ્યાત્મિકતાની વાસ્તવિક રીતે તો (ઉલ્લેખ) છે—ચોથા ભાગમાં પ્રાર્થના પવિત્ર પ્રેમની યાચના

કરી, કૃતકૃત્ય થવાની પ્રાર્થના કરવામાં આવી છે. તે આસ્તિકવાહની પરાક્રમા છે. આ પ્રાર્થનામાં, ચોકસતા રૂપે, પોતાને માટે કંઈ માગણી કરવામાં આવી નથી. અર્થાતું એમ કહેવાથી કે વિશ્વ જીવનથી અલગ કોઈ વ્યક્તિગત જીવન નથી એટલે કે શરીર અને વિશ્વ, વ્યક્તિ અને સમાજ, પ્રેરી અને પ્રેમાસ્પદ વચ્ચેની એકતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

હવે જે કોઈ એમ કહે કે પ્રાર્થના કરવા માત્રથી, સમાનતા ક્યાંથી થઈ શકે? તો એ કહેવાનું ઉપરિથિત થાય છે કે વિકાસની દર્શિબે, એવો નિયમ છે કે ભાવનાઓ પ્રમાણે કર્મ અને કર્મ પ્રમાણે પરિસ્થિતિની ર્યાના થાય છે—તેથી પ્રાર્થનામાં કરેલી પવિત્ર ભાવનાઓથી, કર્મની શુદ્ધિ અને કર્મની શુદ્ધિથી અનુકૂળ પરિસ્થિતિ અવશ્ય થઈ શકે છે. પરંતુ પવિત્ર ભાવનાઓ એતનવંતી અને દઢતાયુક્ત બનાવવાને માટે પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર, યથાશક્તિ કર્તવ્યપાલન કરવાનું અનિવાર્ય છે. એવો નિયમ છે કે જ્ઞાન, ભાવ તથા કર્મની એકતા થાય તો જ્ઞાન પ્રમાણે જીવન આપોઆપ બની જય છે. તેથી આ પ્રાર્થનામાં સર્વ સમસ્યાઓનો ઉકેલ થઈ જય તેવું સામર્થ્ય છે. પરંતુ આ રહસ્ય તેઓ જ પામી શકે છે કે જેએ વિકલ્પરહિત વિશ્વાસના આધાર ઉપર પ્રાર્થનાની સત્તાનો સ્વીકાર કરે છે અને પોતાના વિવેકના પ્રકાશમાં પોતાની નિર્ણયતાઓને જાળી શકે છે. પોતાની નિર્ણયતાનું જ્ઞાન અને અનંતના મહિમામાં શ્રદ્ધા એ બંનેના ધોગથી પ્રાર્થનાની સિદ્ધિ આપોઆપ થઈ જય છે—હવે જે કોઈ એમ કહે કે જેને અનંતના મહિમામાં સ્વભાવથી જ શ્રદ્ધા ન હોય, તે પ્રાર્થના કેવી રીતે કરી શકે, તેનો જવાબ એ છે કે પોતાની નિર્ણયતાનું જ્ઞાન જેને થાય છે, તેને કોઈ શક્તિની મહાનતાનો સ્વીકાર થયા સિવાય રહેતો નથી. કેમકે જે વસ્તુની આવશ્યકતા લાગે છે તે વસ્તુની હસ્તી બની જવામાં તે કારણ થાય છે—તેથી આવશ્યકતાનું હોવું એ જ અનન્તની સત્તા સ્વીકાર કરવાની ખાત્રી આપે છે. જેને પોતાની કંઈક આવશ્યકતા છે એવું જ્ઞાન નથી હોતું તે પ્રાર્થના કરી શકતો નથી. હવે જુઓ કોઈ એવી વ્યક્તિ સંભવે છે કે જેને કોઈ આવશ્યકતા ન હોય—જો ન સંભવતી હોય

તો પ્રાર્થના કરવાનું સર્વને માટે સ્વાભાવિક બની જાય છે. ઈરેક માત્ર
એટલો છે કે આ ઉપર્યુક્ત પ્રાર્થનામાં સર્વ સમસ્યાઓનો ઉકેલ મળી
જાય છે અને એ પ્રાર્થના કેાધિપણ અસુક જ સંપ્રદાયની નથી તેમ તે
પ્રાર્થનામાં કેાધિનો વિરોધ થવા સંભવ નથી. આ પ્રાર્થનામાં તો
સર્વ સમસ્યાઓનું નિરાકરણ મળી જાય તેવી માંગ છે. એ હાચિએ આ
પ્રાર્થના ઈરેક માનવે કરવી જોઈએ.



પહેલો નિયમ

આત્મનિરીક્ષણથી અર્થાતું પ્રાર્થ વિવેકના પ્રકાશથી પોતાના હોષે તપ્યાસવા.

આત્મનિરીક્ષણનો ખરો મર્મ એ છે કે પોતે પોતાના સ્વામી બનવું. પોતાનું નિરીક્ષણ, પોતાના કરેલા હોષેનો નાશ કરવાનું સર્વથી પહેલું સાધન છે. પોતાનું નિરીક્ષણ કર્યા સિવાય નિર્દેખિતા પ્રાર્થ કરવાનો સંભવ નથી; કેમ કે પોતાની વિવિકણુદ્ધિની સહાયથી પેતાનામાં હેખાચેત હોષે સુગમતાથી મરાડી શકાય છે.

આત્મનિરીક્ષણ કરવાથી અસત્યનું જ્ઞાન અને સત્યનો યોગ થવા લાગે છે તેમ જ મળેલું બળ તથા લાયકાતનો સહૃપયોગ આપોઆપ થવા લાગે છે. જો આપણે અસત્યને પકડી પાડી ન શકીએ, અથવા સત્યનો યોગ ન પામીએ અને આપણું કર્તાબ્ય શું છે એ જણી ન શકીએ, તો સમજલું કે આપણે આત્મનિરીક્ષણ કર્યું નથી એટલે કે અનંતની અહૃતુકી કૃપાથી જે વિવેકણુદ્ધિ પ્રાર્થ થઈ છે તેનો આદર આપણે કર્યો નથી. વિવેકના આદરમાં જ આત્મનિરીક્ષણની પૂર્ણતા રહેલી છે. યથાર્થ આત્મનિરીક્ષણ થાય તો કોઈ બીજી ગુરુ કે અંથની આવશ્યકતા જ નથી રહેતી. કેમકે જેના પ્રકાશમાં સર્વ બની રહ્યું છે તે અનંત જ્ઞાન અને અનંત શક્તિનો લંડાર છે. આત્મનિરીક્ષણ કરતાં કરતાં પ્રાણી એ શક્તિથી અભિન થઈ જય છે કે જે શક્તિ, ખરેખર સર્વનું સર્વસ્વ હોવા છતાં, સર્વથી ઉત્કૃષ્ટ છે. આત્મનિરીક્ષણ આપણને બળનો સહૃપયોગ અને વિવેકનો આદર કરવાની પ્રેરણા આપે છે. બળના સહૃપયોગથી નિર્ણયાંતાએ અને વિવેકપૂર્વક આચરણથી અવિવેક આપોઆપ લુંગત થઈ જય છે.

હુરેક પ્રાણી, ચોતાથી અધિક બળવાળા, ચોતાની સાથેના વ્યવહારમાં બળનો સહુપયોગ કરે એમ આશા રાજે છે; જ્યારે ચોતે ચોતાના મળેલા બળનો, નિર્ઝો પ્રત્યે હુરુપયોગ કરે છે એ પ્રાપ્ત વિવેકનો અનાદર નથી તો ધીજું શું કહેવાય?

બળ એટલે સર્વપ્રકારનું બળ; જેવું કે શરીરનું બળ, ધનનું બળ અને પડ કે સત્તાનું બળ, વગેરે. ધનના હુરુપયોગથી સમાજમાં નિર્ધનતા; વિદ્યા અર્થાતું જ્ઞાન, વિજ્ઞાન અને કળાઓના હુરુપયોગથી અવિવેકની વૃદ્ધિ; શરીરભળના હુરુપયોગથી હિંસા અને ચોરી; સત્તાના હુરુપયોગથી વિરોધી સત્તાનો જન્મ અને એવા પ્રકારના અનેક હુર્ગુણાની વૃદ્ધિ થાય છે. પ્રત્યેક પ્રાણીને ચોતાની સલામતી સ્વભાવથી જ ઈષ્ટ છે, થતાં પણ તે ચોતે અહિસક રહેતો નથી; ખીજાની હિંસામાં પ્રવૃત્ત થાય છે અને તેથી હૃદયમાં વૈરભાવ ભરાઈ જય છે. આ જ કલહણું મૂળ છે. એવો કલહ મટાડવો માટે, હુરેક ભાઈઓને ચોતાનું હૃદય વૈરભાવ વિનાનું રહેતેમ કરવું જોઈએ. વૈરભાવ રહિત થવા માટે, અહિસક અનનું એ અત્યાંત આવશ્યક છે. ચોતાની સલામતી જેને ઈષ્ટ છે તેની વિવેકબુદ્ધિ તેને અહિસક અનવાના પ્રેરણા કરે છે, એ અનાદિ કાગણું (સનાતન) સત્ય છે. પરંતુ આજ તો આપણે વૈજ્ઞાનિક શોધો કારા, હિંસાત્મક પ્રયોગાથી કલહ (સંઘર્ષ) મટાડવાની યોજના કરી રહ્યા છીએ. એમ અનનું સર્વથા અસંભવિત છે, કારણ કે વિવેકના અનાદરથી તો પ્રાણી જીના મનમાં સંઘર્ષનો જન્મ થાય છે, તેથી જ જયાં સુધી મનમાંથી સંઘર્ષની વૃત્તિ નિર્મૂળ ન થાય, ત્યાં સુધી સમાજમાં જે કલહ પરતે છે, તે કોઈ રીતે મટે નહિ. વૈયક્તિક, કૌટુંણિક કે સામાજિક ગમે તે ક્ષેત્ર હોય ત્યાં એમ જ અને.

પ્રત્યેક અપરાધી ચોતાને માટે ક્ષમાની આશા કરે છે અને ધીજાઓને હંડ દેવામાં આવે એવી વ્યવસ્થા માગે છે. તે ધીજાઓ,

પોતાના પ્રતિ અહિસક, નિર્વેર, ઉદ્દાર, ક્ષમાશીલ, ત્યાગી, સત્યવાહી અને વિનઅતા, વગેરે દિવ્ય ગુણોવાળા બને એમ ઈચ્�ે છે; પણ પોતે ભીજાઓ પ્રતિ એવો સંદ્રબ્યવહાર રાખી શકતા નથી. પોતાના પ્રતિ મધુરતાયુક્ત સંન્માન ભીજાઓ બતાવે એવી આશા રાખે છે, પણ પોતે ભીજાઓ પ્રતિ કડવાશભયું અને ખરાખ વર્તન કરતા હોય છે. એ ખરેખરી ભૂલ છે. એનો અંનામ એવો આવે છે કે પ્રાણી પોતાના પ્રતિ રાગ અને ભીજા પ્રત્યે દ્રેષ કરનાર બને છે. એ સ્થિતિ સર્વ હુઃખેનું મૂળ છે.

પોતાના પ્રતિ થતા અન્યાયને ધૈર્ય અને ઝુશીથી સહન કરી લઈને, જે અન્યાયકર્તાને ક્ષમા કરી દેવામાં આવે તો દ્રેષ પ્રેમમાં પલટાઈ જાય છે. પોતે કરતા હોઇએ તે અન્યાયયુક્ત વર્તનથી, પોતે જ (ખોદું થઈ ગયાની) પીડા અનુભવીએ, જેના પ્રત્યે પોતે અન્યાય કરી બેડા હોઇએ, તેની ક્ષમા માંગી દેવામાં આવે, તો પોતે પોતાના અન્યાય માટે પોતે જ શિક્ષા સહી લીધી કહેવાય અને પોતાના રાગીપણુંનો હુર્ગુણ, ત્યાગના શુણુંમાં પલટાઈ જાય છે.

જ્યારે રાગ અને દ્રેષ ત્યાગ અને પ્રેમમાં બદલાઈ જાય ત્યારે અનાસકત અને (ખુદાપણુંના ભાવને બદલે) એકતાનો ભાવ આપોઆપ પ્રકટ થાય છે, અથવા એમ કહેવાય કે લક્ષિત અને સુક્રિત મણી જાય છે. એ જ વાસ્તવિક આનંદ છે.

આત્મનિરીક્ષણ કરવાથી એ પણ સ્પર્ષિત થાય છે કે, જ્યારે આપણે રાગથી પ્રેરાઈને ઈંડ્રિયના વિષયો તરફ લલચાઈએ છીએ, ત્યારે એ ઈંડ્રિયજન્ય જ્ઞાનના આધારે અનેક પ્રકારની વિષમતાઓનો ભાસ થાય છે (જે સંવેદનના આધારે ઘણી ચંચળવૃત્તિઓનો ભાસ અનુભવોએ છીએ) તેમ જ ઈંડ્રિયજન્ય સ્વભાવથી થતી કિયાના સુખની આસક્તિ તથા પરવશતા અને જડતામાં ક્રસાઈ જઈએ છીએ. એટલેથી જ બસ નથી થતું. પરિણામે શક્તિહીનતા થઈ જાય છે. પછી પાછા વળી વિશ્રામને

નિવૃત્તિ શોધીએ છીએ. એમાં સરેળ થઈએ તો શક્તિહીનતા મટી આવશ્યક શક્તિ મેળવી શકાય છે.

શક્તિહીનતા, જડતા અને સમતાના અભાવપણુંની ખામી વગેરે હુઃખોથી, પીડાઈને જે વિષયોથી પાછા વળીએ તો એ નિવૃત્તિ દ્વારા સંચિત શક્તિ સંચય થાય. એ શક્તિનો વ્યથ (વિષયોથી વિભુંખ થઈને) અટકે અને બાદાનું લટકતી મટી, અંતમુંખ થઈ જવાય તો કોગને બદલે ચોગ, જડતાને બદલે, ચેતના અને વિષમતાને બદલે સમતા, પરાધીનતાને બદલે સ્વાધીનતા હંસલ થાય અને અનેકતાનું લાન, એકતાના જ્ઞાનમાં પલટાઈ જાય છે. પછી તો સ્વાભાવિક આવશ્યકતાની પૂર્તિ અને અસ્વાભાવિક ધર્ઘાણોની નિવૃત્તિ આપોઆપ થઈ જાય છે. એ જ માનવતાનું લક્ષ્ય છે.

પોતાની વર્તમાન સ્થિતિનું યથાર્થ અને સ્પષ્ટ નિષ્કર્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ આત્મનિરીક્ષણ ગણ્યાય. તે થયા સિવાય આપણે આપણુંને નિર્દોષ બનાવી શકીએ નહિ. મનુષ્યમાં હોષ જોઇ શકવાની શક્તિ તો છે, પણ પ્રમાદથી, લોકો તેનો ઉપયોગ, પોતાનું જીવન તપાસવામાં કરવાને બદલેતે શક્તિ બીજી ઉપર અજમાવે છે. એનું પરિણામ ઘણું લયંકર અને હુખદ બને છે. પારકાના હોષ જોવાથી મોટામાં મોટી હાનિ તો એ થાય છે કે, લોકો પોતાના હોષ જોવાનું ભૂલી જાય છે અને મિથ્યાલિસાની બની તિરસ્કારથી પોતાનું હૃદય ભરી હે છે. (પારકા પ્રતિ) હૃદય તો પ્રેમ સંઘરસવાનું સ્થળ છે. તિરસ્કાર સંઘરસવાનું નથી, પણ હૃદય પ્રેમનું પાત્ર તો ત્યારે બને કે જ્યારે પારકાના હોષ જોવાનું બંધ કરી હ્યા પોતાના હોષ તપાસવાનો જાતાત પ્રથતન ચાલ્યા કરે છે.

પોતાના અને પારકા હોષ જોવામાં એક મોટો ફરજાએ છે કે જ્યારે આપણે બીજાના હોષ જોઇએ તે વખતે આપણું સંખ્યાંધ હોયો. જાથે જોડાઈ જાય છે અને તેથી કાળાંતરે, આપણે પોતે હોષચુક્ત બની જઈએ છીએ, પણ

જે આપણે, આપણા હોષ જેતા થઈએ તો આપણે તે હોષોથી અલગ થઈ જઈએ છીએ અને નિર્દોષતા સંપાદન થઈ જય છે. એ સર્વને ગમે છે, આથી નિર્વિંવાહ ખિદ્ધ થાય છે કે હોષદવિટનો ઉપયોગ કેવળ પોતાના હોષ જેવામાં કરવો જેઈએ, બીજના નહિ.

જેકે પ્રત્યેક માનવમાં, બીજ રૂપે તંત્ર સત્ય તરત્વ વિદ્યમાન છે પણ, તેનો આદરથી વિકાસ ન કરવાને લીધે પ્રાણી એ સત્યથી વિમુખ થઈ જય છે અને પરિવર્તનશીલ વસ્તુ, અવસ્થા તથા પરિસ્થિતિનોમાં સપડાઈ જઈ, પોતે હીન, હીન, અભિમાની અને પરતંત્ર બની જય છે. એ હુઃખ બંધનથી છૂટવાને માટે, એ અનિવાર્ય ઉપાય છે કે મનુષ્યે પ્રાપ્ત વિવેકના પ્રકાશથી પોતાના અંતરમાં જે સનાતન સત્ય છે તેનું નિરીક્ષણ કરવું; અને વસ્તુ, અવસ્થા તથા પરિસ્થિતિ પોતાના જીવનમાં જેવામાં આવે તેથી અસંગ બની જઈ, હુસાચારનો ત્યાગ કરી સહાચારી થવું; અને નિર્વિકાર બની જવું.

એ પ્રત્યેક માનવનો અનુભવ છે કે દર્શય જગતનો સંબંધ, સુખ-હુખમાં, મનુષ્યને ઇસાવી હે છે, અને તેનાથી મનુષ્ય જે ઇસાય નહિ અને અનાસકૃત થઈ જય તો કોઈ પ્રકારનું હુઃખ તેને લાગતું નથી. પ્રિયમાં પ્રિય વસ્તુ કે વ્યક્તિથી સંબંધનો સ્વીકાર કર્યા છતાં, મનુષ્ય શાશ્વત શાંતિ કે શક્તિ મેળવી શકતો ન હોવાથી. તેવા સંબંધથી અલગ થઈ જે તેને સર્વોત્કૃષ્ટ પ્રિય સ્વભાવથી જ છે, તંત્રાથી એકતા પ્રાપ્ત કરવાની હુચ્છા હોય તો તેણે અનાસકૃત થયા સિવાય લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. ગમે તેવી પ્રિય પ્રવૃત્તિમાં આસકૃત થઈ ગયા હોય તો આપણું તે થાકે છે અને પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુથી છૂટો થઈ ગાઠ નિદ્રા લેવા દર્શાવે છે. જેકે એવી ગાઠ નિદ્રા વખતે કોઈ પ્રકારનું હુઃખ કે વિષમતા જણ્ણાતાં નથી, પણ તે નિદ્રાથી પણ પ્રાણીઓ પોતાની મેળે જગૃત થઈ જાય છે. આ દૂંકા સમયની સુષુપ્તિ જે શાંતિ અને હુઃખની નિવૃત્તિ

આપે છે તે ટકતી નથી. પણ એ સુષુપ્તિ જેવું સામ્ય અને હુઃખની નિવૃત્તિ કાયમ રહે, પણ સુષુપ્તિમાં જે જ્ઞાનશૂન્યતા હોય છે તેવી જ્ઞાનશૂન્યતા ન રહે એવી સ્થિતિ, મનુષ્ય જોગે છે. એવા જીવનની જો કરવાની જીવન વિકાસની દ્રશ્ય પ્રાપ્ત થાય ત્યારે તે તેથી પણ ઉચ્ચતર સ્થાનનું દર્શાન કરે છે. એ દ્રશ્યએ પહોંચતાં મનુષ્યને એવું નિશ્ચળ બળ મળે કે જેથી વિશેષ બીજું કંઈ મેળવવાનું રહેતું નથી. તેનું અલૌકિક, અનંત, નિત્ય ચિન્મય જીવન જનાવવા માટેની એટલે કે નિર્બિંકદ્વારા જ્ઞાનમય જીવનની લાલસા વાકુળ કરે છે. એવું જીવન સર્વ અવસ્થાઓથી ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક જીવન છે. આવા સ્વતઃ સિદ્ધ અનંત જીવન માટેની દુચિ, માનવમાત્રમાં સ્વભાવથી જ વિદ્યમાન છે, પણ તેવું જીવન પ્રાપ્ત કરવાને માટે, સર્વ અવસ્થાઓથી વિમુખ થવું જ રહ્યા છે. એ અવસ્થાઓથી વિમુખ થતાં જ, અવસ્થાતીત જીવનને અનુભવ થઈ જય છે.

આત્મનિરીક્ષણ જ વાસ્તવિક સત્તસંગ, સ્વાધ્યાય અને અધ્યયન છે, કારણ કે આત્મનિરીક્ષણ વિના પ્રાણી, જે સત્યતર્ત્વ, અને જ્ઞાન તેનામાં હંમેશાં કાયમ જ છે તેની ઉપલિંઘ કરી શકતો નથી, તેથી જ આત્મનિરીક્ષણ દ્વારા જ આપણને વાસ્તવિક સત્યતર્ત્વ અને જ્ઞાનની ઉપલિંઘ થઈ શકે છે.

આત્મનિરીક્ષણ કરવા લાગતાં જ, જે વિવેકશક્તિથી, અસત્ય નેટ શકાય છે, એ જ વિવેક મનુષ્યને સત્યનો ચોગ પણ કરી કરાવી શકે છે. તે દ્વારા જ સત્યનો જંચોગ પામવાનો (સત્યથી અભિન્ન થવાનો) અને અસત્યથી નિવૃત થવાનો ઉપાય પ્રાપ્ત થાય છે. આત્મનિરીક્ષણ સિવાય, કોઈપણ સદ્ગુરુએ આપેલું જ્ઞાન આપણને કામ આવતું નથી. એવું જ્ઞાન તો માત્ર મગજમાં સંચાલય છે. એતો નકશાની નહીં જેવું જ્ઞાન છે. નકશો આપણને વાસ્તવિકતા સુધી પહોંચાડવાનું સાધન છે ખરું, પરંતુ નહીનો. નકશો નેટને સંતોષ પામી જઈએ, તો એક ગીરુંય પાણી મળશે નહિ અને તરસ પણ છીપશે નહિ.

આત્મનિરીક્ષણની સાથે સાથે, આપણે સદ્ગુરીએ અને સત્પુરુષોએ આપેક્ષા જ્ઞાનનો ઉપયોગ કરવો જેઈએ. આત્મનિરીક્ષણ ક્રારા, જ્યારે આપણે, આપણને શું શું વહાલું છે એ તપાસી લઈએ છીએ, ત્યારે આપણે કોઈ એવી ચૈદ્યા નહિ કરી શકીએ કે જેમાં હીજાં એતું વહાલું વસ્તુ કે હિત ન રહેલું હોય.

જ્યારે આપણે, પ્રાપ્ત વિવેકના પ્રકાશથી આપણી વર્તમાન વસ્તુસ્થિતિનું વિશ્વેષણું કર્યાએ છીએ, ત્યારે આપણને, આપણામાં એ બાધતો જેવામાં આવે છે: (૧) લોગની ધર્યા અર્થાતું દિક્ષિયજન્ય સ્વભાવમાં પ્રવૃત્તિ અને (૨) વાસ્તવિક (મૂળ માનવતાની હોવી જેઈએ તે સ્થિતિ) સ્વાધીનતા. વાસ્તવિક સ્વાધીનતા એટલે વસ્તુ અવસ્થા અને પરિસ્થિતિથી મુક્ત જીવનની અલિલાખા. જે લોગ ધર્યા કહેવાય છે તેની ઉત્પત્તિ તો માત્ર “આ” (શરીર) ને “હું” (આત્મા) માનવાથી થાય છે. એટલે કે શરીર મારું માનવાથી થાય છે. જેકે “આ” (શરીર) ને “હું” માની કેવું એ પોતાના અંતરમાં જે જ્ઞાન (પ્રચ્છન્ન) છે તેથી વિપરીત છે, છતાં આપણે, એ વાસ્તવિક જ્ઞાનનો અનાહર કરીને, ‘આ’ (શરીર)ની સાથે તદ્વાપ થઈને આપણને પોતાને લોગ વાસનાઓમાં ઇસાવીએ છીએ એ જ સર્વહુઃખનું મૂળ છે “આ” (શરીર)ને ‘હું’ માની કેવાથી “આ” (શરીર)માં સત્યપણાનો ભાવ દ્વારા થઈ જય અને તેના પ્રત્યે પ્રિયતા, વહાલ ઉપયોગ છે. એ શરીર ઉપરનું વહાલ ધીરેધીરે, સમય જતાં, આસક્તિ થઈ જય છે ‘આ’ (શરીર)ની સત્યતા અને તેના પરના પ્રેમમાં ઇસાયેલ પ્રાણી, પોતાનું વાસ્તવિક નિત્ય જીવન શું છે તે ભૂલી જઈ, જુહી દિશાએ ચાલ્યો જય છે. ‘આ’ (શરીર) ન રહેવાથી પણ જે રહે છે, અથવા જ્યારે “આ” (શરીર) નહોતું ત્યારે પણ જે હતું, વળી, જેને કારણે “આ” (શરીર) જીવાંત કહેવાય છે તે જ આપણાં નિત્ય અનંત જીવન છે. એ નિત્ય જીવનના અનુભવ સિવાય કોઈને પણ શાખત શાંતિ અને સનાતન પ્રસન્નતા મળી શકતી નથી.

એ નિવિબાહ સિદ્ધ છે. જે મનુષ્ય પોતાના વિવેકના પ્રકાશથી “આ” (શરીર)ને “હું” ન માને અને ‘આ’ (શરીરને) ને “મારું” ન માને તો નિર્વાસના આપોઆપ અવાજી જણે, ડેમકે તેમ થાય તો સંકુચિત અહું-ભાવ બાકી રહેતો નથી અને સાથે સાથે લકૃત જેને ભગવાન, તરફ વેતાઓ નિજસ્વરૂપ યોગીઓ યોગ અને સર્વ પોતાનું સર્વસ્વ માને છે, તેની સાથે અલિન્જતા-અલેદ પામી જવાય છે.

‘આ’ (શરીર) અને ‘હું’ (આત્મા) વચ્ચેનો લેદ સમજય તો “છે” (અસ્તિ-સત્ત-સનાતન સત્ત્ય) થી અભિજ્ઞતા પ્રાપ્ત કરવાનો ઉપાય મળી જાય જેમ હુણદર અને ચૂનો મેળવવાથી લાલ રંગ પેડા થાય છે અને બનેને જુહાં પાડવાથી લાલ રંગ ખસી જાય છે, એજ પ્રકારે ‘આ’ (શરીર) અને ‘હું’ (આત્મા) ને જુહો પાડવાથી ‘અહું’ ‘હું’ ને “મારું” રૂપી લાલાશ કાયમને મારે મટી જાય છે, અને માત્ર અનંત નિત્ય જીવન માત્ર બાકી રહે છે જે માનવનું ખરેખરું લક્ષ્ય છે.

ભૌતિકવાહીઓ ‘હું’ અને ‘તે’ ને ‘આ’ (જગત)માં વિલીન કરીને વિશ્વથી એકતા-અલેદ સાથે છે. આસ્તિકવાહી, ઈશ્વરવાહીને એ સ્થિતિ એ માત્ર પ્રેમ પ્રેમ જ સર્વત્ર શેષ રહે છે, અધ્યાત્મવાહીને પોતામાં જ અલેદદર્શિન થઈ સર્વસ્વ પ્રાપ્ત થાય છે.

ભૌતિકવાહ શરીર અને વિશ્વની એકતા સિદ્ધ કરીને, મનુષ્યને કર્ત્વબ્યનિષ્ઠ બનાવે છે અને સુખદુઃખનો સહુપયોગ કરાવવા સાધકને સમર્થ કરે છે. આસ્તિકવાહ, મનુષ્યને સુખદુઃખથી પરદશા (સિદ્ધ કરાવીને, અખંડ, અનંત, રસપ્રદાન કરે છે અને અધ્યાત્મવાહ મનુષ્યને અખંડ એકરસમાં તરણેણ કરે છે. ભૌતિકવાહની ચરમસીમાએ પહોંચનાર, અધ્યાત્મવાહથી અલેદ સાધીને આસ્તિકવાહમાં પ્રવેશ કરે છે.

જ્યાં સુધી કર્ત્વબ્યપરાયણુતા સંપૂર્ણ સિદ્ધ ન થાય, ત્યાં સુધી જ મનુષ્ય ભૌતિકવાહમાં મશાગૂલ રહે છે. એટલે કે એ ત્યાં સુધી જ ભૌતિક-વાહી રહે છે, જ્યાં સુધી તે વિશ્વથી પ્રાપ્ત વસ્તુઓ, સામર્થ્ય, લાયકાત વગેરે

જગતની સેવામાં સમાપ્તિ કરી હોઈ, સમાજના ગ્રાણુથી સુકૃત અની, નિરભિમાનતા હાંસલ કરી લે છે.

‘આ’ ના અર્થમાં આપું જગત આવી જય છે. શરીર જગત દ્વારી સાગરના એક બિંહુ માત્ર છે, તેથી શરીરદ્વારી બિંહુને સંસારદ્વારી સાગરની સેવામાં જોડી હેવું એ જ શરીરનો સર્વોકૃત્ય સહૃદ્યોગ છે; કારણ કે વ્યક્તિગત જીવન, સમાજના અધિકારીનો સમૂહ માત્ર છે, બીજું કંઈ નથી. જ્યારે પ્રાણી સમાજના અધિકારીને સુરક્ષિત રાખતાં, પોતાના અધિકારને વીસરી જય, ત્યારે આસ્તિકવાદ અને અધ્યાત્મવાદમાં, તેનો સ્વતઃ પ્રવેશ થઈ જય છે, ત્યાર પછી તો ઘણું સુગમતાપૂર્વક ‘આ’ અને ‘હું’ નો વિવેક થઈ જય છે. અધિકારકોલુભાને કારણે જ પ્રાણી ‘આ’ માં ફૂસાઈ જય છે. જે પ્રામ વિવેકના પ્રકાશથી, પ્રાણી, એ સધળી હૃદ્યાચાએ. જેમાં સમાજનું હિત કે પ્રસંગતા ન હોય, તેનો નાશ કરી નાણે, તો ઘણી સુગમતાપૂર્વક, તેનું મન નિર્વિકલ્પ થઈ જય. મન નિર્વિકલ્પ થતાં જ, બુદ્ધિ સમતાયુક્ત થઈ જય છે. બુદ્ધિમાં સમતા આવવાથી, આવશ્યક શક્તિનો વિકાસ થઈ જય છે. તેમ થતાં પ્રાણી પોતાની સ્વાભાવિક લાલસા પૂર્ણ કરીને કૃતકૃત્ય થઈ જય છે. તેનું જીવન નિર્વાસના, નિરોદ્ધારા, નિર્સિદ્ધતા, સમતા, મુદ્દિતા આદિ ગુણોથી પરિપૂર્ણ થઈ જય છે અથવા કહો કે તે પોતાના જીવનનું નિર્માણ કરી લે છે. વ્યક્તિજીવનના એ રીતના નિર્માણથી, આપોઆપ સુંદર સમાજનું નિર્માણ થવા લાગે છે. આમ, આત્મનિરીક્ષણથી આપણે નિર્દેખ અની જવું જોઈએ એ બંધુ આવશ્યક છે. આત્મનિરીક્ષણ કરવાથી આપણુને એ સ્પષ્ટ વિહિત થઈ જય છે કે પ્રામ શક્તિનો સહૃદ્ય, મતુષોને સ્વલ્ભાવથી જ ઈચ્છાતો હોય છે. એ એટલા ઉપરથી સિદ્ધ થાય છે કે, જ્યાં ડોઈ આપણી સાથે વ્યવહાર કરે, ત્યારે જે તેમાં કંઈ હોષ લાગે છે. ત્યારે આપણુને એવો વ્યવહાર, બીજું વ્યક્તિ આપણા પ્રત્યે કરે છે તે સાંદું લાગતું નથી, છતાં આપણે બીજ પ્રત્યે, પ્રમાદવશ, એવો અનુચ્ચિત લાગતો વ્યવહાર કરી જેસીએ છીએ.

મિથ્યા, કડવું કે આવશ્યકતાથી વિશેષ યા એવું બોલવાનું કોઈને પ્રિય લાગતું નથી. આપણે એવી આશા રાખીએ છીએ કે આપણી જાણે ને કોઈ કંઈ બોલે તે સત્ય. પ્રિય, હિતકર અને આવશ્યકતા પ્રમાણે હોવું જોઈએ. બોલવાની ખાળતમાં, આ જાતનું જીન, આપણને કોઈએ શીખવું નથી હોતું. એવું આપણને આપમેળે જ હોય છે. બોલવાની શક્તિનો સહૃદ્યય કરવાથી, વાણીમાં સત્યતા આવી જાય છે, એવા બોલવાનો પ્રભાવ એની મેળે જ પડે છે તે પ્રભાવ તો એટલે સુધીનો હોય છે કે તે બોલ પ્રમાણે પ્રકૃતિમાં કાર્ય થવા લાગે છે એવો અનુભવ વધાર્ય બોલવાવાળાનો છે. એ જ પ્રમાણે આપણે હરેક ઈદ્રિયના વ્યવહાર ઉપર, આપણી વિવેકદિષ્ટિ, નિરીક્ષણ રાખવું જોઈએ કે જેથી ઈદ્રિયની શક્તિઓનો હુંબ્યાં ન થાય. પણ તે ત્યારે જ થાય કે જ્યારે મનમાં એવા જ સંકલ્પ જોઈ કે જે શુદ્ધ હોય, અને જેનો સંખંધ વર્ત્તમાન પરિસ્થિતિને લગતો હોય. આનો મતલબ એ છે કે અનાવશ્યક અને અશુદ્ધ સંકલ્પોનો ત્યાગ કરવાથી જ ઈદ્રિયોનો વ્યવહાર શુદ્ધ થઈ શકશે. એનું પરિણામ એ થશે કે આવશ્યક સંકલ્પો જિંદ્જ થઈ જશે અને અનાવશ્યક સંકલ્પોનો વિલય થશે. અર્થાત્ મનમાં નિર્વિકલ્પતા થઈ જશે, મનમાં નિર્વિકલ્પતા પ્રાપ્ત થતાં જ, ને મનની શક્તિઓ ઈદ્રિયો તરફ હોડતી હતી, તે શક્તિઓ બુદ્ધિમાં ઉત્કૃષ્ટ થઈ ત્યાં વિરમશે, એથી બુદ્ધિ સમતા પ્રાપ્ત કરી અનંતના જીનથી પ્રકાશિત જનશે. એવી પ્રકાશિત બુદ્ધિ, મન ઈદ્રિયો વગેરેને શુદ્ધ જીનના પ્રકાશને કારણે, વ્યવહારમાં સુંહરતાના જન્માગ્ન પર વલાવશે.

આપણાં કાર્યોમાં હોષ તો ત્યારે આવે છે કે, જ્યારે મન અને ઈદ્રિયો, બુદ્ધિથી જે સત્ય પ્રકાશ મળે છે, તેનો અનાહાર કરે છે અને આપણે ને કાર્યો, બુદ્ધિના પ્રકાશ વિહુદ્ધ હોય તેવાં કાર્યોમાં ઈદ્રિયો પ્રવૃત્ત થતી હોય તેનું સમર્થન કરતા રહીએ. બસ, આત્મનિરીક્ષણ ન કરવાથી જ આ ભૂત થાય છે. આપણી બુદ્ધિ ધીજનાં કાર્યોનું નિરીક્ષણ

કરવામાં તો બહુ કુશળતા બતાવે છે, પરંતુ એ કુશળતાને ઉપયોગ, આપણે આપણાં મન, ઈદ્રિયો વગેરેના નિરીક્ષણમાં કરવો જોઈએ.

આપણે જેની સાથે રહીએ છીએ તેની વાત ઉપર વિશ્વાસ કરતા નથી, આપણા પોતાને વિશ્વાસ જોઈ જોચીએ છીએ, અને પછી અમારી વાતનો કોઈ વિશ્વાસ જ કરતું નથી એમ કહેવા લાગીને હુઃખી થઈએ છીએ. આ પ્રકારે પરસ્પરમાં અવિશ્વાસ થવાથી ઘણી લયંકર ગાંડો ઉત્પત્ત થઈ જાય છે. જીવન કલહનું કેન્દ્ર બની જાય છે. પોતાનું અસત્ય હોય તેને સત્ય માનવા લાગીએ છીએ અને ખીંચું સત્ય હોય તે અસત્ય પ્રતીત થવા લાગે છે, તેથી જીવનમાં ભિજતા, નીરસતા અને ઉત્સાહહીનતા વગેરે અનેક વિકારો ભરાઈ જાય છે એવી લયંકર પરિસ્થિતિ ફેરવી નાખવા માટે, આપણે, આપણા પ્રત્યેક કાર્ય દ્વારા, સત્યતા, મધુરતા, પ્રયત્ન અને હિતચિંતકતા દર્શાવવાં જોઈએ; અને આપણા સાથીએના અસત્ય અને કડવાશભર્યો વ્યવહારની અચ્છા કર્યા સિવાય, તેઓની ઇચ્છાએને, તેઓ જે કહે તે સાંભળી લેવું જોઈએ જીથી તેમને ખાતરી થઈ જાય કે તેઓને હર્ષપૂર્વક સાંભળી લેવામાં આવે છે, એમ થશે. તો આપણા સાથી થાડા જ દિવસોમાં પોતાનો સ્વલ્પાવ પોતાના મેળે જ બહલવા માંડશે, જેકે આપણે કોઈના અસત્યનું અનુસરણ ન કરીએ, પરંતુ આપણે જેમ આપણી સત્ય વાતને માનતા હોઈએ છીએ, તેવો જ આપણે સામાની વાતનો પણ અવશ્ય આઠર તો કરવો જોઈએ. કારણ કે કોઈની અસત્ય વાતને અસત્ય કહેવાનો આપણને અધિકાર જ નથી. જે પોતાના અસત્યને કોઈ સત્ય પ્રકાશિત કરે, તો આપણે તેની વાત હર્ષપૂર્વક સાંભળી તો લેવી જોઈએ. તેને અનાદરપૂર્વક કે કડવાશથી જવાબ ન દેવો જોઈએ. એમ કરવાનું પરિણામ એ આવશે કે તેને પોતાનું અસત્ય પોતાને જ જણાઈ જશે. અને તે ખચારો પોતાની મેળે જ અસત્યનો ત્યાગ કરવા લાગશે. અનાદરના લયથી જ મનુષ્ય પોતાની જોઈ વાતને વળગી રહી સાચી કરવા

મયે છે. જ્યારે આપણી ટીકા કરવાર પોતાના સ્વભાવ પ્રમાણે, આપણી સમજ, આપણા સત્યનો અનાદર અને પોતાની જોઈ વાતનું પ્રતિપાદન કરવા માંડે, જે આપણે સામું પ્રતિપાદન કરવા માંડીએ, તો તેથી પરસ્પર સંઘર્ષ ઉત્પત્ત થઈ જાય છે; તેથી જે આપણું સારી રીતે સત્યનું દર્શાન થઈ ગયું હોય તો આપણે આપણા સાથીના અસત્યને અસત્ય કઢ્યા જિવાય, તેને સત્ય સમજાય તેવી દર્શિ આપીએ, તેમ થશે તો તે પોતે પોતાનું અસત્ય સમજુ જશે અને પોતાને સત્યાશીં બનાવવાને તત્પર થઈ જશે.

પોતાનું આત્મનિરીક્ષણ કરવામાં મનુષ્યે જે સ્વભાવિક રૂચિએ પોતાનામાં બનાવી રાખી હોય છે, તે અનુસાર તેને સત્યનું દર્શાન જાય છે. જેકે સત્ય, સર્વ રૂચિ સ્વભાવોના રંગથી બુદ્ધ જ હોય છે તો પણ અસત્યને ખુલ્ખું પાડવામાં સત્ય જ સમર્થ છે. જુહી જુહી રૂચિએ તો, કોઈ ને કોઈ સંકુચિતતાના અલિમાનના આધારે જ સર્વીં હોય છે. તેથી સત્ય તો, તેને રૂચિએથી અતીત જ હોય છે. નિર્ઝેણ હોય છે.

આત્મનિરીક્ષણ કરવાથી આપણું એવું જ્ઞાન પણ થાય છે કે ન્યાય અને પ્રેમથી જ પારસ્પરિક એકતા, પ્રેમ અને મધુરતા સુરક્ષિત રહી શકે છે, પણ ન્યાય પોતાના પ્રતિ અને પ્રેમ સામા પક્ષ પ્રત્યે કરવો જેઠાં. પોતા પ્રત્યે ન્યાયની દર્શિ કરવાથી નિર્દેષિતા આપણું આવે છે અને સામા પક્ષ પ્રત્યે પ્રેમ કરવાથી, સ્નેહની એકતા અને સ્વરૂપનો અલેહ અનુભવમાં આવવા લાગે છે. ન્યાયનો વાસ્તવિક ધર્મ છે અળનો સહૃદયોગ, પ્રેમનો વાસ્તવિક ઉપયોગ છે, પોતાના હુક્કને ભૂલી જઈ સામાના અધિકાર-હુક્કની રક્ષા કરીને, બુરાઈને બદલે ભલાઈ કરવામાં પ્રસંગતાનો અનુભવ કરવો. કારણું પ્રેમમાં કોઈ પ્રકારની લેદખુદ્દ કે અલગપણું હોય નહિ. વાસ્તવિક એકતાનો અનુભવ થઈ જાય તો, મનુષ્ય ધર્મી સુગમતાથી બુરાઈનો બદલો ભલાઈથી આપી શકે છે. દાખલા તરીકે જે કોઈવાર હાંતથી જીલ કયરાઈ જાય તો પણ જુલા

દાંતોને તોડી નાખવાનું ચોણ્ય માનતી નથી, ભેલટું, દાંતોમાં કાંઈ લરાઈ
ગયું હોય તો તે કાઢી નાખવાનો જુલ પ્રયત્ન કરે છે.

આત્મનિરીક્ષણથી આપણુંને એ જ્ઞાન પણ આવે છે કે સર્વને
સુખ આપવાને માટે અને તેમના હુઃખમાં ભાગી બનવાને માટે,
આપણે, સૌની સાથે એકતાને ભાવ સ્થાપિત કરવો જેઈએ. આપણે
આપણું હુઃખ મટાડવાને માટે આપણાથી વધારે સુખીએ. તરફની
મહદેની આશા સેવીએ છીએ, તો પછી આપણા પ્રાપુસ સુખ દ્વારા,
આપણાથી વધારે હુઃખીએની આશા પૂરી કરવામાં પાછી પાની
કરવી એ ભૂલ છે, આ ભૂલને મટાડવાને માટે આદર કરવો એ જ
મહામંત્ર છે. આપણે જે જ્ઞાન અનુભબ્યું છે તેનું નામ વિવેક છે. શીખેલું
જ્ઞાન વિવેક ઉત્પત્ત કરી શકતું નથી. તે તો મગજમાં ખડકેલો કેઠાર
જ છે. આત્મનિરીક્ષણથી એ પણ અનુભવ થાય છે કે પ્રવૃત્તિના અંતે
નિવૃત્તિ અને નિવૃત્તિના અંતે પ્રવૃત્તિ આપોઆપ થયા કરે છે, પણ
રાગયુક્ત પ્રવૃત્તિ પ્રમાદને કારણે વાસનાએની જળમાં આપણુંને ફ્સાવે
છે તેથી પ્રાણી અનેક જાંયનીય ચોનિએ. પ્રાપુ કરીને, અનેક પ્રકારનાં
સુખહુઃખ જોગવતો રહે છે. અર્થાતું આનંદથી વિમુખ રહે છે. આનંદ
સાથે તો આત્માની જાતીય તથા સ્વરૂપથી એકતા છે અને સુખહુઃખ
સાથે તો કલ્પણા એકતા છે. કામનાની ઉત્પત્તિમાં હુઃખ અને પૂર્તિમાં
સુખ ભાસે છે. કામનાની ઉત્પત્તિ, શરીર સાથે એકતાને. સ્વીકાર કરવાથી
થાય છે અને તે વાસ્તવિક રીતે તો ભૂલ છે, કેમકે જેને આપણે, આપ-
ણાથી બુઝું જણુંએ છીએ; તેને આપણું સ્વરૂપ માની લેવું અથવા તેની
સાથે આત્મીયતાનો સ્વીકાર કરવો એ પ્રમાદ સિવાય બીજું કાંઈ નથી.

જે વિવેકથી પ્રમાદ તરીકે એળખીએ છીએ, તે જ
વિવેકથી, પ્રમાદનો અંત થઈ શકે છે, અર્થાતું વિવેક દ્વારા સ્થૂલ સ્હુમ
અને કારણ પણે શરીરાની આસક્તિ હૂર થતાં જ, રાગ, ત્યાગમાં બદલાઈ
જાય છે ત્યારે નાતો પ્રેમાસ્પદનો જ રહે છે અને તે નાતો, એ પ્રેમાસ્પદની

પ્રભાગાને મારે જ, સ્વાર્થરહિત પ્રવૃત્તિ થવા લાગે છે. પ્રેમીને, સર્વમાં પોતાના પ્રિયતમનું દર્શાન થાય છે અર્થાતું એવો અનુભવ થાય છે કે વે કંઈ દર્શય છે તે સર્વમાં પોતાના પ્રેમાસ્પદજ છે. ઐનું કંઈ છે, નહિ. વાસનારહિત નિવૃત્તિ સિદ્ધ થવાથી, એવો જોધ આપોઆપ પ્રગટ થાય છે કે પ્રેમાસ્પદના સિવાય કહી કંઈ ઉત્પન્ન થયું જ નથી. એવો જોધ થતાં જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેમાં શરીરથી થતી પ્રવૃત્તિ, સ્વાર્થરહિત, સર્વહિતકારી સદ્ગુલાવનાથી પ્રેરીત થવા લાગે છે. સ્વાર્થરહિત સર્વહિતકારી પ્રવૃત્તિ, વાસ્તવિક રીતે તો નિવૃત્તિ સમાન જ છે. એવી પ્રવૃત્તિ સમાજના અધિકારને સુરક્ષિત રાખે છે અને તેને બદલે કંઈ મેળવવાની રૂચિ રહેવા હેતી નથા. સ્વાર્થરહિત થતાં જ કોઈ પ્રકારનો ઉપસોાગ બાકી રહેતો નથી અને ઉપસોાગનો અંત થતાં જ પ્રાણી પોતાના પરમ પ્રેમાસ્પદનો અનુભવ કરીને હૃતકૃત્ય થઈ જાય છે. તેથી એ નિવિવાદ સત્ય સિદ્ધ થાય છે કે વાસનારહિત નિવૃત્તિ અને સર્વહિતકારી પ્રવૃત્તિ, એ બંને આવકારદાયક અને આચરવા કે અનુસરવાલાયક છે.

સર્વહિતકારી પ્રવૃત્તિ અને વાસનારહિત નિવૃત્તિ એ એ જ માનવજીવનની મુખ્ય સાધનાએ છે. એ એ જાગોમાં જીવન વ્યતીત થયું જેઠાએ. એ એ સાધનાએ, જે એકના પ્રકાશથી પ્રકાશિત થાય છે તે એક જ સર્વનું સર્વસ્વ છે અને તેની સાથે જ સર્વનો અસેહ થઈ શકે છે.

વાસનાયુક્ત નિવૃત્તિ અને સ્વાર્થયુક્ત પ્રવૃત્તિ તો હુંમેશાં નિદ્દાપાત્ર છે, કારણું કે વાસનાયુક્ત નિવૃત્તિ (મનુષ્ય) પ્રાણીને ભિથ્યાચારી અને સ્વાર્થયુક્ત પ્રવૃત્તિ, તેને વિષયાસક્ત જનાવી હે છે. વાસનારહિત નિવૃત્તિ, બેદમાંથી અલેહ તરફનું અને સ્વાર્થરહિત પ્રવૃત્તિ બિન્નતાથી, અભિનનતા તરફ પ્રેરિન કરે છે. અભિનનતા સ્વાર્થ નાશ કરીને સાધકને સાધ્યની સાથે એકતા કરાવે છે, તે જ પ્રમાણે, વાસનારહિત નિવૃત્તિ, હેઠાલિમાનને નાશ કરીને, સાધકને પોતાના લક્ષ્યમાં

પ્રતિભિત કરીને અલેદ સાથે છે. પણ તો તેના જીવનમાં કોઈપણ પ્રકારનો ‘અભાવ’ (અસતોષ-તુઠિ) રહેતો નથી, અર્થાત् ‘થડ’ (સંસાર) અને ‘તે’ (પરમાત્મા) અને ‘હું’ ત્રણેની વાસ્તવિક એકતા થધ જાય છે.

આત્મનિરીક્ષણથી એ પણ જીવન થાય છે કે પ્રાપ્તનો અનાદર અને અપ્રાપ્તનું ચિંતન કરતા રહેવાથી પ્રાપ્ત શક્તિનો હુબ્બર્યથ થાય છે. સહૃપ્યોગ નથી થતો. આહરપૂર્વક વર્તમાન રિથતનો સહૃપ્યોગ ન કરવાથી, આગળ પાછળનાં બથર્થ ચિંતન થવા લાગે છે, એટલે ઉપરોગી ચિંતન થઈ શકતું નથી. જેનું એકમાત્ર સમરણ, ચિંતન અને ધ્યાન કરવાથી સિદ્ધિ મળે તેના તરફે, સાર્થક ચિંતન સિવાય પ્રગતિ થતી નથી. જ્યાં સુધી પાણી એ અનંત જીવનની સિદ્ધિ મેળવતો નથી, ત્યાં સુધી તે કોઈ ચિંતનમાં લાગ્યો જ રહે છે તે અનંત જીવન સર્વ અવસ્થાઓ, વસ્તુઓ અને પરિસ્થિતિઓથી અતીત છે. એ અનુભવ કરવાને માટે તો આપણે સધળાં ચિંતનનો ત્યાગ કરવો જ જેઇએ. સ્વાર્થભાવ મટાડવાને માટે જેમ સેવાભાવ અનિવાર્ય છે, તેમ જ બથર્થ ચિંતનનો નાશ કરવાને માટે સાર્થક ચિંતન પણ પરમાવશ્યક છે. જ્યાં સુધી અપાપ્ત પરિસ્થિતિની આશા કર્યા સિવાય પ્રાપ્ત પરિસ્થિતિનો સહૃપ્યોગ ન થાય ત્યાં સુધી બથર્થ ચિંતન થયા કરવાનું સ્વાસ્થાવિક જ છે. પ્રાપ્ત પરિસ્થિતિ જ સર્વોચ્ચ સાધનસામન્યી છે એમ માને તો જ પ્રાણી અપાપ્ત પરિસ્થિતિની આશા છોડી શકશે. પ્રત્યેક પારસ્થિતિ પ્રકૃતિના ન્યાયથી મળેલી સાધનસામન્યી છે. બીજું કાંઈ નથી. સાધનમાં સાધ્યબુદ્ધિ કે જીવનબુદ્ધિ કરવી એ ભૂલ છે. સાધક સાધન દ્વારા, સાધ્યથી અલેદ પાળી શકે છે. તેથી હરેક સાધકે, સર્વ પરિસ્થિતિઓથી અનંત નિત્ય જીવન પ્રાપ્ત કરવાને માટે પ્રાપ્ત પરિસ્થિતિનો સહૃપ્યોગ કરવો જેઇએ. આ ત્યારે જ બની શકે કે જ્યારે મનુષ્ય, પરિસ્થિતિને સાધન અને પરિસ્થિતિઓથી અતીત, નિત્ય, દિવ્ય તથા ચિન્મય જીવનને સાધ્ય-લક્ષ્ય જણે કે માને.

આતમનિરીક્ષણુથી એ પણ સ્પષ્ટ થઈ જય છે કે પ્રત્યેક પરિસ્થિતિ અપૂર્ણ હોય છે. કોઈને બીજાની સરળાખીએ, અમુક પરિસ્થિતિ ઓંચી કે નીચી જ્ઞાતે લાગતી હોય, પણ ખરી રીતે જેતાં તો, સર્વ પરિસ્થિતિઓની એક જ દર્શા હોય છે, તેનું કારણ એ છે કે દરેક પરિસ્થિતિમાં, મનુષ્યને પોતાની પરિસ્થિતિથી બીજાની પરિસ્થિતિ વધારે સુખવાળી કે હુઃખ-વાળી લાયે છે. પ્રાણી પોતાથી વધારે હુઃખીઓને જેઠિને, પોતાને સુખી જેને બીજાને સુખી જેઠ પોતાને હુઃખી માને છે, અથવા એમ કહો કે જ્યારે કોઈ પરિસ્થિતિ અપ્રાપ્ત હોય તે કાળે જ, એ સ્થિતિની સત્યતા જેને સુંદરતાનું આકર્ષણીય હોય છે. જે એ પ્રાપ્ત થઈ જય તો તેમાં એવું આકર્ષણી રહેતું નથી. પ્રાપ્ત થાય ત્યારે તો તેથીયે વધારે આગળ વધવાની સ્વાભાવિક રૂચિ પેહા થાય છે, તેથી એ નિર્વિવાદ સિદ્ધ થાય છે કે આપણે તો તે જેઠાં એ સધળી પરિસ્થિતિઓથી પર (અતીત-અથત् શાકીવત) દર્શા હોય. એ દર્શામાં પહોંચવાને માટે કોઈ ખાસ પરિસ્થિતિની જરૂર નથી હોતી. એથું જ નહિ પણ પ્રાપ્ત પરિસ્થિતિના જરૂરપથોગ દ્વારા, આપણે તેનાથી અસંગ થવું છે અને અપ્રાપ્ત પરિસ્થિતિનું ચિંતન કરવું નથી. પરિસ્થિતિના ચિંતનથી સુક્ત થતાં જ આસ્તિકો(ભક્તો)ને જગવતું ચિંતન અને જિજ્ઞાસુઓને તત્ત્વચિંતન આપોઆપ થાય છે. તેથી વ્યર્થ ચિંતનનો નાશ થઈ શરણાગતિ અથવા નિશ્ચિંતપણું પ્રાપ્ત થાય છે. તે પછી તો પ્રાણી પોતાનું લક્ષ્ય સિદ્ધ કરીને કૃતકૃત્ય બની જાય છે. વળી, આત્મનિરીક્ષણુથી એ પણ જણાય છે કે, સમતા વગર શાંતિ નથી. વાસ્તવિક સમતા, કોઈ વિશેષ પરિસ્થિતિથી આવતી નથી. પરંતુ સર્વ પરિસ્થિતિઓથી ઉપરની દર્શાથી અથવા પોતપોતાના સ્થાનમાં સ્થિરતા ધારણ કરવાથી વાસ્તવિક સમતા પ્રાપ્ત થાય છે. સર્વ પરિસ્થિતિઓથી ઉપરની દર્શામાં જે સામ્ય છે તે નિત્ય અને અનંત છે, અને પોતપોતાના સ્થાને સ્થિરતા (સંતોષ) અનુભવવાથી, જે સામ્ય પ્રાપ્ત થાય છે તે, એકબીજાના પરસ્પર અધિકારીને સુરક્ષત રાખવા જેવી પ્રીતિ

કેળવાઈ, એકતા થાય છે તેવું છે. આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે વ્યકૃતગત જીવન, સામાજિક જીવનનો સમૂહ બની જય અને સામાજિક જીવન એ જ વ્યક્તિગત જીવન બની જય. પણ આ સ્થિતિ ત્યારે થાય કે જ્યારે માનવ કર્તાબ્ય કરવું એને જ પેતાનો અધિકાર સમજે, અને હુક્કોની લાલસાથી સુક્રત થઈ, નિશ્ચિંત બની જય. એવો પણ સર્વનો અનુભવ છે કે ફરેંડ પ્રવૃત્તિને અંતે, શક્તિહિનતા, જરૂરા અને પરાધીનતા વગેરે નિર્ભળતાએ આવી જય છે અને નિવત્તિ થવાથી સ્વાભાવિક રીતે જ, આપોઆપ શક્તિનો સંચય થવા માટે છે અર્થાતું પ્રવત્તિથી આવી જતી નિર્ભળતા નાશ પામે છે તેથી એવું નિર્વિવાહ સિદ્ધ થાય છે કે પ્રત્યેક પ્રવૃત્તિ શક્તિનો વ્યય અને પ્રત્યેક નિવૃત્તિ, શક્તિનો સંચય કરાવવા સમર્થ છે. જો પ્રાણી પ્રવૃત્તિના દોષોથી હુણી થઈને, તેની વાસનાથી રહીત થઈ જય અને પછી આપમેળે જ ગ્રાસ થતી નિવૃત્તિ મેળવી નિશ્ચિંત બની જય. તો ખોણે બદલે યોગ, રાગને બદલે વૈરાગ્ય, પરાધીનતાને બદલે સ્વાધીનતા તથા જરૂરાને બદલે ચિંતનતા પ્રકટે. પછી જેનાથી જતીય તથા સ્વરૂપની એકતા છે, તેનાથી અસેહ અને જેનાથી કદપેલી જ એકતા છે તેનાથી જુદાપણું થઈ જય, અર્થાતું કોઈપણ પ્રકારની વિષમતા અને જિન્નતા રહેતી નથી. એ સારી રીતે અનુભવ થઈ જય છે કે પ્રત્યેક પ્રવૃત્તિ ડેવણ છુપાયેલા રાગની વાસ્તવિક હસ્તીનો પરિચય આપે છે, અને નિવૃત્તિમાં, પ્રવૃત્તિએનો અંત થઈ, પ્રવૃત્તિ નિવૃત્તિથી અતીત, અનંત, નિય જીવનનો પાડ શીખવાય છે. બસ, આ જ આધ્યાત્મિક અને આસ્તિક જીવન છે, તેથી જ આત્માનિરીક્ષણું દ્વારા, મનુષ્ય, અત્યંત સુગમતાથી આધ્યાત્મિક ઉત્થાન, તથા વાસ્તવિક જીવનનો અનુભવ પામી, કૃતકૃત્ય થઈ શકે છે.



ધીને નિયમ

થઈ ગયેલી ભૂલ કરી નહિ કરવાનું વત લઈને સરવ વિશ્વાસપૂર્વક

આર્થિના કરવી.

જ્યારે આરમનિરીક્ષણથી, આપણે કરેલા હોષોને જેદી લઈએ છીએ, ત્યારે તે હોષ ટાળવાને માટે પ્રાયશ્વિત, વત અને તપ્ય તથા પ્રાર્થના કરવાનું અનિવાર્ય બની જય છે, કારણ કે પ્રાયશ્વિત વિના, કરી ભૂલ ન કરવાનો નિશ્ચય દઠ રહી શકતો નથી; અને વત લીધા વિના, ભૂલ કરી જિપત્ત ન થાય અને નિર્દેખતા હાંસલ થાય તેવો સંભવ નથી. વળી, પ્રાર્થના વિના વત પૂરું કરવાની શક્તિ અને નિરલિમાનતા પેઢા થવાનો સંભવ હોતો નથી.

પ્રાર્થનારહિત તપ્યથી મર્યાદિત અહુભાવની દફતા થાય છે જે જાખકને ગુણોના અલિમાનમાં કરાવે છે. ગુણોનું અલિમાન એ હોષોનું મૂળ છે. તેથી વતપાલન કરવામાં જે કંણાધિએ હેખાય તેને તપ્ય સમજુને, સહૃદ્ય સહન કરી લઈએ અને આવશ્યક શક્તિ તથા નિરલિમાનતા માટે જરૂર વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરીએ, તો હોષોની નિરૂપિત અને નિર્દેખતાની પ્રાપ્તિ આપોઆપ થઈ જય, એ નિર્વિવાદ સિદ્ધ છે. નિરલિમાનતાનું વાસ્તવિક તત્ત્વથી એ છે કે ગુણોનો સંગ ન લાગે અને હોષોની ઉત્પત્તિ ન થાય.

ભૂલને ભૂલ જાણી લીધાથી જે વેદના ઉત્પત્ત થાય છે, તે જ સાખકના મનમાં પ્રાયશ્વિત કરવાની ભાવના જાથ્રત કરે છે. કરેલી ભૂલ કરી ન થાય એ જ ખરું પ્રાયશ્વિત છે; પરંતુ એ પ્રાયશ્વિતને સચેત અને સફળ જનાવવા માટે એ અનિવાર્ય થઈ જય છે કે થયેલી ભૂલમાં જે સુખનો ઉપસોાગ કર્યો હોય, તેને હુઃખારક સમજુને, એ સુખની આસક્તિ ભૂસી નાખવી; અને કોઈ ને કોઈ પ્રકારનું તપ્ય કરવાનું રવીકારી દેતું જેથી કરી ભૂલ ન કરવાની દફતા આવી જય, અસ્ત્રાવધાની મઠી જય, હૃદયની

હર્ષણતાનો અંત થઈ જય અને કરીને એવા સુખની આશાનો અંકુર ન ફૂટે કે જેના રાગથી પ્રેરિત થઈને ભૂલ કરવામાં આવી હતી. એ જાણીતું છે કે સુખની આશાથી પ્રેરિત થઈને પ્રાણી ભૂલ દ્વારા ઉત્પન્ન થયેલાં સુખનો ઉપયોગ કરે છે, અવિવેકજન્ય, ચિત્તની અશુદ્ધિથી જ, સુખ લોગમાં પ્રવૃત્તિ થાય છે. દાખલા તરીકે, લોકના દોષથી ધનના ઉપયોગની લાલસા અને હાનિનો લય, મોહના દોષથી સંયોગ ઈચ્છાની ગુલામી તથા વિયોગનો લય, અલિમાનના દોષથી માનની લાલસા અને અપમાનનો લય, અને કામના દોષથી કામના પૂર્તિ માટેની ગુલામી અને પૂર્તિ ન થવાનો લય ઉત્પન્ન થાય છે.

પ્રાયશ્ક્રિત દ્વારા, ચિત્ત શુદ્ધ થઈ જઈને, લોગાસંક્રિત અર્થાતું સુખ-લોકુપતા મટી જય છે. સુખલોકુપતા મટી જવાથી, હુઃખ જેવી કોઈ વસ્તુ બહાર રહેતી નથી, તેમકે એવું કોઈ હુઃખ હોઈ શકે નહીં કે જેનો જન્મ કોઈ પ્રકારના સુખલોગથી થયો ન હોય.

સુખહુઃખી લાગણીનો અભાવ થતો જ હૃદયમાં આપોઆપ, આનંદની ગંગા લહેરવા લાગે છે. પ્રાયશ્ક્રિત કરવાથી વતી જીવનનો આરંભ થઈ જય છે. વતી જીવનથી જ, નિર્દેખ રહેવાની લાલસા સહાય અને સ્થાયી થઈ જય છે. તે ભૂલને ઉત્પન્ન જ થવા હેતી નથી, અને અસર્યમ અને અસાવધાનીનો નાશ કરીને સતત જગૃતિ પ્રદાન કરે છે. એમ થવાથી પ્રાણી સાધનયુક્ત જીવન દ્વારા, લક્ષ્ય તરફ પ્રગતિશીલ થાય છે અને ચોયમાં મારી કડળુંઘણોને સહૃદ્ય સહન કરી લે છે. આ જ ખરી રીતે તપ્ય છે. તપ્યથી અવશ્યક શક્તિનો વિકાસ આપોઆપ થાય છે, અને સધણી નિર્ઝણતાઓનો નાશ થવા લાગે છે.

પ્રતયુક્ત જીવન સુરક્ષિત રાખવા માટે, બાળ સરલ વિધાસપૂર્વક પ્રાર્થનાનો આશ્રય લે છે અને ભौતિકયાદી તપશ્ચર્યાનો આશ્રય લે છે. પ્રામુશક્તિનો સરદબદ્ય કરવાથી જ પ્રાર્થના કરવાનો અધિકાર પ્રાપું થાય છે. શક્તિનો સંભાળ તથા અપ્યંતર કરવાથી કરેલી પ્રાર્થના નિર્ઝળ થાય છે,

કેમકે તે અનાધિકાર ચૈણ્ટા છે. અથવા એમ કહો કે પ્રાર્થના ખરી રીતે ચલ્યની ભૂખ સિવાય બીજું કંઈ નથી. તેથી જેમ જેમ સત્યની ઐજ તથા તેની અભિવાસ સબળ થતી જય છે, તેમ તેમ પ્રાર્થના, ભક્તતનું જીવન ખની જય છે. જ્યાં સુધી પ્રાર્થના, પ્રાર્થના કરનાર તથા જેની પ્રાર્થના કરવામાં આવે છે, એ વાણે એક ન થઈ જય, ત્યાં સુધી પ્રાર્થના થયા જ કરે છે.

એ દૃષ્ટિઓ પ્રાર્થના, માવનજીવનનું આવશ્યક અંગ છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રાર્થનાથી જ નિતનવ ઉત્સાહની વૃદ્ધિ થાય છે અને અતુકૂળ પરિસ્થિતિઓમાં, તેથી પ્રાપ્ત શક્તિને. સહૃદ્ય કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી જર્વે દશામાં પ્રાર્થનાથી પ્રાણીઓનું હિત થાય છે.

પ્રાર્થના અશક્તનો અંતિમ પ્રયત્ન, સર્કણતાનું અચૂક સાધન અને આવશ્યક સામર્થ્ય પ્રદાન કરનાર મહામંત્ર છે. અથવા એમ કહો કે, એ હુભીઓની યોગ્ય સાધના છે. પ્રાર્થના પ્રત્યેક પરિસ્થિતિમાં, સુગમતા, પૂર્વક થઈ શકે છે. કેમકે તે માટે હોઈ બીજી સાધનસામયીની જરૂર પડતી નથી એ દૃષ્ટિઓ પ્રાર્થના પ્રાણીમાત્રાની સહજ સાધના છે.

પ્રાર્થના વિષે જેટલું કહીએ તેટલું ઓછું છે. કારણ કે તે નિરાશાને આશામાં, નિર્ભળતાને બળમાં અને નિર્ઝળતાને સર્કણતામાં પલટાવીને પ્રાણીને છીટ વસ્તુ પ્રાપ્ત કરવા સમર્થ છે.



ગ્રીલે નિયમ

વિચારનો પ્રયોગ પોતાના પર અને વિશ્વાસનો ધીજાંઓ પર, અર્થાત् ન્યાય પોતાના પર અને પ્રેમ તથા ક્ષમા અન્ય તરફ.

માનવ માત્રમાં વિશ્વાસ અને વિચારની શક્તિ સ્વભાવમાં વિદ્યમાન છે. કારણ કે એવો કોઈ માનવ નથી, જેનો કોઈ ને કોઈ પર વિશ્વાસ ન હોય, અને જે કાર્ય ને જાહુંતો ન હોય. પણ એ બંનેનો યથાર્થ ઉપયોગ તે જ કરી શકે છે કે જેનું જીવન સાધનયુક્ત હોય.

વિશ્વાસ એકતા પ્રદાન કરે છે અને વિચાર નિર્દેખિતા ઉત્પન્ન કરે છે તેથી પોતાને નિર્દેખ બનાવવાને માટે વિચારની અત્યંત આવશ્યકતા છે. અને જેનાથી બેદવૃત્તિનો અનુભવ થતો હોય તેનાથી એકતા સ્થાપિત કરવાને માટે, વિશ્વાસની અત્યંત આવશ્યકતા છે. વિચાર એટલે પોતાના જ્ઞાનનો પ્રકાશ આપણાં હોષોનું દર્શન કરાવે છે તેમ જ તેનો નાશ કરવાનો ઉપાય પણ અતાવે હૈ, કારણ કે વિચારથી ન્યાયની પ્રતિફળ થાય છે. તે જ ન્યાય સાર્થક છે જે પોતાના ઉપર કરાય કેમકે જેટલી સ્પષ્ટતાથી આપણે આપણા હોષ કોઈ શકીએ છીએ તેટલી સ્પષ્ટતાથી ધીજાંના જેઈ જાહુંતી શકાતા નથી. ન્યાય એ અનિષ્ટ કરનાર કોઈ વિધિ નથી. ઊંઘટું, આપણાંને સુધારનાર વાસ્તવિક ઉપાય છે.

પ્રાકૃતિક નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિત્વ પોતાની દર્શિતમાં અપરાધી બનીને રહેવાનું પસંદ કરતા નથી તથી પોતાનો ન્યાય પોતે જ કરવો એ અનિવાર્ય છે. એ તો સહુને અખર જ હોય છે કે, હુરેક હોષ કરનારને ને ભૂતકાળમાં પોતે કરેલા હોષોનું જ્ઞાન હોય છે. એ દર્શિએ જે ભૂલ કરી ચૂક્યા છે, તેના જ્ઞાનથી તે પોતાને દર્શિત માને છે. વર્તમાન કાળે એટલે કે વિચાર કરતી વખતે જે નિર્દેખિતા હોય છે, તેને સુરક્ષિત રાખવાથી, મતુષ્ય, પોતાની દર્શિએ પોતે આદર ચોઅ હોવાનો અનુભવ કરે છે. પણ જ્યાં સુધી તે સર્વાંશે નિર્દેખ બની ન જય, ત્યાં સુધી ચાલુ નિર્દેખિતા

ગ્રીલે નિયમ

વિચારનો પ્રયોગ પોતાના પર અને વિશ્વાસનો ધીજાંઓ પર, અર્થાત् ન્યાય પોતાના પર અને પ્રેમ તથા ક્ષમા અન્ય તરફ.

માનવ માત્રમાં વિશ્વાસ અને વિચારની શક્તિ સ્વભાવમાં વિદ્યમાન છે. કારણ કે એવો કોઈ માનવ નથી, જેનો કોઈ ને કોઈ પર વિશ્વાસ ન હોય, અને જે કાર્ય ને જાહુંતો ન હોય. પણ એ બંનેનો યથાર્થ ઉપયોગ તે જ કરી શકે છે કે જેનું જીવન સાધનયુક્ત હોય.

વિશ્વાસ એકતા પ્રદાન કરે છે અને વિચાર નિર્દેખિતા ઉત્પન્ન કરે છે તેથી પોતાને નિર્દેખ બનાવવાને માટે વિચારની અત્યંત આવશ્યકતા છે. અને જેનાથી બેદવૃત્તિનો અનુભવ થતો હોય તેનાથી એકતા સ્થાપિત કરવાને માટે, વિશ્વાસની અત્યંત આવશ્યકતા છે. વિચાર એટલે પોતાના જ્ઞાનનો પ્રકાશ આપણાં હોષોનું દર્શન કરાવે છે તેમ જ તેનો નાશ કરવાનો ઉપાય પણ અતાવે હૈ, કારણ કે વિચારથી ન્યાયની પ્રતિફળ થાય છે. તે જ ન્યાય સાર્થક છે જે પોતાના ઉપર કરાય કેમકે જેટલી સ્પષ્ટતાથી આપણે આપણા હોષ કોઈ શકીએ છીએ તેટલી સ્પષ્ટતાથી ધીજાંના જેઈ જાહુંતી શકાતા નથી. ન્યાય એ અનિષ્ટ કરનાર કોઈ વિધિ નથી. ઊંઘટું, આપણાંને સુધારનાર વાસ્તવિક ઉપાય છે.

પ્રાકૃતિક નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિત્વ પોતાની દર્શિતમાં અપરાધી બનીને રહેવાનું પસંદ કરતા નથી તથી પોતાનો ન્યાય પોતે જ કરવો એ અનિવાર્ય છે. એ તો સહુને અખર જ હોય છે કે, હુરેક હોષ કરનારને ને ભૂતકાળમાં પોતે કરેલા હોષોનું જ્ઞાન હોય છે. એ દર્શિએ જે ભૂલ કરી ચૂક્યા છે, તેના જ્ઞાનથી તે પોતાને દર્શિત માને છે. વર્તમાન કાળે એટલે કે વિચાર કરતી વખતે જે નિર્દેખિતા હોય છે, તેને સુરક્ષિત રાખવાથી, મતુષ્ય, પોતાની દર્શિએ પોતે આદર ચોઅ હોવાનો અનુભવ કરે છે. પણ જ્યાં સુધી તે સર્વાંશે નિર્દેખ બની ન જય, ત્યાં સુધી ચાલુ નિર્દેખિતા

સુરક્ષિત રહેતી નથી એટલું જ નહિ પણ પોતાનો અપરાધીપણુંનો ભાવ પણ નથી થતો નથી. તે કારણે જાણેલા અને કરેલા દોષોનો સર્વાંશે ત્યાગ કરવાનું અનિવાર્ય છે. પ્રત્યેક દોષ એ દોષથી જન્મેલ સુખલોલુપતાના જ્ઞાધારે જીવંત રહે છે. અથવા એમ કહો કે તે દોષની પુનરાવૃત્તિ તેથી બચા કરે છે. દોષથી વેદના અનુભવાય તો જ સુખલોલુપતાનો નાશ થાય. દોષને જાણી લેવા માત્રથી, જગૃત તો થવાય છે, પરંતુ દોષમાં જણાવેલ સુખની લોલુપતા વૃત્તિ, દોષ કરનારને પોતાની નિર્દેષીતાની રક્ષા કરવા હેતી નથી, અને તે મનુષ્ય, પોતાનામાં ઓડી નિર્દેષીતાની જલક અનુભવવાથી દોષજનિત વ્યથાને ફણાવી હે છે, એટલું જ નહિ, તે પારકાના દોષ જેવા જાળીને, પોતે નિર્દેષ અનવાની લાવસાને પણ શિથિલ કરી નાખે છે. તેનું ઘણું ભયંકર પરિણામ એ આવે છે કે, પોતાના પ્રતિ ન્યાય કરવાની ધર્યા શિથિલ થઈ જય છે અને મનુષ્ય, અપરાધી હોવા છતાં, બીજાઓની દિલિએ ચાતે નિરપરાધી હેખાયા કરે એવો હંસ કરવા માંડે છે.

પોતાનો જ ન્યાય પોતે કર્યા સિવાય એ હંસનો નાશ થતો નથી. જાપણે અપરાધી રહ્યા કરીએ અને બીજા જાપણુંને નિરપરાધી માને રાખે જેવી વૃત્તિ, જાપણુંને જાપણા ન્યાય કરવા હેતી નથી. બીજા જાપણુંને જે ન અપરાધી માને પરંતુ જાપણે જાપણી મેળે નિર્દેષ રહીને, ચેતતા રહીશું એવો દદ નિર્ણય કરીએ તો તેથી જ, જાપણુંને જાપણા પ્રતિ ન્યાય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થશે.

કરેલી ભૂલને ભૂલ તરીકે સ્વીકારી લધાએ કે તત્કાળ ભૂલની વેદના જાયત થાય છે. એમ થતાં જ માનવ પરદોષ દર્શન કરવાનો ત્યાગ કરી હે છે અને પોતે કરેલા દોષથી થતી વેદના તીવ્ર અને સંખ્યા અને છે. તેથી ભૂલ જનિત સુખલોલુપતાનો નાશ થાય છે. દોષજનિત સુખલોલુપતાનો નાશ થતાં જ, દોષ ઉત્પન્ન જ નથી થતા અને પછી નિત્ય રહેતી નિર્દેષતા અવિનિષ્ઠ રહે છે. એ જ ન્યાયનું ઝળ છે.

કરેલી ભૂલને પોતાની વિવેકબુદ્ધિના પ્રકાશથી સ્પષ્ટ ઝ્યમાં જાણી

દેવી, ભૂતજનિત પીડાથી પીડિત થવું અને ભૂતજનીત સુખદોદ્યુપતાનો સર્વાંશો નાશ કરવો તેમ જ નિત્ય રહેતી સ્વતઃસિક્ષ નિર્દેખતાથી અભિજ્ઞ રહેવું એ જ વાસ્તવિક ન્યાય છે, જે હુરેક માનવ પોતા પ્રત્યે પોતાની મેળે જ કરી શકે છે. વાસ્તવિક ન્યાય કોઈ ધીજ દ્વારા થઈ શકતો નથી. તેથી પ્રત્યેક લાઈબહેને, પોતાનો ન્યાય, પોતે જ કરવો એ અનિવાર્ય છે.

નિર્દેખતાથી અભિજ્ઞ અન્યા છતાં, કોઈ આપણુને દોષિત માન્ય કરે, તો તેથી જરા પણ ચિંતિત કે ભયભીત થવું ન જેધાય. વિશેષભાં નિશ્ચિંતતા તથા નિર્ભયતાપૂર્વક શાંતિ અને પ્રસંગતાની સતત રક્ષા કરવાનું સંપૂર્ણ રીતે આવશ્યક થઈ પડે છે. વાસ્તવિક ન્યાયની પ્રતિષ્ઠા અન્ય દ્વારા થઈ શકે નહિ. ન્યાય તે જ કરી શકે જે અપરાધીને અપરાધીના જાણીને હુણી થાય છે. અપરાધના ઘફલામાં શિક્ષા કરી હુઃખ દેવાની વૃત્તિ રાખવાથી, ન્યાય થવાનો સંભવ નથી, કરુણ કે ધીજ અપરાધી છે, એ જાણુવાથી આપણુને જે પીડા થાય તે તો કરુણાને ઉત્પન્ન કરે છે. જેના પ્રત્યે કરુણાની વૃત્તિ થાય છે તેનું હિત કરવાનું કરુણાથી દ્રવિત થનારને ઈષ હોય છે, હિત અપરાધનો નાશ થાય તેથી થાય છે, અપરાધીના નાશથી નહિ. અપરાધી નિરપરાધ અની જય એવી સર્વભાવના સ્વભાવથી આપણા પ્રતિ આપણુને થાય છે. અથવા વીતરાગ તત્ત્વવેતા મહાપુરુષો જેના જીવનમાં સર્વાત્મભાવનો પ્રાદુર્ભાવ થયો હોય તેને થાય છે. તેથી જ નિયમો અનાવવાનો વાસ્તવિક અધિકાર વીતરાગ, તત્ત્વવેતાઓને જ છે, ધીજાનોને નહિ.

જે લાઈબહેનોનું હૃદય કરુણાથી ભરપૂર નથી હોતું, તેના દ્વારા થયેદો ન્યાય, ખરી રીતે ન્યાય નથી. તેઓ તો અપરાધીને પીડા આપી, અશક્ત અનાવી, ધીજાનો પ્રત્યે થવાના અપરાધીએ અટકાવવાનું કરે છે, પણ અપરાધીને ખિયારાને તેઓ નિરપરાધ અનાવી શકતા નથી. નિરપરાધ થયા જિવાય, ધીજાનો પ્રત્યે થનારી બૂરાઈ કરવાની પ્રવૃત્તિનો નાશ થઈ શકે બલા? કદાપિ નહિ. એ દસ્તિઓ, કોઈ પણ રાજ્ય, ન તો વ્યક્તિને નિર્દેખ અનાવી શકે કે સમાજમાં સર્વાંશો નિર્દેખતાની સ્થાપના

કરી શકે. એ એમ અની શકતું હોત, તો કોઈ દેશમાં, ગુપ્તથર ન્યાય-
સ્વામી, કેદખાનાં, લશ્કર કે પોલીસ વગેરેની આવશ્યકતા જ ન પડતા; વિભાગનિક વેજાનિક રીતોનો ઉદ્ભબ ન થાત અને સમાજની શક્તિ અને
સંભળની ઘણેં મોટો વ્યય, વિનાશકારી કાર્યોમાં ન થાત. શું કોઈને
એ વાદુંબામાં નથી કે યુદ્ધ પછી વિજય પામેલ હેશ, પરાજિત દેશને
અસુધુલ અનાવવાને. પ્રયાસ કરે છે ? તેનું પરિણામ એ આવે છે કે પરા-
જિત હેશ દ્વારાને શક્તિ એકીકૃત કરીને યુદ્ધ કરવા તત્પર થાય છે. કોઈને
નિર્ણય કરી, ભયભીત કરીને દ્વારાને યુદ્ધ નિર્ભયવલું એ જ શું ન્યાય
હોય શું એવા ન્યાયથી શાંતિની સ્થાપના અને સંધર્ષની નાશ થઈ
જાકે હોય ? વ્યક્તિ અને સમાજમાં નિર્દેખિતાની ગંગા દહેરાવી શકાશે ?
કાચિ નહિ. પણ જે માનવ સમાજ, પોતાનો ન્યાય પોતે કરવાનું સ્વી-
કરે તે નિર્દેખ જીવનથી અલ્યાંત સુગમતાપૂર્વક સમાજમાં નિર્દેખિતાની
સ્થાપના થઈ શકે છે. પરસ્પર ઘર્ષણનો નાશ થઈ શકે અને વિધમાં
શાંતિની સ્થાપના થઈ શકે એ નિર્દેખિત સિદ્ધ છે.

સ્વાભાવિક રીતે જ, પ્રત્યેક વ્યક્તિના જ ધારણામાં વિવિધતા
હોય છે. તે એવે સુધી કે પિતા, પુત્ર, સહોદર ભાઈઓનાં રૂચિ,
સંસ્કાર, લાયકાત, સામર્થ્ય વગેરેમાં પણ સમાનતા નથી હોતી. અપ-
સાધની પ્રવૃત્તિના મૂળમાં વ્યક્તિગત સુખનો મોહ હોય છે. ધીજના
લુક્ઝાન, વિનાશ તથા હુઃખથી, પોતાનું સુખ મેળવલું એ જ મૂળ
અભિજ્ઞાન હોય છે. તથી જીવનમાં નિર્દેખિત ત્યારે જ વિકસે, કે જ્યારે માનવ
વ્યક્તિના સુખદોષપતાનો ત્યાગ કરે. કોઈ ધીજ માટે એવો કોઈ
સાચોંદ્ર નથી કે નેથી જણી શકાય કે તેની સુખદોષપતા કેટલા
હુંણ કે ત્યાંથી મટાડી શકાય. એમ હોવાથી જ, અન્યથી ન્યાય થઈ
જાઓં નથી. ભૂતથી વધારે સંજ થઈ જય તો અપરાધીના મનમાં
સૌંચે અને હૈંદું ઉત્પન્ન થાય છે. તથી તે કર્ત્વબ્રહ્મ બાંની ઘોર અપરાધી
જને છે. એ અપરાધ કરતાં સંજ એઠી થાય તો અપરાધી લોલાય છે

अने इरी अपराध करवानी तेने वृत्ति थाय छे. न्यायनी मतवण डोहने सज्ज करवानी नथी, परंतु अपराधी पोते पोतानो अपराध जाणी लर्हने निरपराधी अनवाने माटे उपर थर्ह जय ए ज वास्तविक न्याय आजाय.

हुवे डोह एम कहे के अपराधी पोतानो अपराध कथूल करवा राणु होतो नथी अने तेनाथी निर्णयोने ते बहु भीड़ पहेंचाडे छे एवी स्थितिमां शुं तेने अणपूर्वक रोकवे। न कंधाए ? ए कठखाई विशे गंभीरतापूर्वक विचार करवाथी एवुं प्रतीत थाय द दे जे भाषा तथा प्रदोषनथी होराई गयेत अपराधीने सहजार न मणे अने तेना उपर कोध पछु करवामां न आवे, तो कोह अपराधी, भीजनी महाद के उत्तेजन विना, एकदो अपराधमां प्रवृत्त थतो नथी। खूराईने उत्तेजन मणे तो खूराई पोषण पामे छे. निर्देष जुवनथी ज, निर्देषिता वृद्धिगत थाय छे. अणात्कारे होयो हानावी शकाय पछु निभूण थर्ह शके नाहि. अणना सहुपयोगवी निर्णयोने सभण गनावी शकाय छे अने अणनो हुकुपयोग सभणने निर्णण अनावीने, प्रतिहिसानी लावनाने उत्पन्न करे छे. निर्णण सभण थर्ह जय ए न्याय छे; सभणने निर्णण अनाववामां न्याय नथी. समग्र अने निर्णण वन्ये एकता थर्ह जय ए न्याय छे. परस्पर संवर्पने जन्म हेवो ए न्याय नथी, ठिंतु न्यायना वेशमां द्वार अन्याय ज छे. आ सघणां कारणेणी, ए स्पष्ट जणाय छे के न्याय पोतानो पोताना द्वारा ज थर्ह शके छे अने ते रीते निर्देषिता साथे अलिङ्गता थर्ह शके छे.

जे प्राणी, न्यायपूर्वक, पोतानो सुधार पोते ज करी ले, तो पछी तेने राष्ट्रीय, सामाजिक के स्वाभाविक न्याय के सज्जनी आवश्यकता ज नथी रहेती, अर्थात् ते भीजना शासनथी हंसेशने माटे मुक्त थर्ह जय छे. शासननी आवश्यकतानो उद्य त्यारे ज होय छे के ज्यारे प्राणी पोताना उपर विवेकनु शासन करतो नथी. भरी स्वाधीनता प्राप्त

કરવાને માટે, પોતાના ઉપર પોતાનું શાસન અર્થાત્ પોતા ઉપર પોતાનો કલાણે કે ન્યાય કરવો એ પરમ આવશ્યક છે. એમ થાય તો તે. પ્રાણીને જિહ્વાનું અનાનવાને સમર્થ છે. આપણે એ જ શીખવાનું ને શીખવાનું છે કે કેના જેનાથી, જેટલી વિશેષ નિકટતા હોય, તેટલો તેના તરફ કરક ન્યાય કરવો જેઠાં એ દિલ્લિએ આપણાં મન, ઈદ્રિય વગેરે ઉપર આપણે સુર્વથી કઠોર ન્યાય કરવો જેઠાં અને જેમ જેમ હર ને હુસનો સંભાષ થતો જય તેમ તેમ ન્યાય ને પ્રેમને ક્ષમામાં અફલતા બતું જેઠાં. નિકટવતીઓનો સુધારો ન્યાયથી અને હૂરવતીઓનો સુધારો. પ્રેમ તથા ક્ષમાથી જ થવાનો સંભવ છે.

સંયમ, તપ, ઉદાસીનતા, નિયંત્રણ, અસહયોગ, ઉપેક્ષા વગેરે ન્યાયનો જ અંગ છે. તે વિના નિકટવતીઓનું હિત થવા સંભવ નથી. ન્યાય કરવામાં હમેશાં દ્રેષ્ટના નહિ પણ હિતની કામના વિદ્યમાન રહે છે. લાલચ તથા જયરહિત થવાથી, પ્રાણી, ન્યાયના વાસ્તવિક સ્વરૂપને જાળી શકે છે અને તેનો પ્રયોગ કરી શકે છે. ન્યાયમાં હુરાઅહુ, કોધ કરેને વિકારને માટે કોઈ અવકાશ જ નથી, કારણ કે કોધની ઉત્પત્તિ લો જેતાની કામનાપૂર્તિ માટે છે. પણ ન્યાયમાં તો, જેના પ્રતિ ન્યાય કરવો હોય, તેના હિતની લાલસા રહે છે. ન્યાયમાં સત્યાઘ્રહ હોય છે, હુરાઅહુ નહિ. ન્યાયનો જન્મ વિચારથી થાય છે, પ્રમાદથી નહિ. સત્યાઘ્રહ, અસત્યનો નાશ કરીને, સત્યથી અસેહ કરવે છે. એ દિલ્લિએ, સત્યાઘ્રહ આવકારહાયક અને હુરાઅહુ નિંદાપાત્ર છે. ન્યાય કોઈના ઝાણી સહેલા હેતો નથી. ન્યાય પોતાને ક્ષમા નથી આપતો. ન્યાય બળનો હુરુખ્યોગ થવા નથી હેતો. ન્યાય નિર્ણયને સબળ અને બળવાનને ઉદાર અનાનવાસમર્થ છે. ન્યાય, બળપૂર્વક અન્યાયનો નાશ કરવાનો પક્ષ કરે છે; અથડત અસંયમીને સંયમી, સંગ્રહપોરને ઉદાર, સ્વાધીની અરજાની અને હિંસકને અહિસક બનવાની પ્રેરણ આપે છે. ન્યાય પૂર્વીનું બળનો ઉપ્યોગ કરવાથી કોઈના વિનાશ થતો નથી કે કોઈના

અધિકારનું અયહરણ થતું નથી. ન્યાય, પ્રેમ અને ક્ષમાને પોષે છે. તેનો વિરોધી નથી. ન્યાય, સમતાપૂર્વક એકતાનું સમર્થન કરે છે અર્થात્ પોતાપોતાના સ્થાન ઉપર સર્વને અધિકાર સુરક્ષિત રહે, સર્વના વિકાસનાં સાધનો લભ્ય હોય અને કર્ત્વબ્યપરાયણુતા એ જ હરેક પ્રાણી પોતાનો અધિકાર માને એવું વિધાન કરે છે. અધિકાર તો કર્ત્વનો દાસ છે. ખીજ કોઈની ઉદ્દારતાથી કોઈના અધિકારની રક્ષા કાયમ માટે થઈ શકતી નથી. તેથી પોતે જ પોતાનો ન્યાય કરી, કર્ત્વબ્ય દ્વારા, ખીજના અધિકારની રક્ષા કરવી એ જ પોતાનું કર્ત્વ માનવું જેઠાં ખીજના અધિકારની રક્ષા કરવાનો, પોતાનો અધિકાર માનવો એ જ ખરી રીતે પ્રેમ છે.

ખીજાએ પ્રત્યે તો પ્રેમ અને ક્ષમા જ કરી શકાય ક્ષમાશીલતા એ મોટું બળ છે, કાયરતા નથી. ક્ષમાશીલતા સિવાય, વેરભાવનો સર્વાંગો નાશ થઈ શકતો નથી. એકતાની માતા, નિર્વિરતા છે. સેફ અને જુગાપણુનો નાશ થતાં જ, પરસપર સનેહની એકતા થઈ જય છે અને પછી સંગ્રહણ ધર્મબ્ય કાયમ માટે હૂર થઈ જય છે. હુવે જાંભીરતાથી વિચાર એ કરવો રહ્યો કે ક્ષમાશીલતાનું સ્વરૂપ શું છે. જેણે પોતાના પ્રત્યે જોડું આચરણ કર્યું હોય, તેણે પોતાને હુષ્ટ બનાવ્યો નથી શું? પોતે હુષ્ટ ન હોય તે કોઈના પ્રત્યે જોડું આચરણ કરી શકે શું? કહાપિ નહિ. પોતાના પ્રત્યે કોઈ ખરાણ વર્તન કરે તો તેનું હુઃખ તો સર્વ પ્રાણીઓને સ્વાભાવિક રીતે જ થાય છે, પણ જે ક્ષમાશીલ મહાયુરુષ હોય છે તેને તો એ વાતનું હુઃખ થાય છે કે બિચારો જેણે જોડું કર્યું હોય તેણે પહેલાં પોતાને હુષ્ટ બનાવ્યો છે તેથી તેનાથી ખીજ તરફ હુષ્ટ આચરણ થાય છે. જે તે હુષ્ટ ન હોય તો તેનાથી કોઈ પ્રત્યે ખરાણ આચરણ ન થાત. સ્વાભાવિક નિયમ પ્રમાણે તો કોઈને લલા બનાવવાનો ઉપાય, તેના પ્રતિ લલાઈ કરવી, તેને હુષ્ટ માનવો નહિ, તેનું ભુંડું થાય એવું ઈચ્છાવું નહિ અને તેના પ્રત્યે કોઈ પણ પ્રકારનું


જાતું કર્તાન ન કરવું, એ છે. આવું ત્યારે જ પણો શકે કે જ્યારે જાતું એક સિદ્ધાંત તરીકે સ્વીકારી લઈએ કે, ન્યાય પોતાનો અને ક્ષમા નાથ પ્રેમ બીજાનો પ્રત્યે કરવાનું અનિવાર્ય છે. પ્રત્યેક કર્મ, કર્તાનું કૃપાનું હો, અર્થાત् કર્મના રૂપે કર્તા પોતે જ પ્રકટ થાય છે અને કર્મ કોણે જ હુંખ બને છે. એ દસ્તિઓ, કર્તા, કર્મ અને હુંખ એ કર્તાનાં જ સ્વરૂપ છે. જેણે આપણા પ્રત્યે જોડું આચરણ કર્યું છે તેણે પોતે જાતું હો એવો પોતાનો પરિચય આપ્યો છે. પણ તેથી એમ ન થશું જોડાને કે આપણે તેના બહલામાં, તેના તરફ ખરાળ વર્તન કરીએ. જોટું જ નહિ પણ ખરાળ આચરણ કરવું હોશે તો આપણે પોતાને જાતું બનવું પડશે. કોઈ આપણા પ્રત્યે જોડું કરે તેથી આપણુંને જોટું નુકસાન નથી થતું કે જેઠલું પોતે ખરાળ બનવાથી આપણે જોડાની લંઘાને છીએ. તેથી વ્યક્તિગત અને સાર્વજનિક હિતની દસ્તિએ જિયારાં, ક્ષમાશીલતાપૂર્વક પોતા પ્રતિ ખરાળ આચરણ થવાનું હોય તેના બહલામાં ભાવાઈ કરવી એ અતિ આવશ્યક છે. એ ત્યારે જ સંભાળિત થણે કે જ્યારે, જેણે જોડો આચાર કર્યો છે, તેની ખૂરાઈ જાણીને જાપણું વેદના થાય. તેની ખૂરાઈથી ક્ષોલ અને કોધ ન હોય. કોધ-નહિન થવાથી કર્તાબ્યની, પોતાના યથાર્થ સ્વરૂપની અને પ્રેમાસ્પદની સ્વરૂપ સ્વરતઃ જાગ્રત થાય છે. એ દસ્તિએ ક્ષમાશીલતા ઘણું મહત્વવાળો ગુણ છે. તેમાં સર્વાનું હિત રહેલું છે. ક્ષમાશીલતાની ભૂમિકામાં જ પ્રેમનો આવિલ્લાવ થાય છે અને તે જ ખરું જીવન છે.

આકૃતિક નિયમ એવો છે કે ક્ષમાશીલતા સાધ્યા સિવાય પર-સ્વરતા વિકાસનો સંભવ નથી. ખૂરાઈના બહલામાં ખૂરાઈ કરવાથી, ઉત્તરોત્તર ખૂરાઈની જ વૃદ્ધિ થાય કરે છે, કારણ કે, ખૂરાઈની પ્રતિક્રિયા ખૂરાઈ જ હોય છે. તેથી ખૂરાઈનો અંત, ખૂરાઈ ન કરવાથી જ થાય. એ દસ્તિએ સર્વાંશમાં લેહ તથા જુહાપણાનો નાશ કરવા માટે, ક્ષમા નાથ પ્રેમ સમાન બીજું કોઈ સર્કણ સાધન નથી. પ્રેમ, લિઙ્ઘતાને

નેત્રામાં, કોઈને ક્ષમામાં, સંકુચિતપણાને વ્યાપકપણામાં અને કૃપણુતાને ઉત્તુલામાં દેવની નાખે છે. પછી, બહારની ભાષા, વેશ, વર્ણ અને કર્મ નેત્રેને ગુદ્ધ ડેવા છતાં, પ્રીતિની એકતા સુરક્ષિત રહે છે, કેમકે પ્રેમ જિલ્લા નવી પ્રીતિનો પોષક અને રક્ષક છે. પ્રેમની ઉત્પત્તિ સરળ વિશ્વાસથી સાચવા યથાર્થ જ્ઞાનથી થાય છે. જેને આપણે પોતાનું માની કરું જોઈ તેની સાથે આપોઆપ પ્રેમ થવા લાગે છે અને જેને આપણે જરૂર પ્રકારે એળાખી લઈએ છીએ, તેની સાથે પણ આપણને પ્રેમ કાય છે અધૂરો વિશ્વાસ તથા શંકાયુક્ત જાણુકારી, પ્રેમના જિલ્લામાં છે. પ્રેમ જિલ્લાય, નિત નવ રસની પ્રાપ્તિનો સંભવ નથી. રસનીકિનું લુચન નિરથી છે. રસયુક્ત થવાથી જ જીવનની સાર્થકતા છે. સંકુલા લુચન કોઈના પણ હુંખુંનું કારણ બનતું નથી, કેમકે પ્રાણી પોતે જિલ્લા હોય તો બીજાઓ પણ હુંખી થાય છે. જેનું હૃદય રસ અને પ્રસંગતાથી ભર્યું હોય, તેનાથી જ સમાજમાં પ્રસંગતા પ્રાપ્ત થઈ શકે છે. પ્રસંગતા સહા, જેના હૃદયમાં પ્રેમ અને ક્ષમા લર્પૂર હોય, તેના હૃદયમાં જ નિવાસ કરે છે. કોઈ પાસે ક્ષમા માગવાથી નિર્દેખિતા અને ક્ષમા આપવાથી નિર્વેરતા આપોઆપ આવી જય છે. વૈરાધિ નીકિન હૃદયમાં જ પ્રીતિની ગંગા દહેરાય છે. પોતા પ્રાત થયેલ અપનાની ક્ષમા આપવાથી અને પોતે કરેલા અપરાધોની ક્ષમાની યાચના કંઠો એ જોડું બળ છે, નિર્ણયિતા નથી. ક્ષમાની યાચના કરવાનો પાસાનિંદ્રાની સર્થી એ છે કે જે અપરાધની ક્ષમા માગવામાં આવી છે, તે કરુંનાથ જવિષ્યમાં કરી કોઈ તરફ કરવામાં નહિ આવે અને ક્ષમા આપવાનું તાત્પર્ય એ છે કે, આપણા પ્રતિ થયેદી બૂરાઈ, સહા માટે ગુદ્ધી કરી અને હૃદય નિર્વેરતા અને પ્રેમથી લરાઈ જય. નિર્વેરતા વિના કરુંનાનું બર્થલુ મરી શકે નહિ અને નિર્વેરતાતો ક્ષમારીલતા તથા પ્રેમ જિલ્લા સંભવ નથી. કેવળ બળના પ્રયોગથી, અથડામણ થોડા વખત માટે રહાઈ જાય છે પણ નમૂંણ ન થાય. બળ તો નિર્ણયોનો સધિયારો

છે, બીજુ' કાંઈ નથી. અર્થात् બળ દ્વારા નિર્ભળતાનો વિકાસ અને રક્ષાનું સાધન ઉત્પત્ત થએ શકે છે. બળનો ઉપયોગ કોઈના વિનાશ માટે કરવો એ પોતાને નિર્ભળ બનાવે છે. કેમકે તેથી પ્રતિહિંસાની ભાવના જગૃત થાય છે અને કાળાંતરે ઘોર સંધર્ષ ઉત્પત્ત થાય છે.

પોતે નિર્દેખ રહેવા માટે અને પરસ્પર પ્રીતિનો સંચાર અને અથડામણુના પ્રસંગો નિર્મળ કરવા માટે, પોતાના ઉપર ન્યાય અને અન્ય પ્રતિ પ્રેમ તથા ક્ષમાનો પ્રયોગ કરવો એ અતિ આવશ્યક છે.



ચોથે નિયમ

જિતેંદ્રિયતા, સેવા, લગ્નવત્તુ ચિંતન અને સત્યની શોધ દ્વારા આપણા જીવનનું ઘડતર. આપણું ઘડતર કરવા માટે અર્થાતું આપણને સુંદર બનાવવા માટે, ઈદ્રિય લોહુપતાથી છૂટી, જિતેંદ્રિયપણા તરફ, સ્વાર્થનો ત્યાગ કરી સેવા તરફ, વિષયોનું ચિંતન અથવા નિરથ્યક ચિંતા છોડી લગ્નવત્તુ ચિંતન અને ઉપયોગી ચિંતન કરવા તરફ અને અસત્ય છોડી સત્ય તરફ, પ્રગતિ કરવાનું ધણું જ આવશ્યક છે. કારણું કે જ્યાં સુધી, પ્રાણી, પોતાના ઉપર પોતે શાસન જમાવે નહિ, પોતે સ્વીકારી લીધેલી પરાધીનતાઓનો ત્યાગ કરીને, સ્વાધીન ન થઈ જાય, નિરથ્યક ચિંતન અને કર્મો છોડી ન હે, પોતાને સહૃદય અને ઉદાર ન બનાવી લે, સત્યનો પ્રેમ પાડો ન કરી લે, ત્યાં સુધી તે, પોતાને સુંદર બનાવી શકશો નહિ એ નિવિવાદ સિદ્ધ છે.

ઈદ્રિય લોહુપતા અવિવેકથી જિદ્ધિ પાએ છે. જે મનુષ્ય પોતાનામાં રહેલી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને, શરીર, ઈદ્રિય, પ્રાણું, મન, બુદ્ધિ વગેરે સમસ્ત દર્શયથી, પોતે આલભ થઈ જાય, તો ધણી સુગમતા-પૂર્વક જિતેંદ્રિયપણું મેળવી શકે; અર્થાતું લોગ કરતાં લોકતાનું ભૂલ્ય વધી જાય છે, તંત્ત થતાં જ લોગની હુચિને ખાલે તરવજિજાસાસા અને પ્રેમાસ્પદ-(ઇન્નિવર)નો પ્રેમ સિદ્ધ થાય છે. એ દસ્તિંગ શરીરાદિથી અનાસક્ત રહેવાનું અનિવાર્ય છે. અનાસક્તિ કોઈ અભ્યાસથી નથી સિદ્ધ થતી, પરંતુ આત્મ પ્રકાશિત વિવેકનો આદર કરવાથી જ સાધ્ય છે. સમસ્ત અભ્યાસ શરીરના તાદીત્યથી જ ખને છે. કર્મની ઇચ્છા જ દેહાભિમાનને પોષે છે અને દેહાભિમાનથી જ સુખનું પ્રલોલન અને હુખને લય ઉત્પન્ન થાય છે. આનો અર્થ એમ નથી કે મનુષ્ય પ્રાણી, પ્રામુખ પરિસ્થિતિનો સદ્ગુરૂપયોગ ન કરે, કર્મ કરવાનાં ઇણ તરીકે કાંઈ પ્રામુખ કરવાનો ને લોલ હોય છે, તેથી જ મનુષ્યનું દેહાભિમાન વધે છે અને તેમ

બનતો, જિપજ થયેલ વસ્તુઓમાં સત્યતા, સુંદરતા અને સુખ આપવા. જીએ જિયાત થાય છે. એ જ ઈદ્રિય લોહુપતાની ભૂમિકા છે તેથી એ જિયાત સિદ્ધ થાય છે કે પ્રણે શરીરની અલિંગ થવાથી જ ખરી જિતે-જિતાને અવિજ્ઞાવ થઈ શકે છે.

દેખાલિમાન હાથ ત્યાં સુધી, બાળાત્કારે જિતેંદ્રિય બનવાનો પ્રયત્ન જિયાતજિતાનો નાશ કરવામાં સમર્થ થતો નથી. તપ દ્વારા, થોડા સમય ચાટે, જિયાતજિત હયાઈ જાય છે પણ નિર્મળ થતી નથી. એ કારણે જિયાતજિતાનો નાશ તો, માત્ર વિચારથી જ સંભવિત છે. વિચારદૂપી જીવની ઉદ્દ્દ્ય થતાં જ, વિષયાસક્રિત ઝૂપી અંધકાર આપોઆપ નાશ પામે છે. તે સહિતે તપ અને ત્યાગ બેઠના દ્વારા જ જિતેંદ્રિયપણું સિદ્ધ થઈ શકે છે. તપની શક્તિનું સંપાદન થાય છે અને ત્યાગથી નિર્વાસના થાય છે. કેબી સર્વાંશમાં આસ્ક્રિતઓનો નાશ થઈ જાય ત્યારે ખરી જિતેંદ્રિયાના થાય.

દનિદ્રય લોહુપતા, ક્ષણિક સુખ તરફ આકર્ષે છે અને જિતેનિદ્રય-સુખ. હિતની પ્રેરણા આપે છે. સુખ અને હિતમાં એક મહાન લેદ છે. તે એ કે સુખનો લોળી, વસ્તુઓ, વ્યક્તિઓ અને અવસ્થા તથા પરિસ્થિતિ-ચીને જાણ થઈ જાય છે; અર્થાત् સ્વાધીનતાને બદલે પરાધીનતા હંમલ કરે છે, એનું જ નહિ પણ તેનામાં શક્તિહીનતા, હૃદયની કઠોરતા અને પરિચિતા વગેરે અનેક નભળાઈએઓ, આપોઆપ ઉત્પન્ન થઈ જાય છે, તેથી જિદ્ધ કે હિતનો આશ્રય લઈએ તો પરાનધીનતામાંથી સ્વાધીનતા, હૃદયહીનતામાંથી સહૃદયતા, સંકુચિતપણું કે લેદભાવમાંથી નભળાઈએઓમાંથી ઉત્પન્ન જને અસેદભાવ તથા સખળતા ઉત્પન્ન થાય છે, કારણું કે હિતઘુદ્ધિ. અહિતઘુદ્ધિનાંથી આત્મવૃત્તિની પ્રેરણા કરે છે. હિતનો અભિતાષી, ‘આ’ (અનુભૂતિ) ‘હુ’ (સત) તરફ પ્રગતિ કરે છે. અર્થાત् તે દશથી વિસુખ થઈ, જરૂરે પ્રકાર આપનારનો આધાર અહુણ કરે છે. પછી તો વિષયો ઈદ્રિયોમાં, દાઢિયો જનમાં, મન બુદ્ધિમાં અને બુદ્ધિ, જે એ સર્વથી અલગ (પર-

અતીત) છેતેમાં લીન થઈ જય છે. એ પ્રકારે યુદ્ધિમાં સમતા થવાથી મનમાં નિર્વિકલ્પતા થઈ જય છે; પછી ઈંદ્રિયો, વિષયોથી મોહું ફેરવી લઇને, મનમાં સંસ્કારંત થઈ જય છે એ જ બસ જિતેન્દ્રિયતાનું વાસ્તવિક રવરૂપ છે. જિતેન્દ્રિયપણું સધાયાથી શક્તિહીનતા અને પરાધીનતાનો અંત આવી જય છે, કેમકે ઈંદ્રિયના જયથી, આવશ્યક શક્તિનો વિકાસ આપોઆપ થવા લાગે છે.

પણ જ્યાં સુધી સ્વાર્થનો ભાવ નિર્મળ નથી થઈ જતો. ત્યાં સુધી જિતેન્દ્રિયપણાની ઉત્કટ લાલસા જાગ્રત નથી થતી. તેમ થયા વિના માનવ સત્યપણ્ય ઉપર પ્રગતિ કરી શકતો નથી. એ દશિએ સ્વાર્થભાવનો નાશ કરવો અનિવાર્ય છે. સ્વાર્થભાવ ગાળી દેવા માટે સુખની આસક્તિનો નાશ કરવો અનિવાર્ય છે. સેવામાં પ્રવૃત્ત થવાથી જ તે સાધ્ય છે. સેવાનો પ્રાહુર્ભાવ, હુઃખીએને દેખી કરુણા ઉત્પન્ન થવાથી અને સુખીએને દેખી પ્રસન્ન થવાથી થાય છે. સેવા વિના સુખનો લોલ નિર્મળ નથી થતો, કારણ કે સુખનો સહૃદ્યુય સેવા કરવાથી જ થાય છે. સેવાભાવનો પ્રાહુર્ભાવ થતાં જ પ્રાણીમાત્રથી એકતા અનુભવાય છે. એમ થવાથી હુઃખીએને દેખીને સેવા કરનારનું હૃદય કરુણાથી લર્પૂર થઈ જય છે અને પછી તો તે સેવા કરનાર. પોતે જ સુખના ભાગી હોય છે, તેની લેટ પ્રેમપૂર્વક હુઃખીએને કરી દે છે. એમ કરવાથી એ સેવા કરનારની સુખમાં મહાલવાની લોહુપતાથી થતી ગુલામી નિર્મળ થાય છે. તે જ વિકાસનું મૂળ છે. સ્વાલાવિક નિયમ પ્રમાણે શરીર કે વિશ્વના ભાગ પડી શકતા નથી. ઈંદ્રિયો જુદી જુદી હોવાના વિચારે જોઈએ તો પણ શરીર અને શરીરના અવયવોની એકતા જ છે. એ જ પ્રમાણે સમસ્ત વિશ્વ સાથે પણ મનુષ્યની એકતા આપોઆપ સાખિત છે. એ એકતા, હુઃખીએને દેખીને કરુણા અને સુખીએને દેખીને પ્રસન્નતા ઉપજાવે છે. કરુણાથી સુખ લોગવવાની લાલસાનો નાશ થાય છે અને પ્રસન્નતા નિષ્કામપણું પ્રકટાવે છે (તેનાથી મનુષ્યનો અલેદ કરે છે.) લોગની રૂચિનો નાશ થતાં જ ચોગ અને નિષ્કામતા પ્રાપ્ત થવાથી અનાસક્તિ આપોઆપ પ્રાપ્ત થાય છે. ચોગથી

સહિત અને અનાસહિતથી સ્વાધીનતા આપોઆપ આવે છે, એ દિશિએ, કેવાલ ઘરી મહત્વની વસ્તુ છે. એટલું જ નહિ, સેવા સેવકને સેવ્યથી સેવાની અનાવે છે. અથવા એમ કહો કે સેવકનું અનુભૂતિબાબત સેવાભાવથી જુદી કંઈ સ્વિતિમાં નથી. સેવા, સેવ્યનો સ્વભાવ અને સેવકનું જીવન છે. કેવાળી સેવ્યને રસ મળે છે અને જગતનું હિત થાય છે. મુંદ્ર સુમાજનું નિસ્સાનું માત્ર સેવાથી જ બને છે. સેવાથી જીવન જગતને અને સેવ્યને માટે ઉપયોગી સિદ્ધ થાય છે. સેવાભાવ જાગ્રત થવાથી પ્રાપ્ત વસ્તુ, લાયકાત અને શક્તિનો સહિત્ય આપોઆપ થવા લાગે છે કે જગતને માટે ઉપયોગી થાય છે. સેવાભાવથી, પોતાને પ્રાપ્ત વસ્તુ ઉપરની ભમતા તથા જગતની વસ્તુની કામના નાશ પામે છે, સેવાથી પરાધીનતાને બદલે સ્વાધીનતા, બદાને બદલે ચિન્મયતા અને મૃત્યુને બદલે અમરત્વના ભાવમાં કીન રહે રહ્યાય છે. એ દિશિએ, સેવા આપણે પોતાને માટે ઉપયોગી જગતું સેવા સેવ્ય પ્રત્યેની આત્મીયતા જાગ્રત કરે છે. આત્મીયતામાં જ જગતું, જગત, નિત નવ રસ રહેલ છે. તે રસ સેવ્યને મળે છે તેથી જ સેવા કેવને માટે ઉપયોગી છે. જેના પ્રત્યે માળું અવિયળ આસ્થા રહ્યાં હે. સેવા, આધિકૌતિકવાહીઓને વિશ્વપ્રેમ, અધ્યાત્મવાહીઓને જગતસહિત અને લક્ષ્યોને પ્રભુપ્રેમ પ્રદાન કરવા સમર્થ છે. પ્રેમનો આરંભ ખોલ્યો કેંઠના પ્રતિ થાય છે પણ આપરે વ્યાપક થઈ જાય. કારણ કે નિષાનકારિકો જુદી જુદી હોવા છતાં, વાસ્તવિક જીવન તો એક જ છે. સેવા જગતનાં અલેદ પામવાને માટે, માનવમાત્રને સેવા જ સાધન છે.

સેવા નિયમ કે કે સેવા જેને ઉદેશીને થતી હોય તેની જ પ્રીતિ સેવા જાળવે જની જાય છે. પ્રીતિનો આરંભ, આત્મીયતાપૂર્વક સ્મરણ ચિહ્નાની જ થાય છે. સ્મરણ કરવું નથી પડતું. જેની સાથે આત્મીયતા હોય હે તેનું સ્મરણ આપોઆપ રહ્યા કરે છે. એ તો સૌ જણે છે કે જગતું, જેની સાથે આત્મીયતાનો અનુભવ કરે છે અને જેને પોતાના

માને છે, તેનું ચિત્તન આપોઆપ થવા લાગે છે. એ દર્શિયે ચિત્તન કેઈ ખાસ અભ્યાસનું નામ નથી, અર્થાતું સ્વાભાવિક આવશ્યકતા અને પ્રિયતાની જગૃતિ એ જ ચિત્તન છે. સેવ્ય સાથેની આત્મિયતા ત્યારે જ જીવંત થાય છે કે જ્યારે સેવક ચાહુરહિત થાય છે અને પોતાનામાં પોતાનું કંઈ હોવાનું માનતો નથી. અર્થાતું ચાહુરહિત અને ભમતારહિત થવાથી જ પ્રેમીઓમાં પ્રેમાસ્પદનું, ભક્તોમાં લગવાનનું અને જિજ્ઞાસુઓમાં તત્ત્વનું ચિત્તન આપોઆપ થવા લાગે છે. તેથી લગવતું ચિત્તન અને સાર્થક ચિત્તન દ્વારા, મનુષ્ય પોતાનું ધડતર કરી શકે છે.

પ્રત્યેક માનવ સ્વભાવથી જ મૃત્યુથી લયભીત થઈ અમરતવની અને સંદેહથી પીડાઈ નિઃસંદેહતા પ્રાપ્ત અરવાની આવશ્યકતાનો અનુભવ કરે છે. મૃત્યુનો લય અને સંદેહની ઉત્પત્તિ અસત્તના સંગથી થાય છે. અસત્તને અસત તરીકે પિછાણી લઈએ કે તરત, અસતની નિવૃત્તિ અને સતતી પ્રાપ્તિ સ્વતઃ થઈ જય છે. તત્ત્વની જિજ્ઞાસા, અસતું વસ્તુઓની કામનાનો નાશ કરીને, જિજ્ઞાસુને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે અને પછી મૃત્યુનો લય કે સંદેહની ગંધ પણ રહેતી નથી. એ કારણે માનવમાત્ર માટે સત્યની શોધ કરવાનું આવશ્યક છે. શોધ તેની જ હોય, કે જેનાથી દેશકાળનું ફરપાણું ન હોય તથા જેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. અર્થાતું જે ઉત્પત્તિ વિનાશ રહીત સર્વત્ર અને સર્વહા હોય છે. જર્ણથેલી વસ્તુ—સૃષ્ટિ પદાર્થ વગેરેની ભમતા તથા તેનાથી સંબંધ સ્વીકારવાથી, મનુષ્ય સતથી વિમુખ થાય છે અને અસત્તના સંગમાં બંધન પામે છે. છતાં સર્વ પ્રાણી-માત્રમાં, બીજડે સતતી જિજ્ઞાસા તો વિદ્યમાન હોય છે. એ જિજ્ઞાસાને અસત્તના સંગથી ઉત્પજ્ઞ થયેલી કામનાઓએ શિથિલ કરી નાખી હોય છે. એ (શુભ-દ્વારાયેલી) સ્વાભાવિક માંગની જગૃતિથી જિજ્ઞાસા પ્રથળ બને છે. જેમ જેમ જિજ્ઞાસા સખળ અને સ્થાયી થવા માટે છે તેમ તેમ ઉત્પજ્ઞ થયેલી કામનાઓનો નાશ થવા લાગે છે. કામનાઓનો નાશ થવા લાગતાં જ, વિવેક (વિચાર)નો ઉદ્ય થાય છે, અવિચાર—અસહ વિચારનો

નાર જિજ્ઞાસુને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યનું કર્ત્વ તો માત્ર સતતની જોગ કરવાનું છે. તેની પ્રાપ્તિ તો ઈધરની મંગળ કરનારી રૂચનાથી એ વાસ્ત્વિકાય થઈ જાય છે. અસતું અને સતમાં એક મોટો લેદ એ કે અસતુંની કામનાઓ, મનુષ્યને (અસત) પ્રવૃત્તિમાં જોડી હઈ, અસતોય એ ઉપસ કરે છે. અર્થાતું એમ રહેવાય છે કે કોઈની બધી કુલભાગે કરી પૂરી થતી નથી પરંતુ સતતી જિજ્ઞાસા મનુષ્યને સતતો જોગ કરી જાય છે સતતની તીવ્ખ જિજ્ઞાસામાત્રથી સતતી પ્રાપ્તિ આપોયાય થઈ જાય છે. તેથી જગતની કામનાઓનો ત્યાગ કરી, સતતી શોધ જીવની એ અનિવાર્ય છે. અસતુંની કામના, પ્રાણીઓનાં સંકુચિત અહુમને શુદ્ધિત કરે છે. એ કારણે જિવારો મનુષ્ય, અધ્યરાપણામાં ફસાઇને કુલભાગે એને અલિમાનના અગ્નિમાં બળે છે. સત જિજ્ઞાસા, સંકુચિત અસુસ્તુસ્તુને નશ કરી, દિંય ચિન્મય, નિત્ય જીવનમાં લગી જાય છે. કુલભાગે એનેક પણ જિજ્ઞાસા એક જ હોય છે. કામનાઓ જન્મમરણના કુલભાગે એને જિજ્ઞાસા અવિનાશી જીવન તરફ પ્રગતિ કરાવે છે. અથવા એને જોડું કે જિજ્ઞાસા નિત્ય જીવનની હોય છે અને કામનાઓ અનિત્ય શુદ્ધિની સર્વને એ તો ખબર છે કે કોઈની સર્વ કામનાઓ પૂરી થતી નથી એને અસુસ્તુસ્તુ કામનાઓ સર્વની પૂરી થાય છે એટદું જ નહિ પણ કામના પૂર્ણ કરાં, બીજુ કામનાઓની ઉત્પત્તિ આપોઆપ થાય છે. એ કારણે કુલભાગે તો કામનાઓ તો અપૂર્ણ જ રહે છે. કામના પૂર્તિ કે અપૂર્તિની કુલભાગ સ્થિતિ, સંકુચિત અહુંભાવને પોષે છે. અહુંભાવનો નાશ નથી જાતી. જાણ જ્ઞાને પ્રાણી કામના અપૂર્ણ રહેવાની અસદ્ય વેહનાથી, પીડિત કરી, સતતી શોધ કરે છે, ત્યારે સતતી જિજ્ઞાસા, અહુંભાવનો નાશ જાણે સતતી યોગ કરાવે છે. જિજ્ઞાસા દ્વારાત્મક સ્થિતિ રહેવા હેતી નહી રહેલી જિજ્ઞાસા, લેદ બુદ્ધિનો નાશ કરી, અમર જીવનનો યોગ જાણે છે. એ દુષ્ટીએ, એ વાત સ્પષ્ટ થાય છે કે કામનાઓ અહુંભાવની જોગ કે એ જિજ્ઞાસા અહુંભાવનો નાશ કરે છે.

જેમ નિર્ણયતા, ખળની આવશ્યકતાની સ્થિતિ સિવાય ધીજું કાંઈ નથી, તેમ અનિત્ય જીવન નિત્ય જીવનની માંગ સિવાય ધીજું કાંઈ નથી, અર્થાત, અનિત્ય જીવનનું જીહું અનિત્ય જીવનથી, તેવા અનિત્ય જીવનની પ્રતીતિ ભલે થાય પણ તે અનિત્ય જીવનની પ્રાપ્તિ ન ગણ્યાય. અનિત્ય જીવનનું આકર્ષણું જ કામનાઓના રૂપમાં ઉત્પન્ન થાય છે. નિત્ય જીવનની માંગ જ સત્તની શોધના રૂપમાં પ્રકટ થાય છે. તે કારણે શોધ કરવા માત્રથી જ સત્તની પ્રાપ્તિ થાય છે. એ રીતે સત્તની શોધ દ્વારા, મનુષ્ય માત્ર, અમરત્વનો યોગ સાધી શકે છે, એ નિર્વિવાહ સિદ્ધ છે. સત્તની શોધનો વાસ્તવિક અર્થ તો એ છે કે પોતે જાણેલા અસતના સગનો ત્યાગ કરવો, અર્થાતું વિવેકનિરોધી કર્મો, સંબંધ, વિશ્વાસનો ત્યાગ કરવો. સારાંશ એ કે સંશ્યાની વેહના સત્યની વૃત્તિને જાયત કરે છે. સરળ વિશ્વાસે ભગવતું ચિંતનમાં પ્રવૃત્ત કરે છે. હૃદયમાંની કરુણા અને ઉદારતા સેવાને સળુવ જનાવે છે અને સ્વાધીનતાની માંગથી જિતેન્દ્રિયપણું સ્વતઃ આવે છે. એ ચારે વસ્તુઓથી માનવનું ઘડતર થાય છે, તેથી ઈન્દ્રિયજન્ય સત્યની શોધ, સેવા અને ભગવતું ચિંતન દ્વારા, મનુષ્યે પોતાનું જીવન ઘડવું એ અનિવાર્ય છે.

પ્રત્યેક માનવ, પોતપોતાની રુચિ, લાયકાત, સામજ્ય અને પરિસ્થિતિ અનુસાર જિતેન્દ્રિયપણું સેવા, ભગવતું ચિંતન તથા સત્યની શોધ દ્વારા પોતાનું ઘડતર કરી શકે છે. સમગ્ર સંયમ અને તપમાંથી જિતેન્દ્રિયતા, કર્તવ્યબુદ્ધિની પરકાઢાથી સેવા અને સમસ્ત ઉપાસનાઓથી પ્રિયતાની જાયતિ આવે છે અર્થાતું ભગવતું ચિંતનથી અને જ્ઞાતમા વિવેકના જ્ઞાન પ્રકારથી જગતના દર્શયના અસતના ત્યાગમાં સત્યની શોધ સમાઈ જય છે, અથવા એમ કહે કે સત્યનો યોગ સધાય છે, એ દર્શિએ, પ્રત્યેક માનવ ગમે તે સાધનથી પોતાના વિકાસનો આરંભ કરે, પણ દરેક સાધનની સંપૂર્ણતામાં, સર્વ સાધનોનો સમાવેશ થાઈ જય છે. સાધનની લિક્ષતા હોવા છતાં સાધ્યની એકતા જ સધાય છે. આરંભેલ

સાધન પૂર્ણતાએ પહોંચે છે. ત્યારે સર્વ સાધનો આપોઆપ લેળાં થઈ જય છે. આરંભમાં કિન્તુ હોય છે, અંતે નહિ. બક્તિગત અધિકારમાં લેદ હોવા ને કારણે (સાધનની) કિન્તુ સ્વાભાવિક હોય છે અને સાધ્યની એકતા હોવાથી, સર્વ સાધનોનો અંત, સાધ્યની અગાધ ભક્તિમાં જ પરિણમે છે. પ્રત્યેક સાધક, પોતાના સાધ્યનું પ્રેમપાત્ર બનીને, સાધ્યમાં મળી જય છે એ જ માનવજીવનની પૂર્ણતા છે.



પાંચમો નિયમ

ધીજનું કર્તવ્ય એ આપણો અધિકાર, ધીજની ઉડાસ્તાને પોતાનો શુણ અને ધીજની નિર્ભળતાને પોતાનું બળ ન માનવું. કર્તવ્ય ને અધિકાર પરસ્પરની જુદાઈને એકતામાં બહલી નાખે છે. એ દિલ્લી, કોઈનું કર્તવ્ય જ કોઈનો અધિકાર બને છે. કર્તવ્યનિષ્ઠ પ્રાણીઓ દ્વારા, સર્વના અધિકાર સુરક્ષિત રહે છે અને એ જ વિકાસનું મૂળ છે. પણ જ્યારે ધીજ પોતાનું કર્તવ્ય, પોતા પ્રતિ બરાબર કરે, એવો પોતાનો તેમના ઉપર અધિકાર છે, એવું મનુષ્ય માની લે છે ત્યારે અધિકાર બંધનકારક લાલસા ઉત્પન્ન કરે છે. એમ થતાં જ પોતાના અધિકારની પૂર્તિ થવામાં રાગ અને માનેલા અધિકાર પ્રમાણે, ધીજ કર્તવ્ય ન કરે, તો દ્વોષ અને હોધ ઉત્પન્ન થાય છે. એ સ્થિતિ સર્વનાશનું મૂળ છે. રાગ મનુષ્યને પરાધીનતા, જડતા અને અસર્તોષ આદિ દોષોમાં ફૂસાવે છે. એ કોઈને ઈષ્ટ લાગે તેવું નથી. રાગની ભૂમિકામાં જ કામનાઓ સમસ્તની ઉત્પત્તિ થાય છે. ઉત્પત્ત થયેદી કામનાઓ પૂરી થાય કે અધૂરી રહે, તેના આધારે, પ્રાણી સુખની શુલામી અને હુઃખના લયમાં ફૂસાય છે. સુખની લાલસા અને સંસ્કાર સુખની જ શુલામીની દઢ ઘેરી છે કે જે મનુષ્યને દેહાલિમાનમાં જકડી રાખે છે. એ જ સર્વ વિરોધોનું મૂળ છે અને હુઃખનો લય, હુઃખને અશક્તા બનાવી હે છે, કારણ કે હુઃખના લયથી પોતાનામાં જે શક્તિ છે તે ઘટે છે. એ રીતે જેતાં, રાગનો નાશ કરવો એ માનવમાત્રને માટે અનિવાર્ય છે. પણ તે ત્યારે જ થઈ શકે કે, જ્યારે ધીજનાં કર્તવ્ય ઉપર પોતાનો અધિકાર ન મનાય અને ધીજનેાના અધિકારની રક્ષાને પોતાનું કર્તવ્ય માનવામાં આવે. અધિકાર લાલસાનો નાશ થતાં જ, નવો રાગ ઉત્પન્ન થતો નથી. એટલું જ નહિ પણ ધીજના અધિકારની રક્ષા કરવાથી, જે રાગ પેઢા થયો હોય છે તે પણ નાશ પામે છે. સર્વને એ જ્ઞાન તો હોય જ છે કે પોતાની શક્તિ અને વિવેક પ્રમાણે પોતાનું કર્તવ્યપાલન કરવામાં કોઈ મનુષ્ય અસર્મથ્ય નથી હોતા. એ કારણે સર્વ

ભાઈ ખેણ, કર્તાવ્ય નિષ્ઠ થવામાં સ્વતંત્ર છે. અને એ રીતે કર્તાવ્ય અજલીને, જે આસક્તિ (રાગ) વર્તમાન જણાય કે તેનાથી સુક્ત થઈ શકે છે. પોતાના અધિકારની પૂર્તિ કરવામાં કોઈ પ્રાણી સ્વતંત્ર નથી. તેથી અધિકાર સંતોષાય નહિ ત્યારે ક્ષોલ અને કોધમાં ક્રસાય છે ખળતકારે પોતાનો અધિકાર, ધીજાઓ પાસે સંતોષાવવાનાં કર્મથી પરસપરમાં અભ્યત જુદાઈ ઉત્પન્ન કરે છે. અને તે ધર્માણું મૂળ છે. કર્તાવ્ય પરાયણુતાથી જ પાર સ્પર્ધિ કર્તાવ્યની ભાવના પોષાય છે ને તે એકતાની માતા છે. પ્રાકૃતિક નિયમ સુજખ, જે જીવનમાં હોય તેજ બ્યાપક અને છે. તેથી કર્તાવ્ય પરાયણુતાથી જ, સમાજમાં અરસપરસ કર્તાવ્ય પરાયણુતા પાંગરે છે અને આપણી અધિકાર લાલસાથી જ, ધીજાઓ પણ અધિકારની માંગ કરવા પ્રેરાય છે. એ કરણે પોતાની અધિકાર ભાવનાનો ત્યાગ કરવો અને ધીજાના અધિકારની રક્ષા કરવી, એ વિકાસનું મૂળ છે. પણ તે ત્યારે અને તે નયારે, ધીજાનાં કર્તાવ્યને પોતાનો અધિકાર ન માનવામાં આવે, ધીજાના અધિકારની રક્ષાને પોતાનું કર્તાવ્ય માનવામાં આવે, અને તેમ કરવાથી જે આસક્તિ (રાગ) બંધાઈ હોય તે હુર થઈ જય અને નવીન રાગ પેઢા ન થાય. રાગ રહિત ભૂમિમાં જ યોગડાયી વૃક્ષની જડ પેસે છે અને યોગ ડ્ર્પી વૃક્ષમાં જ તરવજીન ડ્ર્પી ઇણ જેસે છે. એ ઇણ પ્રેમડર્પી રસથી સરપુર છે. એ દસ્તિ એ, રાગ રહિત થવામાં જ સર્વ વિકાસનું મૂળ છે.

પોતાના અધિકારના ત્યાગ વગર, કોઈપણ વ્યક્તિ, રાગને કોધ રહિત થઈ શકે નહિ એતો સર્વને જ્વાણીટું છે કે અધિકાર ન સંતોષાય તેથી મનુષ્ય કુલિત અને કુલથ થાય છે. કુલથ થવાથી, મનુષ્ય, સમતોલપણું, ગુમાવે છે. સમતા જોવથી કોધનો અભિન જણણ થાય છે, તેમ થતાંજ સજગપણું અને સાવધાની રહેતી નથી અને (સ્વરૂપની) વિસમૃતિ થઈ જય છે કર્તાવ્યની વિસમૃતિથી, ન કરવા લાયક કર્મ થાય છે; સ્વરૂપની વિસમૃતિ, ફેલાલિમાનમાં ઇસાવે છે. અને પ્રેમાસપદની વિસમૃતિ અનેક આસક્તિ અને જન્માવી, પ્રેમની ભાવનામાંથી

વિમુખ કરી હે છે-તેથી માનવજીવનમાં, દ્વાલ અને કોધનું કોઈ સ્થાન નથી-અકાર્યથી જીવન, જગત માટે ઉપયોગી રહેતું નથી. દેહાલિમાન દશ થતાં જીવન પોતા માટે નિરર્થક થાય છે. અને આસક્તિઓમાં દ્રોષાવાથી, જીવન ગ્રલુ સેવા માટે નિરૂપયોગી બને છે-એ દર્શિયે, દ્વાલ અને કોધ જેવા કોઈ લયાંકર વિકાર નથી-તેનો ત્યાગ, પોતાના અધિકારનો ત્યાગ કરવાથી થાય છે. તેથી ધીજાઓનાં કર્ત્વિયને પોતાના અધિકાર માનવોએ ભૂલ છે અને સર્વથા ત્યાજ્ય છે. ધીજાઓની ઉદારતા, આપણા ગુણને લીધે છે એમ માનવાથી મિથ્યા દેહાલિમાન વધે છે. એ સધળા વિકારનું મૂળ છે-તેથી કોઈ મનુષ્યે, કોઈની ઉદારતાને પોતાના ગુણનું કારણ ન માનવું જેઈએ. જે મનુષ્ય, ધીજાની ઉદારતાને પોતાનો ગુણ નથી માનતા, તેઓમાં હૃદયની ઉત્તમ લાગળીએ. નિકસે છે. તેમ થવાથી નીરસતાને બદલે સરસતા, કડવાશ ને બદલે માધુર્ય અને જુહાપણાંની લાવનાને બદલે એકતાનો ભાવ પેડા થાય છે. એ વિકારનું મૂળ છે.

દેહાલિમાનથીજ, મનુષ્ય પોતે ગુણવાન છે એવો અંચળો જોડે છે. ખરીરીતે તો સધળાદિય ગુણો આત્મામાં સિદ્ધ છે. તે બહારથી જેળવવાની વસ્તુ નથી જ્યારે મનુષ્ય, પોતાના આત્માના વિવેકનાં જ્ઞાનથી, પોતાના જાણેલા અને કરેલા દોષનો ત્યાગ કરી હે છે, ત્યારે પોતાનામાં રહેલાં નિર્દેખ તત્ત્વમાં તે એકમેક થઈ જાય છે. એમ થતાંજ જીવન, નિર્વિસના નિવૈરતા, નિલયંતા, સમતા, મુદ્રિતા વગેરેથી ભરપૂર બની અને તેનું બંધેય બદલી જાય છે. સેફ કે જુહાપણાનો ગંધ પણ રહેતો નથી અને સર્વતોસુખી વિકાર આપોઆપ થઈ જાય છે.

ઉદારતા વિના પ્રાસ વસ્તુ, સામર્થ્ય, લાયકાત વગેરેનો સદ્ગુણ્ય થતો નથી. હુણીઓને દેખી કરુણતા અને સુખીઓને દેખી, પ્રસન્નતા થાય તેમાંજ ઉદારતાની પરાકાણી છે, ધીજાઓની ઉદારતાને માટે માનની લાગળી સેવી, પોતે ઉદાર અનવાનો મનુષ્યે, અથાક પ્રયાસ

કરવો જોઈએ. ત્યારે જ, મતુષ્ય, સુખાસકિતની શુલામીમાંથી સ્વાધીન અની શકે. પણ તે ત્યારેજ અને કે જયારે. મતુષ્ય, પારકાની ઉદારતાને પોતાના ગુણનું કારણું ન ભાને, એટલું જ નહિ પણ ઉદારતા પર્વત પ્રાપ્ત સુખનો સહૃપદોગ કરતો રહે. ત્યારે જ પરસ્પરની એક્ષતા સુરક્ષિત રહે અને વાસ્તવિક જીવન પ્રાપ્ત થાય.

એ પણ સર્વને વિહિત છે કે કોઈપણ બ્યક્ઝિત સમાજ, વર્ગ, દેશ વગેરે, સર્વાંગે સભળ કે નિર્ણય નથી હોતા. પ્રાકૃતિક નિયમ પ્રમાણે સર્વાંગ આંશિક સભળતા અને નિર્ણયતા વિદ્યમાન હોય છે. આંશિક અળનો સહૃપદોગ કરવાથી અળની વૃદ્ધિ અને તેના હૃડપદોગથી, અળનો હુાસ થાય છે. તે કારણે અળનો હૃડપદોગ સર્વને માટે અહિતકર છે. અળના હૃડપદોગનો માનવજીવનમાં કોઈ આવકાશ જ નથી. એટલું જ નહિ, પણ સહૃપદોગ કરવાનું અનિવાર્ય છે કેમ કે તે સર્વને માટે, સર્વેહાહિતકર છે. પણ તે ત્યારેજ અને કે બીજાની નિર્ણયતાના આધારે પોતાને સભળ માનાયે નહિ. પરસ્પર સંઘર્ષ બંધ કરવાનો એજ મહામંત્ર છે. તે મંત્રનું અનુકરણ હરેક બ્યક્ઝિત સમાજ, વર્ગ, દેશ વગેરે એ કરું એ અતિ આવશ્યક છે. તેથી એ નિવિંવાદ સિક્ષ થાય છે કે કોઈના કર્તાઓ ઉપર પોતાનો અધિકાર, બીજાની ઉદારતાએ પોતાનો ગુણ, અને કોઈની નિર્ણયતાને લીધે પોતાને સભળ ન માનવાથી જ, સુંદર સમાજનું નિર્માણ થાય છે અને આપણું પોતાનું કલ્યાણ થાય છે. આ રહસ્ય, જેએએ આત્મ વિવેકના પ્રકાશથી પોતાની સ્થિતિનું અધ્યયન કરીને ખરા જીવનની શોધ કરી હોય, તેએ જ જાણી શકે છે.



ઇંગ્રેઝ નિયમ

કૌટુંબિક કે જતનો સંબંધ ન હોય તો પણ કૌટુંબિક ભાવના પ્રમાણે પરસ્પર સંભોધન, તથા સહૃદ્ભાવ; અર્થાત કર્મની જિન્નતા હોવા છતાં સ્નેહની એકતા.

એ સર્વને જણીતું સારી પેડે હોય છે કે પ્રત્યેક ઉત્પત્તિના મૂળમાં કોઈ એક તત્ત્વ છે જે અનુત્પત્ત છે. એમ ન હોય તો ઉત્પત્તિ સ્થિતિ અને લય જિંદ્ગ થઈ શકે નહિ - એ દષ્ટિ એ હરેક વ્યક્તિ, વિશ્વ સાગરમાં એક જિંદુ છે. સાગર અને તેનાં ખુંડમાં ગુણોની જિન્નતા હોવા છતાં, જાતીય અને સ્વરૂપની એકતા છે. ગુણોની જુદાઈ હોવાથી, એકતાને કારણે લક્ષ્યથી એકતા સ્વભાવિક છે.

જેમ પ્રત્યેક કર્માદ્રિય અને જાનેંદ્રિયના કર્મભાં લેદ હોવા છતાં, લક્ષ્યની એકતા રહે છે, અર્થાત શરીરના પ્રત્યેક અવયવ અને આકારમાં લેદ હોવા છતાં પણ તેમની પ્રીતિમાં એકતા હોય છે, તેમ જ હરેક વ્યક્તિ, સમાજ વર્ગ અને દેશની રચનાઓ જુદી જુદી હોવા છતાં, તેમના સ્નેહ અને ધ્યેયની એકતા આવશ્યક છે. પણ તેવું થવાનો સંભવ ત્યારેજ બને કે જ્યારે અનેક પ્રકારના લેદ હોવા છતાં પણ પરસ્પર સંભોધન અને સહૃદ્ભાવ કૌટુંબિક અને જાતીય એકતાનાં ઘોરણે, કરવામાં આવે. સહૃદ્ભાવ પૂર્વક કૌટુંબિક સંબંધ હોય તેવી રીતે, સંભોધન તથા કર્મની પવિત્રતા, પરસ્પરની પ્રોતિની એકતા સુરક્ષિત રાખવામાં કારણ છે. સંબંધ કર્ત્વયનું ચિહ્ન છે, અધિકારનું નહિ. કર્ત્વય પાલનથીજ પ્રાણી, મળેલી વસ્તુ, શક્તિ અને લાયકાતનો સહૃદ્ભાવ કરી શકે છે. મળેલાં સાધનો નો સહૃદ્યોગ થવામાંજ, સુંદર સમાજની રચના થવાની શક્યતા રહેલી છે. પોતાના અધિકારના ત્યાગથીજ, જીવનમાં નિષ્કામ વૃત્તિનો વિકાસ થાય છે. એ દષ્ટિએ હરેક સ્વાગતમાં તે સ્વાગતે અનુકૂળ કર્ત્વયની હિશાતું સૂચન છે. કર્ત્વયનો સંબંધ ‘પર’ લક્ષી છે, અને

નિષ્કામપણું ચોતાનાં 'સ્વ' આત્માને માટે હિત કર છે. કર્ત્વીય બુદ્ધિ શિવાય પરસ્પરની એકતાનો સંભવ નથી; અને નિષ્કામતા વિના, અસંગતા અને આત્મીયતા જીવંત બનતાં નથી. અનાસ્કિત વિના સ્વાધીનતા નાં સામ્રાજ્યમાં પ્રવેશ થતો નથી; અને આત્મીયતા વિના, અગાધ, અનંત નિત નવ પ્રેમ જાગ્રત થતો નથી. એવી જગૃતિ થાય તોજ થથાર્થ જીવન બને. કારણું હુરેક ભાઈ ફેન, કર્ત્વીય પરાયણુતા અને નિષ્કામ પણું સંપાદન કરે એ અલ્યંત આવશ્યક છે.

એ તો સર્વને માન્ય છે કે સમસ્ત વિશ્વનો આધાર અને ઉત્પત્ત કરનાર એક છે. એ નથી. અર્થાતું જેનાં કાર્યથી જગત બન્યું તે છે કારણ એક છે. કારણમાં એકતા હોવા છતાં પણ કાર્યમાં લિખતા જણાય એ વૈજ્ઞાનિક સત્ય છે. એટલું જ નહિ પણ કાર્યમાં, સત્તા, કારણની જ હોય છે, છતાં કારણ સાથે સરખાવતાં, કાર્યમાં ગુણોની લિખતા થઈ જાય છે. તે કારણું એકતામાં અનેકતાનો ભાસ થાય છે. દેખીતી અનેકતા છતાં એકતાનો પ્રચાર રહે, તે માટે, એ જરૂરી છે કે, પરસ્પરનો બ્યવહાર, આત્મીયતાના આધારે જ કરવામાં આવે; એવું ત્યારેજ થઈ શકે કે જાયારે સર્વાત્મકાવ પ્રત્યક્ષ થઈ જાય અથવા એવું જ્ઞાન થઈ જાય કે પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુ સાગરનાં મોઝ જેવાં છે, અર્થાતું એવી પ્રતીતિ થવી જોઈએ કે સર્વાધાર તથા સર્વને ચેતન આપનારની જ વિશ્વ એ અનુપમ લીલા છે. એમ જણાવાથી અનેકતામાં એકતાર્થ દર્શાન ઘણી સુગમતાથી થઈ શકશે. એવું દર્શાન થતાંજ, રાગક્રૈષ નષ્ટ થાય છે. રાગનો અંત થતાંજ સ્વાધીનતાનો વિકાસ અને દ્રેષ્ણનો અંત થતાં પ્રેમ પ્રાહુર્લાંબ, આપોઆપ થાય છે. એજ સર્વનું લક્ષ્ય છે, સર્વની (અંતરહિત) માંગ છે

સહ્યાવ શિવાય સહૃદ્યતાનો ઉદ્દ્ય થતો નથી, સહૃદ્યતા જ પ્રીતિનું ઉદ્ગમ સાધે છે. પ્રીતિ એ એક એવું અદોકિક તત્ત્વ છે કે જેની જગૃત થવાથી કર્ત્વીયવિમુખતા અને આસ્કિત નિર્મૂળ થઈ જાય છે. આસ્કિતના નાશમાંજ કર્ત્વીય પરાયણુતા અને અસંગતા રહેલાં છે. કર્ત્વી

વ પરાયરાણુતામાં સુંદર સમાજનું નિર્માણ અને અસંગતામાં પોતાનું કલ્યાણ રહેલાં છે. એ દસ્તિએ તમામ મનુષ્યોએ, સદ્ગ્રાવ સારી હીતે જળવવાની જરૂરત છે, સદ્ગ્રાવ પૂર્વંક સંખેધન કરવાથી, પરસ્પરના વ્યવહારમાં પવિત્રતા આવે છે, અને સત્યશિવ સુદૃઢ થાય છે. વ્યક્તિ અને સમાજનું નિર્માણ થાય છે જે વિકાસનું મૂળ છે,

સાધનરૂપ અને તેવાં વર્તનની સ્વીકૃતિ એ જ ખરાં માનવજીવનની રીત ગણ્યાય, પોતે જે જીવન રીત સ્વીકારી હોય, તેવી પ્રવૃત્તિ થાય છે. સર્વનાં હિતકારક પ્રવૃત્તિ ત્યારે જ થઈ શકે કે જ્યારે સર્વ જીવી માન્યતાએ જે કર્તાંબ પોષક ન હોય, તેના અંત કરી હેવાય.

કર્તાંબ ન હોય તેવું વર્તન અને સાધન ન બને તેવું વર્તન નાશ પામે તેજ કારણે માનવ સમાજમાં જૂદા જૂદા પ્રકારના સંખેધોની સ્થાપના થયેલી છે. તે કારણે સંખેધોને અનુરૂપ જ સંખેધન અનિવાર્ય છે. હેઠાળિમાનમાં રહેલ પ્રાણી અપવિગતાથી રહિત ત્યારે જ રહી શકે છે કે જ્યારે તે પોતાની સાંસ્કૃતિક સર્વાંગ અને સામાજિક અવસ્થાને બંધ જેસે તેવા સ્વીકારેલ સંખેધોને લક્ષ્યમાં રાખી પરસ્પર સંખેધન તથા સદ્ગ્રાવહાર કરે,

વ્યવહાર શુદ્ધ શિવાય, સ્વાર્થભાવનષ્ટ થતો નથી, તેનો નાશ થયા શિવાય રાગરહિત બનવાનો સંભવ નથી, રાગની ભૂમિકામાં જ સર્વ વિકારિની ઉત્પત્તિ થાય છે. તેથા દરેક ભાઈજણને, નિવિકાર બનવા માટે રાગ રહિત થલું અનિવાર્ય છે. વિકાર ચુક્તાળવન, પોતાને માટે ઉપયોગી નથી કે પારકાને માટે પણ ઉપયોગી નથી. કોઈને પોતાને સાથી અપમાણિક હોય તે ઝયતું નથી. પ્રમાણિક વ્યક્તિ સાથેના સંખેધની સર્વની માંગ હોય છે, અથવા એમ કહો કે જે પોતાને જેઈ એ છીએ, તેવું જ વિશ્વને જેઈએ છીએ. સદ્ગ્રાવહાર અનેકતામાં એકતા અને જૂદાપણુંમાં, અભેદભાવની સ્થાપના કરે છે. જૂદાપણુંથી સ્વાર્થભાવ અને અસેદ્ભાવથી સેવાભાવની વૃદ્ધિ થાય છે, સ્વાર્થભાવ રહેતાં

સુધી કોઈનો પણ વિકાસ થવાનો સંભવ નથો, તે કારણે લેદભાવનો નાશ થવો જોઈએ. એ ત્યારે જ ખનેકે જ્યારે અનેક લેદ હોવા છતાં પ્રીતિની એકતા સ્વીકારવામાં આવે. પ્રીતિની એકતા એ જ ખરી એકતા છે. કર્તાંયની લિંગતા, પ્રીતિની એકતાની બાધક નથી, એટલું જ નહિ પણ પ્રીતિની એકતા, કર્મની લિંગતા હોવા છતાં, લેદરહિતપણું સ્થાપન કરવા સમર્થ છે. લેદભાવની ભૂમિકામાં જ કામનાઓની ઉત્પત્તિ થાય છે. તે વિનાશનું મૂળ છે. તેથી લેદભાવને અલેદભાવથી, નષ્ટ કરવાનું અનિવાર્ય છે. તેથી પ્રત્યેક લાઈફને, કૌટુંણિક લાવના હોય તેવું જ અરસપર સંઝોધન અને સફભાવ રાખવાનું આવશ્યક છે. વિકાસનું એ મૂળ છે.



સાતમો નિયમ

નિકટવર્તી જન સમાજની યથાશક્તિ કાર્ય દ્વારા સેવા કરવી.

એ હકીકત સૌને વિદ્ધિત છે કે વસ્તુ સામર્થ્ય, ચોણ્યતાના રૂપમાં જે કોઈ ભાઈંહેનને જે કાંઈ મદ્દયું છે, તે વ્યક્તિગત નથી, પરંતુ સમબિંદી શક્તિઅથીજ નિર્મિત છે. એ નિયમ છે કે મળેવી શક્તિને સહૃપદોગ કરવામાં જ, પ્રાણીઓનો વિકાસ રહેલો છે. તેથી પ્રાસ વસ્તુ, સામર્થ્ય અને ચોણ્યતા દ્વારા જ નિકટવર્તી જન સમાજની યથાશક્તિ સેવા કરવાનું અનિવાર્ય છે. સેવાસાવથી કરેવી પ્રત્યેક પ્રવૃત્તિ ચોડી હોય કે ધર્ણી પણ તેનું મૂલ્ય સરખું છે. સેવાનું ઇણ, ચિત્તની શુદ્ધિ છે કોઈ ખાસ પરિસ્થિતિ મેળવવાની તેમાં આશા ન રહાય. પ્રાસનો સહૃપદોગ, આવશ્યક વસ્તુ સામર્થ્ય અને ચોણ્યતાની પ્રાપ્તિનું પણ કારણ છે, પણ એ સેવાનું ગૌણ ઇણ છે. સુખ્ય નહિ. સેવાનો આરંભ, હુખીઓને હેઠીને કર્ણા પૂર્ણ અને સુખીઓને હેઠી પ્રસન્ન રહેવાથી થાય છે; અર્થાત કર્ણા અને પ્રસન્નતા જ સેવાનું-તાસ્તવિક સેવાનું સ્વરૂપ છે. કર્ણાથી સુખલોગની લાલસા નષ્ટ થાય છે અને પ્રસન્નતા, કામના રહિત કરી હે છે; સુખલોગની આસક્તિનો નાશ થતાં જ, મળેવી વસ્તુ, સામર્થ્ય અને લાયકાતનો સહૃપદોગ સમીપ સ્થિત પ્રાણીઓનાં હિત માટે આપો આપ થવા લાગે છે. એમ થવાથી પરસ્પર એકતાનો સંચાર અને લેદાવાનો નાશ, આપોઆપ થવા લાગે. લેદાવાનો નાશજ સુંદર સમાજનાં નિર્માણમાં કારણ ભૂત છે; શ્રમરરહિત થઈ જવાથી હેઠાલિમાન ગળી જય છે. તેથી આપણું કલ્યાણ થાય છે. એ દાખિએ સેવામાંજ, સુંદર સમાજનું નિર્માણ અને વ્યક્તિનું કલ્યાણ છે.

સુખલોગની વાસનાનો નાશ થયા વિના, નિલ્ય-ચોગની પ્રાપ્તિ સંલાભિત નથી. કોઈ ખાસ અસ્યાસથી, ચોડા વખત માટે, શાંત થઈ શકાય એતો એક તાત્કાલિક વિશેષ સ્થિતિ છે. તે નિલ્ય ચોગ ન કરેવાય. નિલ્ય ચોગતો સાધકને નિલ્યનાં જીવનનો ચોગ સાધી આપે છે.

એજ સર્વને દૃષ્ટ છે એ કારણે સુખ લોગની વાસના નાખું કરવી એ આવશ્યક છે. અને તે કરુણાળું બનવાથી સંભવિત છે. મમતાને કારણે કરુણા તો પણ પક્ષી વગેરેમાં પણ હોય તેથી ચિત્ત શુદ્ધ નથી થતું. મમતા રહિત કરુણા હોય તો જ ચિત્ત શુદ્ધ થાય.

ભौતિકવાહીની દર્શિયે સમસ્ત વિશ્વ એક છે. અધ્યાત્મવાહીની દર્શિયે સમસ્ત વિશ્વ એ આપણી જ એક વિશેષ અવસ્થા છે. અને આસ્તિકવાહીની દર્શિયે, તે અનંતની એક અનુપમ લીલા છે. તે કારણે સર્વ આપણાં જ છે, કેંધી પારકું નથી એવો સહ્બાવ થયા શિવાય સેવા ભાવથી જગૃતિ થવાનો સંભવ નથી. એ સર્વને વિહિત છે કે ભાવ અર્મયોહિત અને કર્મ ભર્મયોહિત હોય છે. પરંતુ વ્યાપક ભાવથી જીમિત કર્મમાં પવિત્રતા આવે છે અને તેથી કર્તા નિષ્કામ થઈ જય છે. નિષ્કામતા પ્રકટ થતાં જ, લોગ, યોગમાં લુસ થઈ જય છે. તેથી નિકટના પ્રાણીઓની સેવા, લોગને યોગી બનાવી હે છે. યોગ કલ્પવૃક્ષ જેવો છે. યોગથી જ હુઃખીઓનાં હુઃખનો નાશ, જિજામુઓને તત્ત્વજ્ઞાનનો લાભ અને પ્રેમીઓને પ્રેમાસ્પદ (પ્રભુ)ની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ, સમસ્ત વિકાસની ભૂમિકા, ચિરકાળનો વિશ્વામ યોગથી જ સાધ્ય છે. નિજ વિવેકના ઉપયોગથી જ, પવિત્ર ભાવનો ઉદ્ગમ થાય છે. પવિત્ર ભાવથી ધ્યેલાં કર્મ ક્રારા, કર્તા કામ રહિત થાય છે. કામ રહિત થતાં જ, સર્વ પ્રકારનો વિકાસ સ્વતઃ સધ્યાય છે. એ કારણે પ્રાપ્ત વિવેકનો આદર (સહૃદયોગ) કરવો એ માનવમાત્ર ને માટે અત્યંત આવશ્યક છે. નિજ વિવેકનો અનાદર કરવાથી, સ્વાર્થભાવની ઉત્પત્તિ થાય છે. તે સુખ લોગની વાસના, પ્રવૃત્તિ અને આશામાં પ્રાણી ને ઇસાવે છે અને તે વિનાશનું સૂળ છે.

સેવાભાવનો ઉદ્ભબ થયાથી સ્વાર્થભાવનો સર્વાશો નાશ થાય છે. તેથી પ્રત્યેક વર્તમાન કર્તાંય હોય તે કામ, સેવાભાવથી પ્રેરાઈને કરું જોઈએ. દરેક કર્તાંય કર્મ, આસ્તિકની દર્શિયે પૂળ છે, અધ્યાત્મવાહીની દર્શિયે સાધન છે. અને ભौતિક વાહીની દર્શિયે, સ્વર્ઘર્મ છે.

પૂર્ણની પૂર્ણતા, પૂર્ણરીને પ્રેમથી એતખોત કરે છે. અને સાધન, અસાધન પ્રવૃત્તિનો નાશ કરીને, સાંદ્રય અને સાધનની અભિનનતા કરી હોય છે. સ્વધર્મ રાગદ્રોષ રહુત બનાવી, કરીને ચિરશાંતિ પ્રદાન કરે છે. હરેક દિલિભિહુંથી જેતાં, એ વિકાસનું ભૂળ છે. તત્ત્વજ્ઞાનનો લેદ હોવાથી, હુકીકતમાં કંઈ કેર પડતો નથી-કારણું તત્ત્વદર્શન અનેક છે. પણ જીવન તો એકજ છે.

સેવકની હરેક પ્રવૃત્તિ, નિર્માહૃતા, નિર્વ્યાખ્યાતા અને નિજામતા યુક્ત હોય છે; તેના જીવનમાં કોઈખિને કે પારકે નથી. સર્વ આપણા છે. અને આપણા હોવાથી સ્વભાવથીજ પ્રિય છે. નિજામતા શિવાય, પ્રેમ વ્યાપક બનતો નથી-મર્યાદિત પ્રેમથી આશક્તિનો જન્મ થાય છે. અને પ્રેમની વ્યાપકતાથી સત્ત્વપ્રેમ ઉત્પત્ત થાય છે. તે સત્ત્ય જીવન છે. તે કારણે નિકટવતીં પ્રાણીઓની સેવા કરવાનું અનિવાર્ય છે.

સર્વ જણે છે કે પ્રત્યેક પરિસ્થિતિ સુખહુણ યુક્ત હોય છે. સુખનો સહૃપત્તે, દુઃખીઓની સેવામાંજ છે. એ કારણે. પ્રાત સુખ, દુઃખીઓનીજ સંપત્તિ છે, એ વાત લક્ષ્યમાં રાખી, આદર પૂર્વક અને પવિત્ર લાવથી. દુઃખીઓને તે લેટ કરી હેવી જેઠાંએ ત્યારેજ મનુષ્ય સુખની ગુલામીરાંથી છુટો થઈ શકે છે. અને તેમ થતાંજ દુઃખનો ભય આપો આપ નાટ થાય છે. સેવાથી સુખી અને દુઃખીઓમાં એકતા અને સ્વાથી લાવ જૂદારો કરાને છે. અને એકતામાં સંધર્ષ ઉત્પત્ત થાય છે. શાંતિ, સામર્થ્યની સાતા છે. અને સંધર્ષ વિનાશનું ભૂળ છે. તેથી પ્રત્યેક કર્મ સેવા લાવથી કરવું જેઠાંએ. જે કોઈ કારણે સેવા ન થઈ શકે તો ત્યાગ અનિવાર્ય છે, ત્યાગથી સેવાની શક્તિ આવે છે. અને ત્યાગમાં કર્ત્તવ્યની પૂર્ણતા છે સેવાને અતે ત્યાગ અને ત્યાગની પૂર્ણતામાં સેવા આપોઆપ, થવા લાગે છે.

સેવાલાવની સીમા હોતી નથી, કિયા સીમિત હોય છે.-એ હુદ્દ લાવથી, કિયાનાં ‘મર્યાદિત શૈત્રમાં પવિત્રતા પ્રવતો’ છે; અને પવિત્રતાથી

વ्यापकभाव सचेत રહે છે. સેવા કરવા માટે સૌ પોતાનાં છે. અને પોતાને માટે તો તેજ પોતાનાં ગણ્યાય કે જે. સર્વનાં પ્રકાશ આપનાર અને આશ્રમદ્ય હોય. જે સૌને પ્રકાશ આપનાર છે તે, સર્વના પરમ ભિત્ત છે, અને તે નાતેજ સેવા કરવાની છે. સેવાનો કિયાતમક પ્રદેશ લુણે મર્યાદિત હોય પણ સેવાનો ભાવ સર્વ વ્યાપી હોવો જોઈએ. મર્યાદિત ભાવથી જે સેવા કરવામાં આવે તે બકિતએ વર્ણે, વર્ગો વર્ણે અને દેશો વર્ણે સંધર્ષ પેઢા કરે છે. સેવાની પૂર્ણતા, પ્રેમને જન્મ આપે, સંધર્ષેને નહિ તેથી હરેક સેવા કાર્યમાં નિર્મયાદ, વ्यાપકભાવ હોવો જોઈએ એકના નુકસાનથી થીજનો વિકાસ કરવાની ભાવના એ સેવાભાવના નથી, પણ સ્વાર્થ ભાવ છે. તેજ માનવ સેવા કરી શકે, જેણે સર્વનાહિત કરવાની સહલાવના સેવી હોય. સર્વનાં હિતમાં પ્રીતિ રાખનારનો સેવાભાવ સાચો રહે છે તેથીજ સેવાભાવથી રંગાઈને, પોતાની આજુઆજુના જન-સમાજની. કિયાતમક દ્યુ સેવા કરીને, પ્રત્યેક ભાઈઓને પોતાનું કલ્યાણ અને સુધર સમાજનું નિર્માણ કરી શકે એનિવિંવાહ મિશ્ન થાય છે.

જ્ઞાન શ્રી

આઠમો નિયમ

શારીરિક હિતની દર્શિએ આહારવિહારમાં સંયમ અને હૈનિક કાર્યોમાં સ્વાવલંઘન.

માનવજીવન ધારી મહત્વની વસ્તુ છે, કારણ કે એ જીવનમાં જ, પ્રાણી સાધન પરાયણ થઈને, વાસ્તવિક જીવન અથવા અંતિમ ધ્યેયથી, ચોગ પામીને, કૃત કૃત્ય થઈ શકે છે તેથી માનવ માત્રની એ જવાળાદારી થાય છે કે, મળેલી વસ્તુ, સામર્થ્ય તથા લાયકાતનો સહૃપદોગ કરવો. એમ ત્યારે જ થઈ શકે કે જ્યારે, પ્રાણી શારીરિક હિત માટે, આહારવિહાર ઉપર સંયમ અને હૈનિક કાર્યોમાં યથાશક્તિ સ્વાવલંઘન સિદ્ધ કરે, પરંતુ સુખલોલુપતાથી. માનવ શારીરિક હિતનો વિચાર છેડી હઈને સુખભોગમાં પ્રવૃત્તિ કરે છે. તેનું ધાર્યું જ ભયંકર પરિણામ એ થાય છે કે, પ્રાણી બિચારો, દેહાસ્કિતમાં ઇસાઈ જય છે અને તેને એ દેહાસ્કિતાની ભોગની પ્રવૃત્તિને પરિણામે, રોગ, શોક વગેરે હુણો ભોગવવાં પડે છે. એ સમજને પ્રાણીએ જાણવું જોઈએ કે માનવ જીવનની સાર્થકતા. સુખનાં પ્રલોલનનો ત્યાગ કરીને, હિતાવહ પ્રવૃત્તિમાં જોડવું જોઈએ, અહિતકર કર્મોમાં પ્રવૃત્ત થવું એ જીવનનો અનાદર છે, પ્રાકૃતિક નિયમનો વિરોધ છે અને અનંતનાં મંગળમય વિધાનનું ઉલ્લંઘન છે. એ સર્વ નાશનું મૂળ છે. સર્વ જાળે છે કે પશુઓનાં જીવનમાં, પ્રાકૃતિક નિયમનું યથેષ્ટ પાદન હોય છે, પરંતુ માનવ, પોતાને મળેલી સ્વાધીનતા નો હૃદ્યપ્રોગ કરીને, હિતકર પ્રવૃત્તિઓથી વિમુખ અને સુખકર વિલાસમાં ઇસાઈને, પોતાને હીન, હીન અનાવે છે અને સાધનયુક્ત જીવનને જોઈ બેસે છે. એ કારણે સુખ બુદ્ધિનો ત્યાગ કરી, હિત બુદ્ધિ પ્રમાણે વર્તન કરવું એ હુરેક ભાઈખુનને માટે પરમ આવશ્યક છે,

ખોરાકનો ઉપરોગ, પ્રાણ અથવા જીવન શક્તિ કાયમ રહે એ માટે છે, વિહારનો સંબંધ માનસિક સમતોલપણું સુરક્ષિત રાખવા સાથે છે, તેથી એ જ આહાર ઉપરોગી છે કે જેથી જીવન શક્તિનું પોષણ થાય,

અને વિહાર એ જ હિતકર છે કે જેથી વિદ્યમાન આસક્તિતની નિવૃત્તિ થાય. જે આહાર, સુખકર લાગે પણ હિતકર ન હોય અને જે વિહારથી નવીન રાગની ઉત્પત્તિ થાય તે સર્વથા ત્યાજ્ય છે, સૌ જાણે છે કે પ્રાણું શક્તિ ક્ષીણ થવાથી, પ્રાણી અશક્તિમાં પટકાય છે અને પોતાનું તાત્કાલિક કર્તાચ કર્મ પૂરેપૂરી રીતે કરી શકતો નથી અને એમ થવાથી જીવન, જગત માટે ઉપયોગી રહેતું નથી. તેથી જીવનશક્તિની રક્ષા માટે હિતકર આહાર અનિવાર્ય છે.

આહાર ધાર્યું કરીને, પ્રાણ પ્રકારના હોય છે. હિતકર, ભાવતા અને સુખકર. હિતકર આહાર તે છે કે જે સ્વભાવિક રીતે સાત્ત્વિક, ને સુપાચ્ય હોય અને જે મેળવવા માટે કોઈનું અહિત ન કરવું પડે અથવા જેનું ઉત્પાદન હિંસાત્મક ન હોય. ખાદ્ય પહાર્યોમાં કેટલીક એવી વસ્તુઓ હોઈ શકે છે કે જે સ્થૂળ શરીર માટે ઉપયોગી હોય. પરંતુ સૂક્ષ્મ શરીરને હુનિકર્તા હોય. લોજન વિજાનની દર્શિયે, આહારનો નિષ્ણિય કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જેઠાં કે સ્થૂળ શરીરનું પોષણ કરવા જતાં, પ્રમાદને કારણે કૃયાંદર્ભ સૂક્ષ્મ શરીરનું અહિત ન થઈ જય; કારણું કે સ્થૂળ શરીરનો નાશ થવા છતાં, સૂક્ષ્મ શરીર તો રહે છે. એટલું જ નહિ, સ્થૂળ, શરીર હોય ત્યારે પણ સૂક્ષ્મ શરીરને શુદ્ધ રાખવાનું અનિવાર્ય છે, કારણું કે સૂક્ષ્મ શરીર અશુદ્ધ થતાં જ, ચાલુ વિકાસમાં વિધન આવે છે, અને ભાવિ વિકાસ અટકી જય છે. તેથી આહારનો સંખાંધ, માત્ર સ્થૂળ શરીરને હેઠળ રાખવા પૂરતો જ નથી પરંતુ ધંદ્રિયો, મન, બુદ્ધિ વગેરેને પણ સ્વસ્થ રાખવાનો છે. એ ત્યારે જ સંલાલે કે જ્યારે જે આહાર સૂક્ષ્મ શરીર માટે હિતકર ન હોય, તેનો ત્યાગ થાય. ક્ષોલ, ક્રોધ અસહુન શીલતા વગેરે દોષોનો સંખાંધ સૂક્ષ્મ શરીર અસ્વસ્થ હોવા સાથે જ છે, તેથી એ જ આહાર ઉપયોગી છે, જે સ્થૂળ તથા સૂક્ષ્મ બંને શરીરોના હિતમાં હોય. સામાન્ય રીતે આ રહસ્ય ઉપર ધ્યાન નથી રહેતું એ ખરી રીતે પ્રમાદ છે,

ઇચ્છિકર અને સુખકર લોજનમાં કેવળ એજ ફેર છે કે, ઇચ્છિ, છરસોમાંના કોઈ એક ખાસ રસની હોય છે, અને સુખકર લોજનમાં કોઈ ખાસ પદાર્�નો આગ્રહ હોય છે. ઇચ્છિકર આહાર શરીરની માંગ છે, અને સુખકર આહાર સ્વાધની આસક્તિ છે. જેકે સ્વાધની આસક્તિને કારણે કોઈ ખાસ પદાર્થનો આગ્રહ થાય છે, રસ વિશેષનો નહિ એ ભૂલથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. હિતકર અને ઇચ્છિકર લોજન તો હુમેશાં કરવાનું હોય છે. તત્કાળ માંગની દ્રષ્ટિઓ નિખુતિની દ્રષ્ટિઓ, ઔપધની પેઠે કહી કહી સુખકર લોજન લકે થાય પણ તેમાં કંઈ એવી વસ્તુ ન હોવી જેઠાં જે સ્વદ્ધ શરીરને માટે અહિતકર થાય. સ્વાદ અભ્યાસથી અને છે; સ્વભાવિક હોતો નથી. સ્વભાવથી રસનો સ્વાદ હોય છે. પણ વસ્તુ નો નહિ. તીવ્ર અને ઉત્તેજક રસો વિશેષ પ્રમાણુમાં સેવન કરવાથી જુલની શક્તિક્ષીણ થઈ જાય છે, એમ થવાથી સ્વભાવિક સ્વાદ અહણ કરવાની શક્તિ રહેતી નથી. એ કારણે સાત્ત્વિક વસ્તુઓમાં ઇચ્છિ નથી રહેતી અને રાજ્યસ અને તામસ વસ્તુઓ ઇચ્છિકર લાગે છે. એ બનાવટી ઇચ્છિનો નાશ કરવા માટે, વસ્તુઓના આગ્રહનો ત્યાગ કરવો જેઠાં અને માત્ર રસનો આગ્રહ રાખવો જેઠાં; શરીરને ફરેકે રસની આવશ્યકતા છે, તેથી જે વસ્તુમાં સ્વભાવિક રસ હોય તે તેવાજ ડ્રેપમાં સેવન કરવાથી, સાત્ત્વિક આહારમાં ઇચ્છિ આવી જાય છે અને રાજસિક કે તામસી આહાર ઇચ્છિકર રહેતો નથી, સાત્ત્વિક આહાર કરવાથી આહારમાં આસક્તિ નથી થતી અને રાજ્યસ કે તામસ આહારથી રને અને તમોણુણું વૃદ્ધિ થાય છે. જે તુકશાનનું મૂળ છે,

ખરી રીતે તો લોજન એ યજ્ઞ છે, ઉપલોગ નથી, એ દૃષ્ટિએ લોજનમાં એવી વસ્તુઓ લેવી જેઠાં કે જેથી પ્રાણુદેવતાનું થથાવત પૂજન સેવન થઈ શકે, અર્થાતું પ્રાણુશક્તિ સુરક્ષિત રહે યજ્ઞમાં તે વસ્તુઓનો જ ઉપયોગ થાય કે જે હિતકર હોય, તેની જ આહુતિ અપાય છે, અને

હિત, એવી જ વસ્તુઓથી થાય કે જે સ્વાભાવિક રીતે જ સાત્ત્વિક હોય. બોજન કર્યારે અને કેમ કરવું જોઈએ તેનું જ્ઞાન પણ આવશ્યક છે. સ્વાસ્થ્યની દસ્તિએ. દિવસના ખીજ પહોરમાં અને રાત્રિના ઘેલા પહોરમાં બોજન કરી લેવું જોઈએ. બોજન શાંત તથા પ્રસન્ન ચિંતા ચાવી ચાવીને કરવું જોઈએ જેથી તેમાં ચોણ્ય પ્રમાણુમાં મોઢાનો રસ લઈ જય. એ સંખંધમાં કેટલાક તો એટલે સુધી કહે છે કે ખાવાના પદાર્થેને પીએ અને ખાવાના પદાર્થેને ખાએ, અર્થાતું બોજન પદાર્થેને એટલા ચારો કે તે પાણી જેવા પ્રવાહી થઈ જય. બોજનનું માપ એટલું હેવું જોઈએ કે તે બહુ વધારે ન હોય અને એછું પણ ન હોય. બોજન એટલું જ કરવું જોઈએ કે જેથી પેટને સંભાળવું ન પડે. પેટને વધારે યા એછું ખાવાથી જ સંભાળવું પડે છે, એ એઉ સ્થિતિ અપાકૃતિક છે. કંઈપણ શારીરિકશ્રમ શિવાય, બોજન લેવું અહિતકર છે. તેથી શ્રમ થયા પછીજ બોજન કરવું જોઈએ. બોજનની ઉત્પત્તિ અને તેને પચાવવાની કિયાનો સ્થૂર્ય સાથે સંખંધ છે. તેથી જ દિવસના ખીજ પહોર દરમ્યાન અને રાત્રિના પહોરા પહોરમાં જ બોજન કરવાનું હિતકર છે. જે માણસોમાં કર્મ, વિચાર અને સ્નેહની બોજન કરનાર સાથે એકતા હોય, તેવા માણસોનું બનાવેલું બોજન સ્વાસ્થ્ય આપનાર હોય છે. તેથી કર્મ વિચાર અને સ્નેહની એકતા રહે. બોજન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેણે સુધી સૌને આપીને બોજન કરવું. બોજન બનાવતી અને રસોઈ કરાવતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમાંથી ખીજને પણ દેવાનું છે. પોતાને જ માટે રસોઈ બનાવવી કે કોઈ પાસે બનાવરાવી ચોણ્ય નથી, કેમકે પ્રત્યેક પ્રાણી એ, એ અવસ્થામા પોષણ લીધું છે કે જ્યારે તે પોતે કંઈ કરી શકતો નહિ, એ નિર્વિવાદ સત્યનો હુમેશાં ઘ્યાલ રાખવો જોઈએ. એ ખૂબ યાદ રાખવું જરૂરી છે કે આપણું ને મળ્યું છે તે કોઈએ આપેલું છે તેથી હેવા લાયક થયા હોઈએ, ત્યારે દઈને જ બોજન કરવું જોઈએ.

વિહાર, મન, ઈદ્રિય વગેરેનું સોજન છે. એ સંખંધતું પણ યથાર્થ ધ્યાન રાખનાનું અનિવાર્ય છે. મન, ઈદ્રિય વગેરેમાં ઉત્પન્ન થતા વેગાને ફ્લાવી અને છૂટથી પૂરા કરવા એ અહિતકર છે. જે વેગજિત્પન્ન થાય તે વેગાને, નિયમમાં, સાધન બુદ્ધિથી લાવી પૂરા કરવા. વેગ છૂટા રાગનું પરિણામ છે. જે રાગનો, વિવેકપૂર્વક નાશ કરી શકાય નહિ, તેની ચોણ્યતા અનુભવ કરવા માટે નિયમિત અને મર્યાદિત પ્રવૃત્તિ કરવી એ અનિવાર્ય છે. પ્રત્યેક પ્રવૃત્તિને અંતે સ્ત્રાલાલિક નિવૃત્તિ પ્રાપ્ત કરીને મન અને ઈદ્રિયને સ્વસ્થ તથા શાંત કરવાં જોઈએ; કેમકે પ્રવૃત્તિને અંતે, મન ઈદ્રિય વગેરે શાંત અને સ્થિર થઈ જાય ત્યારે જ આવશ્યક શક્તિનો વિકાસ થાય છે એ જ ઉજ્વલિનું મૂળ છે.

ઈંક, તરસ્સ, ભૂણ, નિદ્રા અને મૂત્રના ત્યાગ વગેરે શારીરિક વેગોનું યથા સમય નિવારણ કરવું એ જ સ્વાસ્થ્યનું રક્ષણ કરનાર છે. કામ વેગ સંખંધી વાત ઉપર પણ વિચાર કરવાનું આવશ્યક છે. મનો-વિજ્ઞાન પ્રમાણે વિચારતાં કામનો વેગ, શરીરના ધીજા સર્વ વેગાથી અધિક તથા મુખ્ય છે જ્યાં સુધી સર્વ ઈદ્રિયોનું અનુભ્યવાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી કામ ઉપર વિજય મેળવવાનું સંભવિત નથી. શરીરની વાસ્તવિકતા અને સૌદર્ય અને ઈદ્રિય જન્ય જ્ઞાનનો સહ્યાદ્રાવ જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી કામનો અંત થઈ શકતો નથી. તેથી કામ ઉપર વિજય મેળવવાને માટે, શરીરની વાસ્તવિકતાનું યથાર્થ જ્ઞાન અને પોતાના ઈષ્ટ (ઇશ્વર)ની અત્યાંત લક્ષ્ય, પ્રકટ થાય એ જરૂરનું છે. કારણ કે પોતાના લક્ષ્ય ઉપર દદ લક્ષ્યનો રસ એ રસની તીવ્રતા એવી ઉત્પન્ન કરે છે કે ધીજી ઘંધી ઈચ્છાએ. વિલીન થઈ જાય છે. તેથી એ સ્થિતિ કામનો અંત લાવવા સંમર્થ છે. કોઈ આસ્તિકનું કહેવું છે કે રામની લક્ષ્ય, કામનો નાશ કરીને, રામ સાથે લક્ષ્યનો યોગ કરી દે છે. તે શિવાય જ્યાં સુધી બને ત્યાં સુધી બક્તિગત રોજનાં કામો પોતાની મેળે કરી લેવાં જોઈએ. ધીજાની સહાય, જ્યાં સુધી પરવશતાની સ્થિતિ આવી જાય, ત્યાં

ન જ લેબી. કારણુ કે પોતે ન કરીએ તો શ્રમની મહત્વા સમજતી નથી
અને પ્રાણી આળસુ, વિલાસી અને સંઘરાખોર અની જય છે. તેમ થવાથી
મનુષ્યને પૈસાનો દોલ વધે છે અને લોણું કરવાની જાવના ઉત્પદ્ધ થાય
છે. એથી ભિથ્યાલિમાન પેહા થાય છે. અને સમાજમાં દરિદ્રતાની વૃદ્ધિ
થાય છે. વિચારીને, સ્વાક્ષરણન આચરણમાં મૂકીને. સમાજમાં શ્રમની
મહત્વા વધારવી જેઈએ. તેથી પરસ્પરમાં એકતાની વૃદ્ધિ અને દરિદ્રતાનો
નાશ થવાનો સલબ છે. એ રીતે આપણે આળસ, અલિમાન અને વિલાસ-
તાથી સુકૃત અની, સત્ય જીવનના અધિકારી અની શક્ષણું. તેથી હેડલાઇ-
અહેનોએ, શારીરિકહિતની દષ્ટિએ, આહાર વિહારમાં સથમ તથા રોજ-
અરોગ્યના કામોમાં સ્વાક્ષરણનથીલ થદાનું અત્યંત આવશ્યક છે.



નવમો નિયમ

શરીર અમી મન સંયમી હૃદય અનુરાગી ખુદ્ધિ વિવેકવાળી તરફાની અહું અને અભિમાન રહિત કરી પોતાને સુંદર બનાવવા.

પોતે સુંદર બનવાને માટે, ઉપરના નિયમનું અક્ષરશઃ ગાલન કરવું અનિવાર્ય છે. શરીર અમી એટલે આળસ અને કર્મશૂન્યતાનો નાશ કરીને વર્તમાન કર્ત્વય કર્મ. અધિકાર લાલસા વિના, લક્ષ્ય ચુક્યા શિવાય પૂરાં કરવાં એ પ્રત્યેક લાઈ જહેનને માટે ઘણું આવશ્યક છે. વર્તમાન કાર્યને ન કરવાથી, ભૂતકાળની ભૂલોનાં ચિંતનનો નાશ થતો નથી અને અને અવિષ્ય ઉજ્જવલ બનતું નથી. એ કારણે વર્તમાન કર્ત્વય કર્મ ઘણું મહત્વની બાબત છે. આવશ્યક અને ચોંચ શ્રમ કર્યા વિના, સાચા વિશ્રામનાં સાચાન્યમાં પ્રવેશન થતો નથી. આળસ અને વિશ્રામમાં મોટું અંતર એ છે કે, બિચારો આળસુ વ્યર્થ ચિંતન અને મિથ્યાચારમાં ફેસેબો રહે છે. ઉપરથી અકર્મણ્ય રહેતો હોવા છતાં વ્યર્થ ચિંતન દ્વારા માનસિક શક્તિનો ક્ષય કરતો રહે છે. એ અનર્થનું સૂચ છે. એ દિલ્લિએ માનવ જીવનમાં આળસ અને કર્મ શૂન્ય રહેવા માટે કોઈ આવકાશ નથી. એટલું જ નહિ પણ નિય નવા ઉત્સાહ પૂર્વક વર્તમાન કર્ત્વય કર્મ કરવું એ અનિવાર્ય છે. એ વિકાસનું મૂળ છે. વિશેષમાં કર્ત્વય નિષ્ઠ થયા શિવાય, સમયનો આદર થઈ શકતો નથી. સમયનો અનાદર, જીવનનો ઘોર અનાદર છે. સમયને ઉપરોગ કરીને વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે. પણ કોઈ વસ્તુને બદલે વીતેલો સમય પાછા આવતો નથી. એ દિલ્લિએ, સમય ખડુ મૂલ્યવાન છે. તેથીજ સમયનો આદર કરીને, શ્રમી થવાનું અનિવાર્ય છે. શ્રમનો સાચો અર્થ એ નથી કે શક્તિ બહારનું કાર્ય કરવાનો પ્રયત્ન કરવો પણ શ્રમથી પ્રાપ્ત સામર્થ્યનો સહૃદ્યય થાય છે અને જે કાર્યો બની શકે છે તે પૂરું થઈ જય છે. જે કરી શકાતું નથી એની ઉત્થતિજ નથી હોતી. (એ પ્રાપ્ત કર્ત્વય ગણ્યાય નહિ) એટલે તે કર્મ ન કરવાથી

મનનો સંયમ આપ મેળેજ થઈ શકે છે. એ સર્વને જાણીતી વાત છે કે આવશ્યક કાર્ય પૂર્ણ કરવાનું અને અનાવશ્યક કાર્યમાંથી નિવૃત્તિ સેવવી, એ શિવાય માનસિક શાંતિ સુરક્ષિત ન રહે એ શક્તિના. પ્રગતિના ક્ષયનું મૂળ છે. આવશ્યક અને અશુદ્ધ સંકલપોનો ત્યાગ અર્થાત વિવેક શુદ્ધ અને શક્તિ ખાડારના સંકલપોનો નાશ કરવાનું અનિવાર્ય છે. એ નાશ થયેથી આવશ્યક અને શુદ્ધ સંકલપ સ્વતઃ પૂરા થવા લાગે છે. એ પ્રાકૃતિક નિયમ છે. પરંતુ સંકલપ પૂર્તિનો ઉપયોગ કરવાથી સંયમ સિદ્ધ થતો નથી કારણ કે સંકલપપૂર્તિથી થતાં સુખમાં રાચવું એ નવીન સંકલપોની ઉત્પત્તિનું કારણ બને છે.

એ સર્વ ભાઈ ફેનોનો અતુભવ હોય છે કે કોઈના પણ સર્વ સંકલપો પૂરા થતા નથી અને સર્વના ડેટલાક સંકલપો પૂરા થાય છે. સંકલપ પૂર્તિના સુખનો સ્વાદ (લોગ) નવીન સંકલપને જન્મ આપે છે. તેથી અશુદ્ધ સંકલપોની પૂર્તિનું તો માનવ જીવનમાં કોઈ સ્થાન જ નથી. પરંતુ આવશ્યક અને શુદ્ધ સંકલપોની પૂર્તિના સુખનો ભોગ પણ ન કરવો જેઈએ અર્થાત સંકલપ પૂર્તિ જીવનનું લક્ષ્ય છે એમ માનવાની ભૂલનો નાશ કરવાનું અનિવાર્ય છે. ત્યારે જ આપેઆપ સંકલપપૂર્તિને અંતે સંકલપોની નિવૃત્તિ થઈ જય છે. અને એમ થવાથી સાધક શાંતિના સામ્રાજ્યમાં પ્રવેશ મેળવે છે. જે કે સંકલપ નિવૃત્તિની શાંતિ, સંકલપ પૂર્તિના સુખના ઉપયોગ કરતા ઘણું મહત્વ ધરાવે છે, તો પણ સંકલપ નિવૃત્તિની શાંતિનું સુખ માણીએ તોય સંયમ સિદ્ધ નથી થતો. તેથી સંકલપ અપૂર્તિનું હુઃઅ થવાથી લયલીત જનલું નહિ અને સંકલપ પૂર્તિના સુખના લોગમાં અને સંકલપ નિવૃત્તિની શાંતિમાં પણ રાચવાનું નથી. સંયમના પૂર્ણતાતો સુખહુઃઅ અને શાંતિની આસક્તિના ત્યાગમાં છે.

શારિરિક અમ દ્વારા આવશ્યક કાર્યની પૂર્તિ અને આવશ્યક કાર્યની નિવૃત્તિ થયા પછી મનનો સંયમ શરૂ થાય છે. સ્વાભાવિક નિયમ પ્રમાણે એક સાધનની પૂર્ણતામાં થીલાં સાધનનો આરંભ રહેદો છે.

તेथी શરીરશ્રમી જનવા પછી મનનો સંયમ થવાનો આરંભ થાય છે અને તેમ થવાથી મન નિર્વિકલ્પ થઈ જાય છે. મન નિર્વિકલ્પ થતાં જ બુદ્ધિ સમતાયુક્ત થાય છે. કારણું કે સંકલ્પની ઉત્પત્તિ થાય તો બુદ્ધિ સાચું જોડું શું તેની વિવેચના કરવા લાગે છે. મનની નિર્વિકલ્પતાથી બુદ્ધિમાં સમતા રહે છે. એજ ખરો યોગ છે યોગ કલ્પવૃક્ષ જેવો છે. એથી જિજાસુઅને વિચાર પ્રેમની પ્રેમ અને જૌતિકવાહિયાને આવશ્યક સામન્ય પેહા થાય છે. મન સંયમી થાય ત્યારે બુદ્ધિ આપોઆપ વિવેક યુક્ત જની જાય છે. તેમ થતાં હેઠને હેહી બુદ્ધાં છે એ જીન થાય છે. તેથી વાસના રહિત પણું આવે છે અને તેમ થતાં નિર્વેરતા, નિર્બિયતા સમતા, સુદિતા આહિ હિંય ગુણો પ્રકારો છે; એટલું જ નહિ પણ બુદ્ધિ વિવેક શીલ થતાં જ, દરેક માનવને પોતાના કર્ત્વ અને ધીજના અધિકારનો સ્પષ્ટ જોગ થાય છે એ વિકાસનું મૂળ છે.

વાસનાઓના નાશમાં જ નિર્માહૃતા રહેલી છે અને હેઠને હેહી વચ્ચેના તઙ્કાવતનું જીન થતાં જ, પરાધીનતા તથા જડતા હુર થઈ જાય છે, અર્થાતું સ્વાધીનતા અને ચિન્મય જીવન સાથે અલેહ સંધાર છે. તે કારણે વિવેક બુદ્ધિથી જ સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. પરંતુ સ્વાધીનતામાં પણ રાચીએ નહિ તો હૃદયમાં અનુરાગ (પ્રેમ) પ્રકારો છે, પ્રેમી હૃદયમાં જ સેવાલાવ સજ્જવ થાય છે, હુઝીઓને હેણી, કદ્દાણિત અને સુખીઓને હેણીને પ્રસન્ન થલું એ અનુરાગી હૃદયનો સ્વલાવ જ છે, એટલું જ નહિ અનુરાગ શિવાય લક્ષ્મિરસ પ્રકટ થવાનો કોઈ રીતે સંસ્કરણ નથી. એ સર્વ સંમત વાત છે કે, નિર્ણામતા વિના, પરમ શાંતિ, વિવેકપૂર્વક અસંગતા વિના સ્વાધીનતા તથા ચિન્મય જીવનનો યોગ અને અનુરાગ શિવાય, નિતનવરસ કે અગોધ પ્રેમની જગૃતિનો સંસ્કરણ નથી. તે શિવાય વાસ્તવિક જીવન ગણ્યાય નહિ. બત્તમાન કર્ત્વ કર્મ સંપાદન કરવામાં જ સુંદર સમાજનાં નિર્માણ તથા સંયમનો આરંભ

થાય છે. સંયમની પૂર્ણતામાં આત્મશક્ત સામર્થ્યની ઉત્પત્તિ તથા આત્મવિવેકની આવકારદાયકતા રહેલાં છે. વિવેકચુક્ત થવાથી સમતાના સામ્રાજ્યમાં પ્રવેશ થાય છે. તેમ થવાથી સાધક ઘણી જ સુગમતાપુર્વક જડતા રહિત થઈ જય છે. જડતાનો નાશ એજ ચિન્મય જીવનનો યોગ છે. એ દૃષ્ટિએ સમતા ઘણી મહત્વની વસ્તુ છે. પરંતુ સમતાથી જન્મૈલ સ્વાધીનતાથીજ સંતુષ્ટ થવાનું નથી. તેના સંતોષમાં નરાચવાથી અહુમદ્રષ્પી અણુનો નાશ થાય છે. તેમ થનાં જ નિરભિમાનતા તથા લેદલાવ રહિત પણું ઉદ્દ્ય પામે છે. એ વિકાસની પરાક્રમા છે.

કર્ત્ત્વી પરાયાચુતાથી ચાલુ આસક્તિનો નાશ થાય છે અને સંયમથી નવી આસક્તિ ઉત્પન્ન થવા પામતી નથી. વિવેકચુક્ત થવાથી રાગરહિત બન્યાનું અભિમાન રહેતું નથી. અર્થાત્ હોષેની ઉત્પત્તિ થતી નથી અને ગુણોમાં રાચવાનું થતું નથી. રાગ રહિત ભૂમિમાં જ ચોગડ્યી વૃક્ષ ઉગે છે અને તે વૃક્ષ ઉપર, તત્ત્વજ્ઞાન ઇંદ્રી ઇણ એસે છે. એ ઇણ પ્રેમરસથી પરિપૂર્ણ હોય છે. બસ એજ માનવ જીવનની પૂર્ણતા છે. એ કારણે આગસનો નાશ કરવા શ્રમી, અસંયમનો નાશ કરવા સંયમી, અવિવેકનો અંત લાવવા માટે વિવેકચુક્ત, રાગ દ્રેષ રહિત થવા માટે અનુરાગી અને લેદલાવ રહિત થઈને હુરેક લાઈ ફણેન અભિમાન રહિત બની જય એ જરૂરતું છે. શરીર મન ખુદ્દિ અને અહુમાનવ માત્રમાં રહેલાં છે. તેથી જે, પ્રાપ્ત છે, તેને સર્વાંગ સુંદર અનાચવાની જવાબદારી સર્વ માનવ ઉપર રહેલી છે. એ કારણે ઉપરોક્ત નિયમનું પાલન કરીને, પોતે સુંદર બનવું અનિવાર્ય છે.



દરશમો નિયમ

સિક્કા કરતાં વસ્તુ, વસ્તુ કરતાં બ્યક્ટિત બ્યક્ટિત કરતાં વિવેક અને વિવેક કરતાં સત્યને અધિક મહત્વ આપવું.

ગંભીરતા પૂર્વક થથાર્થ વિચાર કરવાથી, પ્રત્યેક લાઇફનને વિહિત થશે કે વસ્તુઓના આદાન પ્રદાનનાં ભાધ્યમ તરીકે જ, સિક્કાઓનો પ્રવાર શરૂ થયો છે. જીવનમાં સિક્કાની કોઈ આવશ્યકતા નથી. હા એ ખરૂં છે કે જે ધાતુઓના સિક્કા બનાવાય છે, તે ધાતુ લલે ઉપયોગી હોય પણ સિક્કા તો કેવળ રાખ્યાનું પ્રતીકાત્મક ચિહ્ન માત્ર છે. તેના દ્વારા બ્યવહારમાં સગવડ થાય છે. પરંતુ સિક્કાનો સંબંધ તો ધણો હુંઘડ સિક્ક થયો છે. આગસ, કર્મ રહિતપણું તથા અલિમાનનાં પોષણમાં સિક્કાનો બહુ મોટો લાગ છે. જે કે સર્વ હોષાની ઉત્પત્તિ, અવિવેક સિક્ક છે, પણ તેનું પોષણ કરવામાં સિક્કાનું સુખ્ય સ્થાન છે. આજ સિક્કાના બળ ઉપર અસાધારણું બ્યક્ટિત, મોટા મોટા વિજ્ઞાનવેત્તાઓ તથા કલાકારીને ખરીદી લે છે. તથા બૌદ્ધિક ધર્મો, સિક્કાને આધીન થઈ ગયો છે. એ સર્વ વિચારશીલોને જાણીતી વાત છે.

જીવનમાં આવશ્યકતા વસ્તુઓની છે. તેની ઉત્પત્તિ માત્ર પ્રાકૃતિક પ્રદાર્થ અને બૌદ્ધિક અને શારીરિક અગથી થાય છે. જેટલે દરજને સિક્કાનો સંબંધ શક્ય છે, તેટલી હુદે ઉત્પત્ત થયેલ વસ્તુઓના સંબંધ સરલતા પૂર્વક શક્ય નથી. સંબંધની ભૂખ આગસને જન્મ હે છે. આગસની વૃદ્ધિ થવાથી, આવશ્યક વસ્તુઓના ઉત્પાદનમાં વિધન થાય છે. સિક્કાનો સંબંધ, આગસું બ્યક્ટિતઓની હૈનિક આવશ્યકતાઓ સંતુષ્ટ કરવામાં પૂરૈપૂરૈ. સાથ આપે છે. તેથી તે બિચારા ઉત્તરોત્તર નિર્દ્વભી થવા તરફ ધકેલાય છે. એ વિનાશનું ભૂળ છે. એટલું જ નહિ પણ સિક્કા તે જિચારાઓને અલિમાની બનાવી હે છે. તેથી તેઓ પોતાના જ દ્વારા, પોતાનો નાશ કરી એસે છે.

માનવ સેવા સંઘની નીતિ પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન સિક્કાનો સંબંધ કરવા માટે કરવો એ ભૂલ છે. એ ભૂલનો અંત લાવવો અનિવાર્ય છે, તે ત્યારેજ બને કે જ્યારે સિક્કા કરતાં વસ્તુઓની વિશેષ મહત્તમા છે એ સમજય. વસ્તુઓ પ્રાણીમાત્ર માટે ઉપયોગી છે. તેનું ઉત્પાદન અને સંબંધ પ્રાણીઓની સેવામાટે ઘણાં આવશ્યક છે. તે કારણે વસ્તુઓ કરતાં, વ્યક્તિઓને વિશેષ મહત્ત્વ આપવું એ ચોક્કસ આવશ્યક છે પ્રત્યેક વ્યક્તિ, સમાજનું જુહું ન પાડી શકાય તેવું અંગ છે. તેથી વ્યક્તિઓ પૈકી એવી વ્યક્તિઓનું અધિક મહત્ત્વ છે, કે જે એઓ પ્રાણીત વિવેક અપનાવી, અવિવકનો અંત કર્યો છે. અર્થાત् વિવેક યુક્ત છે. વિવેકયુક્ત થવાથીજ, પોતાનાં કર્તાંય અને ધીજનાં અધિકારનો એધ થાય છે. એ હકીકત સર્વ માન્ય હોય જ કે જેમણે, પોતાના અધિકારનો ત્યાગ કરીને, ધીજનાં અધિકારની રક્ષા કરી હોય, એજ વિવેકી પુરુષોએ. પરસ્પર એકતા સુરક્ષિત રાખવામાં શક્તિવાન બન્યા છે, અને તેમનાથીજ શાંતિની સ્થાપના તથા સંધર્ણનો નાશ થયો છે. તેથી જ વ્યક્તિ કરતાં વિવેકને વિશેષ મહત્ત્વ આપવું એ જરૂરી છે. વિવેકયુક્ત હોવાથી વ્યક્તિ લોકમાન્ય બને છે. એટલું જ નહિ પણ વિવેક અપનાવવાથી, નિર્ણામતા, નિર્માહિતા વળોરે દિવ્ય ગુણોનો વિકાસ થાય છે. એટલે કે જાણેલાં અસતતા ત્યાગમાં વિવેક હેતુ ભૂત થાય છે. એ દર્શિયો વિવેક સાધન અને સત્ય સાધ્ય છે. તેથી વિવેકથી સત્યને વિશેષ મહત્ત્વ હેવું જોઈએ.

ઉપરોક્ત નિયમોનું પાલન કરવાથી, આપણું કલ્યાણ અને સુંદર સમાજનું નિર્માણ ઘણી સુગમતાપૂર્વક થઈ શકે છે. એ હકીકત નિર્વિંવાહ સિક્ક છે કે સુંદર સમાજનાં નિર્માણમાં પરસ્પર એકતા સુરક્ષિત રહે એ સ્થિતિ અનિવાર્ય છે. એવું ત્યારે જ સંભવે કે જ્યારે સિક્કાથી વસ્તુનું મહત્ત્વ વધારે યણ્ણાય. વસ્તુઓનાં ઉત્પાદનમાં શારીરિક અને ઔદ્ધ્વીક શ્રમનું સુખ્ય સ્થાન છે. તેથી શ્રમી થવાને માટે

સિઝાનું મહત્વ ઓછું માનવું અને વસ્તુનું મહત્વ વધારે માનવું એ
આવશ્યક છે. પરંતુ ઉત્પાદિત વસ્તુઓનો સફળ્ય કર્યા વિના, પ્રાણી
ઓની ઉચિત સેવા કરી શકાય નહિ તેથી વસ્તુઓથી વ્યક્તિઓનું
અધિક મહત્વ સમજવું એ ઘણું આવશ્યક છે

ને વ્યક્તિથી વિવેકને અધિક મહત્વ ન આપીએ તો કર્તાંય
પરાયણુતા અને હરદેશીપણું ન રહે. એ સ્થિતિ વિનાશનું મૂળ છે. તેથી
એ હક્કિકત અનિવાર્ય છે કે એક વિવેકચુક્ત પુરુષનું મૂલ્ય, અનેક
વ્યક્તિઓ. કરતાં ઘણું વધારે છે. બહુ સંખ્યા માત્રને મહત્વની ગણવી
અને વિવેકી માણુસોનો અનાદર કરવો એ અનર્થનો હેતુ છે. તેથી જ
વ્યક્તિઓ. કરતાં વિવેકને વિશેષ મહત્વનો ગણવાનું જરૂરનું છે. ને કે
પ્રાકૃતિક નિયમ પ્રમાણે, સર્વભાઈ જ્ઞાનોને વિવેકરૂપી પ્રકાશ પ્રાપ્ત છે.
છતાં મોહવશ થઈને પ્રાણી વિવેકનો અનાદર કરે છે. ત્યારે તે પોતાનાં
કર્તાંય અને લક્ષ્યની વિસુધ બની જાય છે. તેનું પરિણામ એ થાય છે
કે ન તો વ્યક્તિનું કલ્યાણ થાય કે ન સુંદર સમાજનું નિર્માણ બને.
એ કારણે વિવેકનો ઉપયોગ માત્ર સત્યની શોધ કરવામાં છે, તેથી
વિવેક કરતાં સત્યને વધારે મહત્ત્વ આપવી જોઈએ; અર્થાત् સત્ય પ્રાપ્ત
શવામાં જ, વિવેકનો ઉપયોગ છે

માત્ર દાર્શનિક દિલ્લિંદુનો વિકાસ કરવાને માટે વિવેક નથી
મળ્યો. પ્રાકૃતિક નિયમ પ્રમાણે દર્શન અનેક હોવા છતાં, જીવન તો
એક જ છે. દાર્શનિક જેહ હોવાને કારણે પરસ્પર વિવાદ્યી બચવા માટે,
વિવેક કરતાં સત્યને અધિક મહત્વનું સમજવું એ જરૂરનું છે. ઉપરોક્ત
નિયમનું અનુસરણ કરવાથી ઘણી જ સુગમતા પૂર્વક, વ્યક્તિનું કલ્યાણ
અને સુંદર સમાજનું નિર્માણ થઈ શકે એ નિર્વિવાહ સિદ્ધ છે.



અગ્રાધમો નિયમ

વ્યર્� ચિત્તનના ત્યાગ અને વર્તમાનના સહુપદેશ દ્વારા, લખિષ્યને ઉજાવળ અનાવવું.

સર્વ જ્ઞાને છે કે વ્યર્થ ચિત્તનથી (નકામી ચિત્તા કે નકામા વિચારણી) કોઈ પ્રકારનું હિત સધાતું નથી; બદકે પ્રાપ્ત સામર્થ્યની ક્ષયજ થાય છે. એટલા માટે તેનો ત્યાગ કરવાતું જરૂરી છે. નકામી ચિત્તા કે નકામા વિચારણ, લોગવેલ અને વગર લોગવેલ ધ્યાનાઓનું પરિણામ છે. બીજુ કશું નથી. માનવ જે કરી ચૂક્યો છે, અથવા જે કરવાની ધ્યાન કરે છે અથવા સાંભળેલાં, દેખેલાં કે કરેલાં કર્મોના જે સંસ્કાર, તેના મનમાં કોતરાયા છે, તે વર્થ ચિત્તનના રૂપે, પ્રકટ થાય છે. પરંતુ સાધક, સાવધાન રહે નહિ તેથી તેવાં ચિત્તન કર્યા કરે છે અને તેનું સમર્થન અથવા વિરોધ કરવા માટે છે. તેનું ઇણ એ થાય છે કે બિચારો વર્થ ચિત્તનમાં ફ્રસાય છે અને અવશ્ય કરવા લાયક ચિન્તન કે ચિન્તન રહિતતાથી નિર્વિકલ્પતાથી બિમુખ થઈ જય છે.

એ પ્રાકૃતિક નિયમ છે કે જે વસ્તુની પ્રાપ્તિ, કર્મ કરવા પર આધારિત છે, અથવા જે પર પ્રકાશ છે, અથવા જેમાં કાયમ ઈરદ્દાર થયાજ કરે છે તથા જે ઉપયત્તિ અને વિનાશ ધર્મવાળું છે, જેનાથી દેશ કાળનો લેન છે, તેવા વિષયનું ચિત્તન વર્થ ચિત્તન કહેવાય છે. કારણું એવાં ચિત્તન માત્રથી તે વિષયની પ્રાપ્તિ થઈ જતી નથી. પ્રાપ્ત વસ્તુ, સામર્થ્ય, લાયકાતનો વિવેકપૂર્વક સહુપદેશ કરવાથી, આવશ્યક વસ્તુ શક્તિ કે લાયકાતની પ્રાપ્તિ મંગળમય વિધાન પ્રમાણે સ્વતઃ થાય છે. તેથી વસ્તુ, અવસ્થા પરિસ્થિતિ વગેરે મેળવવામાં, નકામા વિચારને કોઈ અવકાશ નથી. એટલું જ નહિ નકામો વિચાર પ્રાપ્ત પરિસ્થિતિના સહુપદેશમાં આધકનીવડે છે.

એ દૃષ્ટિભિન્નથી જેતાં, વર્થચિન્તન. સર્વને માટે અહિત કરના રૂંજ છે. હવે જે કોઈ એમ કહે કે આગળ પાછળનો વિચાર કર્યા શિવાય, ૧૦

વર्तमान કર्तव्यनी સિદ્ધિ સહેળ ન થાય, તો એવું માનવમાં અસાધય-
પણાં શિવાય બીજું કંઈ નથી. કર્તવ્ય નિષ્ઠ મનુષ્ય ભૂતકાળના જનાવોના
અનુભવોને આત્મસાત કરીને, વર્તમાન કાર્ય સુંહરતા પૂર્વક અને સાંગો
પાંગ, પૂર્ણ કરે છે. ઘટનાઓ પથ પ્રદર્શન કરે છે અને તેનું ચિંતનનો
રાગદ્રેપની આસક્તિમાં ફ્રસાવે છે. એ આસક્તિ નુકસાનનું ભૂળ છે. ભવિષ્ય
ની આશાઓમાં ફ્રસાઈ રહેવું અને લક્ષ્યપૂર્તિને માટે વર્તમાન કાર્યને
પૂરાંન કરવાં એ લારી ભૂલ છે. એભૂલનો અંત કર્યા શિવાય કર્તી ભવિષ્ય ઉજ્જ-
વળ નથી થઈ શકતું; કારણું એકમાત્ર વર્તમાનના સહૃપદોગથી જ ભવિષ્યની
ઉજ્જવળતા. સિદ્ધ થાય છે. વર્તમાનની સરસતા ભવિષ્યને સુંદર જનાવે
છે. એ પુરષોનું વર્તમાન ચરસ રહે છે કે જેએ પ્રાપ્ત પરિસ્થિતિનો,
આદરપૂર્વક આવકાર કરીને, સહૃપદોગ કરે છે. અને ચોતાની અનુકૂળ પરિ-
સ્થિતિની ગુલામીમાં અને પ્રતિકૂળ પરિસ્થિતિના ભયમાં ફ્રસાઈ રહેતા નથી.
એટલું નહિ પણ જેએ ઉદારતા અને ત્યાગપૂર્વક અનુકૂળતામાં ઉદારતા
અને પ્રતિકૂળ સ્થિતિ (માંત્યાગ)નો સહૃપદોગ કરે છે. પ્રત્યેક પરિસ્થિતિ,
મંગળમય રચનાથી આવે છે. તેના સહૃપદોગમાંજ, સાધકનો વિકાસ રહેલો
છે, પરિસ્થિતિમાં જીવન ખુદ્ધિ. રાખવી એ ભૂલ છે. એટલું નહિ
પણ પ્રત્યેક ભાઈઝને, સર્વ પરિસ્થિતિ એથી પર હિંય ચિન્મય જીવ-
નનો દોગ રાખવો એ આવશ્યક છે. કારણ કે તે વાસ્તવિક જીવન છે.
પણ એ ત્યારેજ હુંસલ થાય કે જ્યારે માનવ સચેત રહીને, બ્યથ
ચિંતન છોડવાને માટે થાક્યા વગર પ્રથત્નરીલ રહે એમ કરવું એજ
આત્મવિકાસની જરૂર છે.

બર્થ ચિંતનની વિરોધ જાણું ત્યારેજ થાય છે કે જ્યારે સાધક,
શાંતિ સંપાદન કરવાનો પ્રયાસ કરે છે. કોઈપણ પ્રવૃત્તિમાં લાભા રહેતા
હોઈએ ત્યા સુધી બર્થ ચિંતન ભાસતું નથી. વિશ્રાંતિને વખતેજ બર્થ
ચિંતનનો પ્રવાહ પ્રકટ થાય છે. તેમ થવાથી શાંતિનો લંગ થાય છે અને
સાધક તેમ થતું અટકાવવાનો બળપૂર્વક પ્રયત્ન કરે છે, અને છતાંથ સક્રણ

થતો નથી. વગર ધર્મિણાએ પણ જે ચિત્તન ઉત્પન્ન થાય છે તેનો નાશ ત્યારેજ થાય કે જ્યારે તેની સાથે અસહયોગ કરવામાં આવે અને તેમાંથી ચિત્તને અસરી લેવાય. અનાદર કરતાંજ, ઉત્પન્ન થયેલ વ્યર્થ ચિત્તન, નિર્જીવ થઈ જાય છે. અને તેમાંથી ચિત્તને ખેસવી લેવાથી, તેનો સમૂહોના નાશ થઈ જાય છે. પણ એ રહસ્ય એ સાધકોજ જાણવા પામે છે કે જેઓએ વિશ્રામ યા પરમશાંતિનું મહત્વ અપનાવ્યું હોય છે. પરમ શાંતિ, સર્વતોમુખી વિકાસની ભૂમિકા છે. તે કારણે તેને સુરક્ષિત રાખવાનું પરમ આવશ્યક છે. પણ તે ત્યારેજ બને કે જ્યારે વ્યર્થ ચિત્તનોનાશ થઈ જાય. વિશ્રામની ભૂમિકામાંજ આવશ્યક સામર્થ્ય પેહા થાય છે. અને વિશ્રામની સ્થિતિમાંજ, વિચાર (વિશે)નો ઉદ્દ્ય તથા (ભક્તિપાત્રના) વિરહની જગૃતિ થાય છે. એ દસ્તિએ વિશ્રામનું સંપાદન કરવાનું માનવ માત્રને માટે અત્યંત આવશ્યક છે. એ સર્વની જાણની વાત છે કે પ્રત્યેક પ્રવૃત્તિના આહિ અને અંતમાં વિશ્રામ આપોઆપ સિદ્ધ થાય છે. પણ ત્યારે આસ્થા, શ્રદ્ધા તથા વિશ્વાસ ન હોયાને કારણે વિશ્રામમાં આનંદનો ઉદ્દ્ય થતો નથી. તેનું પરિણામ એ થાય છે કે વિશ્રામકાળમાં આગળ-પાછળનું વ્યર્થ ચિત્તન થવા લાગે છે. વિશ્રામનો આનંદ સહેવ શાંતિનો યોગ સિદ્ધ કરી આપવા સમર્થ છે. એવો નિયમ છે કે જેને જેમાં પ્રિયતા ઉત્પન્ન થાય છે, તેને તેનાથી એકતા થઈ જાય છે. એ દસ્તિએ વિશ્રામ (શાંતિ)નાં વાસ્તવિક મહત્વનો સ્વીકાર કરવો એ માનવ માત્રને માટે પરમ આવશ્યક છે, અળપૂર્વક કરેલાં સાર્થક ચિત્તનથી વ્યર્થ ચિત્તન નાટ નથી થતું પણ વ્યર્થ ચિત્તનના ત્યાગમાંજ પુરુધાર્થની પરાવધિ છે. વ્યર્થ ચિત્તન થતું રહે એ સ્થિતિમાં અળપૂર્વક કરેલું સાર્થક ચિત્તન. સાધકને મિથ્યાલિમાની જનાવે છે. તે નાશનું મૂળ છે. તેથી પ્રત્યેક ભાઈ-ખણને માટે, વ્યર્થ ચિત્તનનો જલદીમાં જલદીથી અંત લાવવો એ આવશ્યક છે.

નીરસતાની ભૂમિકામાં, વ્યર્થચિત્તનની ઉત્પત્તિ થાય છે નીરસતાનો

નાશ કરવા માટે વર્ત્માન જીવન સરસ અન્યું રહે એ અતિ આવશ્યક છે. એવું ત્યારે જ સંભવે છે કે જ્યારે આવેલાં સુખદુખનો સહૃપથોળ કરાય. સુખનો સહૃપથોળ સેવા એ અને દુખનો સહૃપથોળ ત્યાગમાં છે. દુખીઓને હેણીને કર્દાખુલ થવું અને સુખીઓને હેણી હર્ષિત થવું એજ સર્વેત્કૃષ્ટ સેવા છે. શરીર આહિ પ્રાસ વસ્તુઓની મમતા અને અપ્રાસ વસ્તુઓની કામનાનો નાશ કરીને અહું અને મમ, હું અને માડું એ વૃત્તિશી સર્વાંશો સુક્તા રહેવું એજ ખરા સરકૃપે ત્યાગ છે, સેવા અને ત્યાગમાં જ, સર્વ પરિસ્થિતિઓનો સહૃપથોળ સમાપેદો છે. પરિસ્થિતિઓના સહૃપથોળથી જ સર્વ પરિસ્થિતિઓથી પર, દિવ્ય ચિન્મય નિત્ય જીવનનો થોળ થાય છે અને ઉત્કૃષ્ટ પરિસ્થિતિની પ્રાપ્તિ થાય છે. પરંતુ પરિસ્થિતિમાં જીવન બુદ્ધિનો સ્વીકાર કરવો એ તો પરિસ્થિતિઓની ગુલામીમાં ફ્રસાવા જેવું છે. તેમ થાય તો વર્ત્માન વ્યવહાર નીરસ થઈ જાય અને વ્યર્થ ચિંતન ઉત્પન્ન થાય, તે કારણે પ્રત્યેક પરિસ્થિતિ સાધનની સામગ્રી છે, જીવન નથી. સાધન દર્શિતો સર્વ પરિસ્થિતિઓ સમાન અર્થી સારે છે. તેથી જે સ્થિતિ પ્રાસ હોય તેનો સહૃપથોળ કરવો એમાં જ ભવિષ્યની ઉજાગ્રતા રહેલી છે, પવિત્ર ભાવથી લક્ષ્ય ઉંપર દર્શિ રાણીને વર્ત્માન કર્તવ્ય કર્મ કરવાં એ જરૂરનું છે. લૌટિકવાહી, વિશ્વને સંખ્યે અધ્યાત્મવાહી આત્મ લાલ માટે, આસ્તિકવાહી પ્રભુનાં કાર્યને સંખ્યે પરિસ્થિતિનો સહૃપથોળ કરી શકે. એ નિયમ છે કે જેને કાજે કાર્ય કરવામાં આવે તેની પ્રીતિશી કર્તા સંપત્ત થાય છે. પ્રીતિની જગૃતિમાં જ જીવનની પૂર્ણતા છે, પણ એ રહસ્ય તે સાધકો જ સમજ શકે છે કે જેઓએ વ્યર્થ ચિંતનનો ત્યાગ કરીને વર્ત્માનને સહૃપથોળ દ્વારા ઉજાગ્ર જનાયું છે.



ધીજ ગ્રાથના

મेરે નાથ !

આપ અપની

સુધામથી

સર્વ સમર્थ

પતિત પાવની

અહૃતુકી કૃપાસે

માનવમાત્રકો

વિવેક કા આદર

તથા

ખલકા સહૃપદોગ

કરનેકી સામર્થ્ય

પ્રદાન કરે

એવમ्

હે કરુણાસાગર

અપની અપાર કરુણાસે

શીଘ્ર

રાગ દ્રેષકા નાશ કરૈ,

સલ્લી કા જીવન

સેવા, ત્યાગ, પ્રેમસે

પરિપૂર્ણ હો જય.

ॐ આનંદ ! ઓં આનંદ ! ઓં આનંદ !!!

પ્રાર્થનાની વ્યાખ્યા.

પ્રત્યેક વ્યક્તિ, વિશ્વ શાંતિના યત્નમાં પૂરૈપૂરો ભાગ લઈ શકે, એ ઉદેશ્ય પૂર્ણ કરવા માટે, આ પ્રાર્થના રચવામાં આવી છે. એ સર્વ માન્ય હુકીકત છે કે માનવનો વિશ્વ અને વિશ્વનાય સાથે અવિભાજ્ય સંબંધ છે. શરીર અને વિશ્વ વચ્ચે લેદ પાડી શકાય નહિ અને અનંતથી તો આપણો લેદ છે જ નહિ.

બાકી રહી વિશ્વ સેવાની ચાત. બળના સહૃપદે ગથી કિયાતમક સેવા થાય છે એને વિવેકના આહરથી (વિવેક વિકસાવવાથી) બળના સહૃપદેઓનું સામર્થ્ય આવે છે, એ વાસ્તવિકતા સ્વીકારવાથી એટદું નક્કી થાય છે કે પ્રત્યેક માનવે વિશ્વશાંતિ માટે, સહભાવ પૂર્વક પ્રાર્થમા કરવી જોઈએ માનવ પ્રાર્થના કરે છે એ અનુભવ સિદ્ધ સત્ત્વ છે, જે કે જેની પ્રાર્થના થાય છે તે પ્રાર્થના કરનારમાં જ રહેલ છે અને પ્રાર્થનાની પરંપરા જ-પ્રાર્થનામયજ માનવનું અસ્તિત્વ છે. જે પ્રાર્થના વૈજ્ઞાનિક રીતે કરે તો માનવ રાગરહિત થઈ જાય, અને પ્રાર્થના અને જીવનમાં એક્ષતા થઈ જાય. પણ એ રહુસ્ય કોઈ વિરલા પુરુષો જ જાણે છે. બળનો હૃદયપ્રેરણ, અટરાગનું મૂળ છે અને એ અટરાગથી વિશ્વમાં અશાંતિ પેઢા થાય છે. તેથી જે પરસ્પરના અટરાગનો નાશ થઈ જાય અને માનવ સમાજ સહજલાભે જ, બળનો સહૃપદેણ કરવા લાગી જાય, તો સુંદર સમાજનું નિર્માણ થઈ શકે. જે કે સામ્યવસ્થા અને ધર્મ બંનેનું લક્ષ્ય, અટરાગ બંધ થાય તેવા ઉદેશ્યવાળું છે, પરંતુ. યોગ્ય માંગ અર્થાત પ્રાર્થના ન કરવાથી એ બંનેનાં લક્ષ્ય સધાતાં નથી એમ જણાય છે એ વ્યક્તિએ, વર્ગો, દેશો, વિગેરેની વચ્ચેમાં અટરાગ જ અટરાગ જેવામાં આવે છે અટરાગથી અટરાગનો નાશ થઈ શકતો નથી. ઉલ્લંઘ પરાજિત અને વિજયી બંને પક્ષો અશક્ત થઈ જાય છે, કેમ કે સંધર્ષ (અટરાગ)માં બળનો હૃદયપ્રેરણ અવશ્ય થાય છે અને તે અશક્તિ લાવવાનું મૂળ છે. બળના સહૃપદેણથી જ, આવશ્યક સામર્થ્ય પ્રાપ્ત થાય છે. એ અનંતની એ મંગળમય રચના છે.

સ્વયં પ્રામુખ્યનો સહૃપ્યોગ કરતાં જે માનવ ભાત્રને માટે બળનો સહૃપ્યોગ અને વિવેકના આદરનાં સામર્થ્યની પ્રાર્થના કરવામાં આવે તો, સંધર્થ (કલાહ, ખટરાગ, લડાઈ) નો અંત લાવી શકાય. કિયાત્મક સેવાથી ભાવાત્મક સેવા જણુવ અને સિદ્ધ રહે છે. ભાવાત્મક સેવા ભાત્ર પ્રાર્થનામાં જ થઈ શકે છે. એ હષિતે મનુષ્ય ભાત્રે પ્રાર્થના કરવી એ અનિવાર્ય છે. વાસ્તવિક પ્રાર્થના સંતોષાય છે એ સત્યમાં આસ્થા રાખવાથી, પ્રાર્થના કરનાર સાચી પ્રાર્થના કરી શકે છે. પ્રાર્થના તેની સામે જ કરી શકાય કે જે સમર્થ છે, સહાય છે, સર્વાત્મક છે, સર્વાના છે તથા અદ્વિતીય છે. અને પ્રાર્થના કરનાર તેજ થઈ શકે છે કે જે પ્રાર્થને સંખ્યા, સર્વાની સાથે એકતા હોવાની પ્રતીતિ રાખે છે. જ્યારે પ્રાર્થના કરનાર, વિશ્વની વ્યથાથી વ્યથિત બને છે ત્યારે તેનામાં પ્રાર્થના થવા લાગે છે, જેમ જેમ પર પીડાથી, માનવ પીડિત થતો જય છે, તેમ તેમ તેની પ્રાર્થના જણુવ થતી જય છે અને પછી સેવા, ત્યાગ અનેપ્રેમથી વ્યાપું બની જય છે, એ હષિતે, પોતાનાં શરણયની સહિતમાનાં જ્ઞાનથી પ્રભાવિત થઈ માનવમાત્ર બળનો સહૃપ્યોગ તથા વિવેકનો આદર કરવા લાગે, એવી ભાવના પૂર્ણ થવું એ ધાર્યું આવશ્યક છે. પ્રાર્થના દ્વારા, મનુષ્ય, હરેક પરિસ્થિતિમાં, સર્વોત્કૃપ્ય સેવા કરી શકે છે; અને ત્યાગ અને પ્રેમ પ્રામુખ્ય કરીને, કૃતકૃત્ય બની શકે છે. તેથી વાંચનાર મહાનુભાવો વિચાર કરે કે વિધિપ્રમાણેની અને વાસ્તવિક પ્રાર્થના મનુષ્ય માત્રને માટે, કેટલી આવશ્યક અને મહત્ત્વાદી ધરાવનારી છે.

જેની અહેતુકી કૃપા જીવન અને શક્તિ દેવા વાળી છે અને પવિત્ર કરવાવાળી છે, તેને જે સર્વહિતકારી સહૃભાવ પૂર્ણ થઈને, બળના સહૃપ્યોગ. વિવેકનો આદર, રાગ ઓફની નિવૃત્તિ, અને સેવા, ત્યાગ, પ્રેમની પ્રાપ્તિને માટે, યાચના કરવામાં આવે તો તે યાચના અવશ્ય સંતોષાય. જેની પ્રાર્થના કરવામાં આવે અને જે પ્રાર્થના કરતા હોય તેમાં જરાપણું મેહન રહે ત્યારેજ પ્રાર્થના સર્જણ થાય છે. એ ત્યારેજ સંલયે કે જ્યારે માનવ વિશ્વ અને વિશ્વના પ્રકાશક સાથે એકતાનો ભાવ અપ-

નાવે. એ વૈજ્ઞાનિક સત્ય છે કે જેટલી વસ્તુ સૂક્ષ્મ હોય, તેટલી તેની વ્યાપકતા વધારે હોય છે. પ્રાર્થના કરનારનું અહુમા ઘણું સૂક્ષ્મ હોય છે અને સૂક્ષ્મ હોવાથી અથાંત મોટું છે. જ્યારે પ્રાર્થી અને પ્રાર્થનામાં લેદ રહેતો નથી લારે પ્રાર્થના વ્યાપક થઈ જાય છે. અર્થાતું પ્રત્યેક માનવ વિશ્વ શાંતિના કાર્યમાં સહયોગી સિદ્ધધ થાય છે. એ કારણે વાસ્તવિક પ્રાર્થના માનવમાત્રને માટે અનિવાર્ય છે. પ્રાર્થના શ્રમસાધ્ય ઉપાય નથી. કિંતુ વ્યથિત હૃદયનો મૂક અવાજ વ્યાપક હોય છે, એ વૈજ્ઞાનિક સત્ય છે. પ્રાર્થના પ્રમાણેનું કાર્ય પણ યથા શક્તિ કરનું જોઈએ. કર્તાબ્ય નિષ્પત્ત પ્રાણીજ વાસ્તવિક પ્રાર્થી થઈ શકે. કર્તાબ્યપાલની સ્વાધીનતા મનુષ્યને જન્મથીજ પ્રાપ્ત છે. એ કારણે માનવ સમાજ કર્તાબ્ય નિષ્પત્ત થઈને પ્રાર્થના કરી શકે અને સર્કારના પ્રાપ્ત કરી શકે. એ વસ્તુ સ્થિતિ સમજુ લેવાને અને અપનાવવાને માટે, પ્રસ્તુત પ્રાર્થનાની રચના થઈ છે.

શખ્ષ તત્ત્વ, ધીન સંઘળાં તત્ત્વોથી વધારે સૂક્ષ્મ છે. તેથી પ્રાર્થનાની શખ્ષાવલીમાં ફેર કરવો નહિ. એ શખ્ષાવલીથી જે અર્થ્ય પ્રકાશિત થાય છે, તે અંતરમાં ઉતારવો, તેમાં અવિચણ આસ્થા રાખાંવી—સર્કારના અવશ્ય થવાનીજ છે.



માનવ સેવા સંઘના નિયમો

૧. આત્મ નિરીક્ષણ અર્થातું પ્રાપ્ત વિવેકના પ્રકાશથી પોતાના હોયો જોવા.
૨. ભૂતકાળની ભૂતોનું પુનરાવર્તન ન થાય તેવું વત્ત લઈ સરલ વિશ્વાસ પૂર્વક પ્રાર્થના કરવી.
૩. વિચારોનો પ્રયોગ પોતાના ઉપર, વિશ્વાસનો પ્રયોગ અન્ય ઉપર, અર્થાતું ન્યાય પોતાની ઉપર પ્રેમ તથા ક્ષમા અન્યની ઉપર.
૪. જીતેં દ્રિયતા, સેવા, ભગવતું ચિન્તન અને સત્યની શોધ દ્વારા પોતાનું નિર્માણ કરવું.
૫. ખીજાઓનાં કર્તાબ્યો ઉપર આપણો અધિકાર છે, ખીજાઓની ઉદ્દારતા આપણા શુણું પરિણામ છે, અને ખીજાઓની નિર્ભળતા એ આપણું પણ છે તેમ માની ન કેવું.
૬. કૌટુંભિક તથા જાતીય સંખ્યન હોવા છતાં પણ કૌટુંભની ભાવનાથી પરહસ્પર સંઝોધન તથા વ્યવહાર.
૭. આજુભાજુના જન સમાજનો યથાશક્તિ કિયાતમણ રૂપે સેવા કરવી.
૮. શરીર સ્વાસ્થ્ય માટે આડાર વ્યવહારમાં સંયમ તથા દરરોજનાં પોતાનાં કાર્યમાં સ્વાવહિંણી થવું.
૯. શરીર ખડતલ, મન સંયમી, હૃહય અનુશાગી, બુદ્ધિ વિવેકવાળી, આહંક અલિમાનશૂન્ય કરી પોતાની જતને સુન્દર જનાવવી.
૧૦. નગદ નાણાથી વસ્તુ, વસ્તુથી બદ્ધિ, બદ્ધિથી વિવેક અને વિવેકથી પણ સત્યને અધિક મહત્વ આપવું.
૧૧. વ્યર્થ ચિન્તનનો ત્યાગ કરી અને વર્તમાનના સહુઉપયોગ દ્વારા અવિષ્યને ઉદ્ભૂત જનાવવું.

